


મેતાના અનોખા આવિન્દુવક 426

થન્ડાચાર્ય

શ્રી બેણોપિષ્ઠાધ

સુદર્માસુમારા
દાદાસાહેબ, લાયજાન
ફોન : ૦૭૯-૨૪૩૪૩૬૫
૪૨૮૪

૩૦૦૧૨૬



પ્રેરક - પૂ. ગાયો શ્રી જિતયન્દુ સાગરજીમ.

Shree Sudharman Swami Gyanbandar-Umara, Swetumaragyanbandar.com

લેખક

૫૨૪૪

‘જયપદ્મ’ પ્રકાશન-પુણી લુ.

ગુજરાતની અસ્તિત્વતાના
અનોખા આવિસ્તારક

હેમચન્દ્રાચાર્ય

: પ્રેરકો :

પૂ. અણ્ણિવાર્ય શ્રી જિનચન્દ્રસાગરજી મ.
પૂ. મુનિવાર્ય શ્રી જયચન્દ્રવિજયજી મ.

વેખક :

પંડિત શ્રી ધનજય જો. જૈન ‘પ્રેમકેતુ’

પ્રકાશક :

‘જયપદ્મ’ પ્રકાશન
કાંદિવલી (ઇસ્ટ). સુંખદ-૪૦૦૧૦૧

પ્રકાશક :

‘જયપદ્મ’ પ્રકાશન

સંચાલિકા : સૌ. જ્યોતિ ડી. જૈન
સી-૧૦, અરિહંત સોસાયટી,
જથ્થા માળે. દામોદરવાડીની સામે,
ચક્કવતી અશોક રોડ,
કાંદિવલી (ઈ.) સુંખદ-૪૦૦૧૦૧.

પ્રથમાવૃત્તિ : પ્રત-૨૦૦૦

પોષ દસમી. સં. ૨૦૪૬
તા. ૨૨-૧૨-૧૯૮૬.

મૂલ્ય : દસ રૂપિયા

સુદ્રક :

ભાવના ગ્રિન્ટરી.
કંપોઝિનગર પાસે,
મહેસાણી-૩૮૪૦૦૨

ટાઇટલ : હેમાંગ ગ્રિન્ટર્સ, સુંખદ



પ્ર. સ્વ. સાધ્વીશ્રી
પદ્મયશાશ્વત મહારાજ

જીયપદ્મ' પ્રકાશનનો પુષ્ટ્ય મારંલ

પુ. જિનશાસનપ્રભાવનાપરાયણુ, પ્રખર પ્રવચનકાર,
પંચાસપ્રવર શ્રી ગુરુદેવ શ્રીચંદ્રશોભરવિજ્યજી
મહારાજના સુવિનીત શિષ્યરત્ન અને મારા અનંતો-
પકારી, પરમ હિતવત્તસલ, પરમ સંયમમૂર્તિ, મારા
સાંસારિક પિતાજી, ગુરુદેવ સુનિરાજ શ્રી જીય-
ચન્દ્ર વિજ્યજી મહારાજની પ્રવત્તમાન સુંદર
સંયમળુવનની અનુમોદનાથે—

તથા

પુ. વર્ધમાન-તપોવારિધિ, સહજ સુંદર ક્ષમામૂર્તિ,
સાધ્વીશ્રી જિનેન્દ્રાશ્રીજી મહારાજ સા. ના
સુવિનીત શિષ્યા અને મારા અનંતોપકારી, ૨૨
વર્ષની નિર્મણ સંયમળુવનની સાધના સાધીને,
તેની જ ફલશ્રુતિ રૂપે વાંછનીય સુંદર સમાધિમૃત્યુને
સાધી જનારા-મારા માતુશ્રી સાધીશ્રી
પદ્મધરશાશ્રીજી મહારાજની
પુનિત સ્મૃતિ નિર્મિતે આરંલ થાય છે
આ 'જીયપદ્મ' પ્રકાશનનો !

તેનું આ છે પ્રથમ પુષ્પ :
‘ગુજરાતની અસ્તિમતાના
અનોખા આવિભીષણ
હેમચન્દ્રાચાર્ય’

આપના કરકમલમાં મૂકૃતાં અમે
અતિ આનંદ અનુભવીએ છીએ.

— ધ્યાન-જીય જૈ. જૈન

＊ સમર્પણ＊

જેમણે

મારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક
જીવન-ઘડતરમાં અપૂર્વ કરણો આપ્યો છે,
મને

જેમની કૃપાએ બનાવ્યો છે;
શ્રી જિનશાસનનો અનન્ય રાગી;
તે....

પરમ સંયમમૂર્તિ અને પરમ ત્યાગી
સ્વ. પૂ. ભાતા-સાઈવી પ્રદીપયશાશ્રીજી
[પૂ. તપોવારિધિ સાધ્વીરતનશ્રી જિનેન્દ્રશ્રીજી
મહારાજના કૃપાપાત્ર શિષ્યા]

મહારાજને....

— સ્લેષક ધૂનંધૂન

સા. શ્રી પદ્મયશાશ્રીનું જીવન ચોંગી જેવું !

— પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણ્ણીબર

[સ્વ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી અફલુત સમાધિ-મરણને પામ્યા બાદ, તેમના ગુરુણીજી પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ને ઉદ્દેશીને પૂ. પં. શ્રી ચન્દ્રશેખર-વિજયજી મહારાજે લખેલા પત્રનું અક્ષરશઃ અવતરણ....]

મહા સુદ ૧૪, સુરત.

સાધવી શ્રી જિનેન્દ્રશ્રીજી !

ચન્દ્રશેખર વિ. ના. અનુવંધનાઈ.

પદ્મયશાશ્રી ખૂબ જી ઉત્તામ કક્ષાની સમાધિ સાથે વિદાય થયાના સમાચાર જાણુતાં એ વિચાર આવ્યો કે, તમારી બધી મહેનતનું પરિણામ તમને મળ્યું. તમે એમને સમાધિ આપી શક્યા.

કોઈ શિષ્યા પણ ન કરે એવી સેવા તમે તમારી શિષ્યાની-તેના ગુરુ હોવા છતાં-કરી. કમાલ કરી છે તમે ! આવી ઉત્કૃષ્ટ વૈયાવરચ્ચ કરવા બદલ તમને

આંતરના ય અંતરથી ઉમળકાલયો આશિષ પાડવું
જું. તમારા સંયમી જીવનનું તમે આ ઉત્કૃષ્ટતમ
સુકૃત આરાધી લીધું છે. કહાચ વર્ધમાન તપની
સો ઓળીનું સુકૃત પણ, આ સુકૃતની તોલે નહિ
આવી શકે.

હવે નવી જવાબદારી-એ શિષ્યાની-માથે
આવી રહી છે. તમે તેમાંથી પાર ઉત્તરશો તેવો મને
વિદ્યાસ છે.

પદ્ધયશાશ્વીના પ્રત્યેક શાળા યાદ આવે છે. ખૂબ
ઉત્તમ ડેટિનો, લઘુકમી, જિનશાસનનો અવ્વલ
લક્તા-તેમનો આત્મા ગણી શકાય. વ્યવહારથી તેમણે
લલે ધણું ન સાધ્યું જણ્ણાતું હોય, પણ નિશ્ચયથી
એ આત્માએ પૂરું સાધી લીધું. એ આત્માના
છેલ્લા મહિનાઓના ઉદ્ગારો-જીવનમાંથી વિદ્યાય
બેતાં કોઈ ચોંગીના જેવા હતા.

ખૂબ પ્રસન્નતાપૂર્વક આગળ વધો એ જ
અભિલાષા.

—શ્રી. વિ.

॥ श्री शंखेश्वर-पाश्वनाथाय नमः ॥

श्री हेमचन्द्राचार्यांनी ज्ञवनकथा !
गातां हुरीचे निज-भवव्यथा !!

[लेखकीय]

कविशिरोभणि श्री हेमचन्द्राचार्ये 'कवि' अने 'प्रतिला' ना लक्षणे। 'काव्यानुशासन' नामना स्वरचित अन्थमां नीचेन। श्वेतोङ्करा धारा ओળाभाव्या छे.

"प्रज्ञा नवनवोल्लेख-शालिनी प्रतिभा मता ।

तदनुप्राणनाजीवद्-वर्णनानिपुणः कविः ॥"

अर्थात् "नवा नवा उ-भेषो (कैपनाच्चो)थी शालिनी (शोलती-अणहणती) प्रज्ञानुं ज नाम छे 'प्रतिला'; अने एवी प्रतिलाथी अनुप्राणित वण्णनामां ने निपुण छाय; ते छे 'कवि'."

आवी प्रतिलाना नित्य-नवां रमणीय गुदाओ जेमना भुद्धि-सरोवरमां सदा भीवेलां रहेतां अने जेमनी भात्र काव्य प्रतिला ज नहि, ज्ञान-विज्ञाना सर्व क्षेत्रो विषेनी प्रतिला रम्य अने लब्ध छती तेवा, 'कलिकालसर्वज्ञ' शण्ठथी सर्वोत्तम सन्मानने वरेला सूरिहेवश्री हेमचन्द्राचार्य विषे, तेमनी हमण्णां ज पूछु 'थयेली नवसोभी ज-म ज्यांतिना वर्षमां केटलांक विक्षान अने विचक्षण लेखकोच्चो सुन्दर लभ्युं छे. अने छतां हेमचन्द्राचार्यांना अलौकिक अने सर्वज्ञ-आदरणीय ज्ञवन अने कवन विषे हजु पण्णु धण्णु 'भधु' लभी के कही शकाय तेम छे.

આ પુસ્તિકામાં સર્વજનચાહ્ય અને તે રીતે, સરળ અને સુચારુ શૈલી કારા હેમચ-દ્રાચાર્ય જીની જીવન-કથાને, મહત્વના પ્રસંગો કે ઘટનાઓને સાંકળી વૈવાપુવ્યક્ત લખવાનો પ્રયાસ કરાયો છે.

સફળાણી પુરુષ પ્રત્યેની અંતરંગ લક્ષ્ણ એ જ જેનું સુદૂર છે તેવા, આ આદેખનની પ્રેરણાતું શ્રેય છે : ભારા અનંત ઉપકારી, પિતા-ગુરુહેવ પુજનીય-વંદનીય, સાધુપ્રવર સુનિરાજ શ્રી જયચ-દ્રવિજયજી મહારાજને ! તેઓશ્રીની ખાસ પ્રેરણાથી જ હું આ જીવનકથાને આદેખી શક્યો છું. વંદન તે ઉપકારમૂર્તિને !

હેમચ-દ્રાચાર્યજીના તેજસ્વી અહિરંગ વ્યક્તિત્વ વિષે અને ઓજસ્વી અંતરંગ અસ્તિત્વ વિષે આછેરી અલાક તો તેમની આ જીવનપરિયયની પુસ્તિકા કારા જ પમાણે. તેથી તે અંગે અહીં વિશેષ કશ્યું કથવું નથી.

અહીં તો હું માત્ર કૃતજ્ઞતાનું જ પ્રગટીકરણ કરીશ. આ પુસ્તિકાના આદેખનમાં મુખ્યત્વે મેં આઠલા ગ્રન્થો આધારરૂપે નજર સમક્ષ રાખ્યા હતા. (૧) પુ. પંન્યાસપ્રવર ગુરુહેવ શ્રી ચન્દ્ર-શોખરવિજયજી મહારાજ-લિખિત અણાહિકા-પ્રત. (૨) ધૂમકેતુ લિખિત - ‘હેમચ-દ્રાચાર્ય’ (૩) પ્રો. રમણુલાલ ચી. શાહ લિખિત-‘કલિ-કાલ-સર્વજ્ઞ હેમચ-દ્રાચાર્ય’ અને (૪) ‘પરબ્ર’ માસિકનો ‘હેમચ-દ્રાચાર્ય-વિશેષાંક’ : (નવે. ડિસે.-

૧૯૮૮) આ સિવાય, છેદ્દે આપેલા ‘આચાર્યશ્રીને અભેણીએની અંજલિ’ એ અવતરણો તથા ‘હૈમી-વાણી’—પુ. પં. શ્રી શ્રીલિંગન્દ્ર વિજયજી ગણ્યિવર સંપાદિત ‘હૈમસ્વાધ્યાય—પોથી’ માંથી લીધા છે. આ સહૃદ્દુ પ્રત્યે, અંતરના આદર સાથે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

ઉપરાંત, આ પુસ્તિકા માટે સુનદર ‘પ્રસ્તાવના’ લખી આપનાર પૂ. વિદ્યક્યું, અને સનેહાળ કલ્યાણ-મિત્ર ગણ્યિવર્યશ્રી હૈમયન્દ્રસાગરજી મહારાજને પણ મારી સરનેહ વંદના સાદર કરું છું.

ચાલો ત્યારે....હવે બાંચીએ....‘ગુજરાતની અસ્તિત્વાના અનોખા આવિલોવક હૈમયન્દ્રાચાર્ય’ની બા જીવનક્થા ! અને ગુજરાતનોના ગુણ ગાવતાં, હરીએ આપણી ભવન્યથા !!

— ધ્રુણંજય જો. જૈન

॥ નમો અરિહંતાષ્ટુમ् ॥

પ્રસ્તાવના

સ ભય-સરિતાના નવ નવ સૈકાચોની સામે પાર
જિલેલી એ વિભૂતિ ! કેવી મનમોહક જણ્ણાઈ રહી છે.

સપ્રમાણુ એ દેહયણિ વિરાટની ઓળખ આપી
રહી છે. એ દેહ ઓહારિક-આણુઓથી નહીં, જાણુ
જાનના જ આણુ-પરમાણુઓથી ગોઠવાયેલો નથી
લાગતો શું ?

સૂર્યશું એ મુખમંડળ અળહળતી આલા વેરી
રહ્યું છે. મસ્તક ઉપર રહેલા સફેદ છતાં ચ ગીય
કેશના ઝુલ્ધા હવાની લહેરથી આમ-તેમ થતાં
હેખાય છે. જાણુ મસ્તિષ્કમાં ભરેલી બુદ્ધિના વલોણુ-
માંથી નીકળેલું માખણુ જિલરાતું ન હોય !

ચમકતાં એ નયન-કચોળાંમાંથી કેવી તેજસ્વી
કિરણુાવલી વધુટી રહી છે ! દાઢી-મૂછની સફેદાઈ
વરચે પરવાળા-શા રંગીલા હોડો લેગા-ધૂટા થઈ
રહ્યાં છે ને એમાંથી વરસતાં શ્રોદ્ધ-સુમનો સમય-
સરિતાની સાથે વહેતાં વહેતાં આજ્ઞેય અહીં
સુવાસ રેલાવી રહ્યાં છે.

સુલક્ષણું કણ્ણ-સુગલ અને આજનખાહુની જોડી,
ને વળી દેહ પર વીંટાયેલું ધવલ-પરિધાન પવનની
પીઠ પર અસવાર બન્સું છે.

કેવો પડછંદ અને પ્રકાશમાન એ દેહ છે ?

‘કાણુ છે એ ?’ એમ સવાલ પૂછો છો ! રે !

૨૫૦૮ તો હેખાય છે. નથી આંખ ઉપર હાથની છાજલી બનાવવાની જરૂર, કે નથી ટેલિસ્કોપ કે બાયનોક્યુલરના ફૂરણીન લગાવવાની જરૂરત ! એ ૨૫૦૮—સુર્સ્પ્રોટ પ્રતિમા છે કલિકાલ—સર્વ્ઝ શ્રી હેમચયન્દ્રસૂરીશ્વરજી મહારાજ !

સમયની ફૂર-સુફૂરવતીં ધરતી પર એ જિલેલા છતાં આજે ય ચોખખા-ચટ જણ્ણાઈ રહ્યા છે.

વચમાં એવી એકેય ટેકરી નથી જિલી કે જે એ અસ્તિત્વની આડશ જિલી કરી શકે ! નથી એવા ધૂમસના ધૂંધલા પણ્ણા બાંધચા જે એ અસ્તિત્વને ઓઝલ બનાવી શકે કે, નથી એવા આડ-અંખરા જામ્યા જેની જાળ-જાળ એ લુષંત જયેાતિના પ્રકાશને આવરી શકે !

નવ-નવ સૈકાથી જેના લુષનતું અમર ગાન ધરતીના આ માનવો ગાતાં થાકતાં નથી.... એ વિરલ-વ્યક્તિત્વના સ્વામી કલિકાલ સર્વ્ઝ શ્રી હેમચયન્દ્રાચાર્ય લગવંતના લુષન-કવન ઉપર અનેક ચરિત્ર-અંથો પ્રકાશિત થયાં છે, થતાં રહે છે. એમાંને જ આ એક અહેનો પ્રયાસ છે.

સ્નેહી પંડિત શ્રી ખન-જયભાઈની કલમ સાચે જ કમનીય કલમ છે.... શૈલી એવી પ્રાસાદિક અને પ્રાવાહિક છે કે એમના લેખન પર વાચક અનાયાસ જ તથ્બાતો રહે છે.... હા; નહીમાં જેમ લાકડું તથ્બાય ને, તેમ જ િ !

નાની—શી આ પુસ્તિકામાં કલિકાલ-સર્વેજ શ્રી
હેમચન્દ્રાચાર્ય લગવંતના મોટા લાગના મુખ્ય મુખ્ય
પ્રસંગો-ધટનાએ આવરી લીધા છે.....

નાનાથી માંડીને મોટેરાં સુધીનાં સહુ જને માટે
એક-સરખું આકર્ષણું જન્માવનારું આ પ્રકાશન
બહુકૃલદાયી નીવડશે એમાં વિસંવાદને અવકાશ
નથી.

નવમી શતાબ્દીના છેડે નજર નાંખતું નવલું આ
નજરાણું પૂજયશ્રી પ્રતિ કૃતજ્ઞલાવતું પ્રતીક બની
રહેશે એ જ ઉમહા આશા.

મૌન એકાદશી,
સં. ૨૦૪૬

ગાણી હેમચન્દ્રસાગર
કૈલાસનગર, સુરત.

આ નુંકુમ

પ્રકરણ	પૃષ્ઠ
[૧] આંસુ....ખદલે છે ઈતિહાસનું પાસું	૧/૬
[૨] ચંગદેવમાંથી સોમચન્દ્ર	૭/૧૮
[૩] આચાર્યપદનો અલિષેક	૧૬/૨૪
[૪] સિદ્ધરાજ અને સૂરિદેવ	૨૫/૩૪
[૫] સમદર્શીં અને સમયુદ્ધ સૂરિસમાટ	૩૫/૪૬
[૬] રાજ કુમારપાળને પ્રતિષેધ	૫૦/૬૫
[૭] 'પતિત'માંથી પરમાર્થાંતુ	૬૬/૭૬
[૮] નાતાના ઉત્તુંગ શિખર પર	૭૭/૮૩
[૯] સુવિશાલ સાહિત્યના સર્જક	૮૪/૬૫
[૧૦] સુક્ષ્મિયાત્રા પ્રતિ મંગલ-પ્રયાણ	૯૬/૧૦૦
[૧૧] આચાર્યશ્રીને અશ્રણીઓની અંજલિ	૧૦૧/૧૦૫

આ પુસ્તકના પ્રાપ્તિસ્થાનો।

[૧] ધનંજ્ય જે, જૈન.

સી-૧૦, અરિહંત સોાસા., ૪ થા માળે
દામોદરવાડી સામે, ચક્રવર્તી અશોક રોડ,
કંદિવલી (ધરણ) Bombay-400101

[૨] કીતિ પ્રકારણ.

C/O. ધર્મેશ આર. અવેરી
૧૦/૧૨૭૦, હાથીવાલા દેરાસર સામે, ગોપીપુરા.
સુરત. (દ. ગુજરાત)

[૩] ઉપા. શ્રી યશોવિજયજી સંસ્કાર સદન

સંચાલક : પ્રમોદ આર. મહેતા.

C/O. કલાપ્રકાશ, ટીલક રોડ,
માલેગામ. (M.S.) PIN-423203

[૪] ઉપા. શ્રી યશોવિજયજી સંસ્કાર-સદન

સંચાલક : બી. સી. શાહ

ફે. જૈન વિઘાલય, કે. જી. હોસ્પિટલ પાસે,
નવસારી. (દ. ગુ.) PIN-396445.

[૫] શ્રી યશોવિજયજી જૈન સેવાસદન

C/O. એસ. એમ. શાહ, 'વિમલકુંજ',
શ્રીમાળીવાગા, ડાલોધ. (શ.) PIN-391110.

આ પુસ્તકના પ્રામિસ્થાનો।

[૬] આગમોદ્વારક પ્રતિષ્ઠાન.

બિપીનચન્દ્ર એસ. શાહ. વાણીયાવાડ
છાણી (જિ. વડોદરા) (ગુજરાત)

[૭] વસ્તુપાળ જે. જૈન.

૫૦, વધ્યમાન ફ્લેટ્સ.
પાલડી, સરખેજ રોડ
જૈન મર્ચન્ટ સો. ની સામે.
અમદાવાદ—૩૮૦૦૦૭

[૮] વિનોદ બી. શાહ

નેમુલાઈની વાડીના ઉપાશ્રય સામે.
ગોપીપુરા—સુરત (દ. ગુ.)

: વિશેષ શુદ્ધિ :

પેજ નં. ૬૪—સૌથી છેદ્દી લીટી
'તવાગ્રતોઽભ્યર્થ્યે' ના ખદ્દે
'સ્વામિન् યદભ્યર્થ્યે' આ પાઠ
શુદ્ધ જાણવો.

— લેખક.

સુકૃતના સહભાગીઓ !

૧૫૦૧] પૂ. પરમ સંયમમૂર્તિં, ઉત્તમ સમાધિમૃત્યુને
વરીને સંયમનું સાકૃત્ય વરનારા રવ.
સા. શ્રી પદ્મયરણાશ્રીજી મ. ની પુષ્ટય-
સ્મૃતિ નિમિત્તે....તેઓશ્રીના ગુરુખીજી પૂ.
સહજ-સુનદર-ક્ષમામૂર્તિં, વર્ધમાન તપો-
વારિધિ, સા. શ્રી જિનેન્દ્રાંજાલી મ. ની
ગ્રેરખુથી....ગુરુલક્ષ્મો તરફથી આગોતરા
આહકૃપે....!

૧૦૦૧] શ્રીમતી શારદાખેન નવનીતલાલ શાહ
તરફથી લેટ !

૧૦૦૧] શ્રીમતી ગીતાખેન શ્રેયસકુમાર દોશી
તરફથી લેટ !

૨૫૧] શ્રીમતી કુચુમખેન શાંતિલાલ ઝવેરી
તરફથી લેટ !

સુકૃતના આ સહલાગીઓને અંતરના અભિ-
નનદન !

— સુદર્માસુદર.

[૧]

આંસુ....

બદલે છે ઈતિહાસનું પાસું !

હેમચન્દ્રાચાર્યનું શોશવ રૂપ : ચાંગો

અહિંસાની સંસ્કૃતિથી શોભતો ગૂજર નામે
દેશ છે. રૂડી અને રળિયામળી ધંધુકા નામે નગરી
છે. તેમાં ધર્મજનોમાં અગ્રેસર એક શેડ વસે. નામ
તેનું આચ.

ચાચની ધર્મપત્નીનું નામ પાહિણીદ્વારા ! નખ-
શિખ સહાચાર અને સત્પ્રેમની જણે પ્રતિમા !
શ્રદ્ધા અને સંસ્કારની જણે કલકલ વહેતી સરિતા !

ચાચ અને પાહિણીના ધરમાં એક કુળજીપકનો
જરૂર થયો. વિકમની અગિયારસો. પિસ્તાળીશની
૧

એ સાલ અને કાર્તિક પૂર્ણિમાનો એ દિવસ. આ શુલ દિવસે પાહિણીએ એટ પાવન પુત્રને જન્મ આપ્યો. ■

પુત્રમના ચાંદ સમાન સમુજ્જવળ, ધવલ અને કાંતિમાન એ બાળનો હેહ હતો. જેના જાજરમાન વ્યકૃતિત્વથી શુજરાતની ધરતી અહિંસાની સંસ્કૃતિથી સભર બની અને જેના જ્ઞાનના આલોકે જૈનધર્મનો સાહિત્યબાગ સેંકડો સાહિત્યક કૃતિએ ઇપી શુલાષાથી મહોરી ઉઠ્યો, તે કલિકાલ સર્વજ હેમચન્દ્રાચાર્યના એ શ્રીશવ-રૂપને સંસારે “ચાંગો” નામ આપ્યું હતું.

પાહિણી ચામુંડ ગોત્રના હતા, એટલે બાળકનું નામ ‘ચ’ અક્ષરથી પાડવાનું માતા-પિતાએ વિચાર્યું. વળી બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો, ત્યારે માતાને (ચાંગ) સુંદર સ્વર્ણે આવતા, શુલ વિચારો જગૃત થતા, અને....કાર્તિકી પૂર્ણિમા એટલે કે હેવદિવાળી જેવા ચાંગ (સારા) દિવસે બાળકનો જન્મ થયો....આ બધા કારણોસર માતા-

■ ચાંગહેવ (હેમચન્દ્રાચાર્ય)નો નાનો લાઇ ‘કહાનજી’ નામનો હતો. તે ઉલ્લેખ ‘ચતુરશિ-તિપ્રથંધ’માં છે. અને ‘નેમિનાથ’ નામના તેમના મામા હતા, જે ‘શ્રાવક’ હતા. તે ઉલ્લેખ ‘પ્રથંધકોશ’માં છે.

પિતાએ પોતાના કુટુમ્બખીજનો સમક્ષ પુત્રનું ‘ચાંગો’
ઉછે ‘ચાંગહેવ’ નામાલિધાન કર્યો.



આચાર્યના આંસુ....ખદલે ધતિહાસનું પાસું

ચાંગાના જન્મ પહેલાં, આચાર્યશ્રી હેવચન્દ્ર-
સૂરીશરળના જીવનમાં બનેલી એક ઘટના તરફ
દર્શિયાત કરીએ.

તે સમયે સનાતન ધર્માચ્છૈના જૈન ધર્મ અને
ઓદ્ધ ધર્મ ઉપર જોરદાર શાખિદ્ક હુમલાએ ચાલી
રહ્યા હતા. શાંકરાચાર્યે જૈનધર્મ સામે જોહાદ જગાવી
હતી. જૈનાને ‘નાસ્તિક’, ‘ધર્મદ્રોહી’, ‘ધર્શરવિરોધી’
વગેરે કહેવા કારા હલકા ચિતરાઈ રહ્યા હતા.

મહાન જૈનાચાર્ય શ્રી હેવચન્દ્રસૂરીશરળ મહા-
રાજ શાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાતા અને સમર્થ સાહિત્ય-
કાર હતા. જ્યોતિષ, સામુદ્રિક લક્ષણ વગેરે વિદ્યા-
એના પણ વિક્ષિપન હતા. ‘શાંતિનાથ ચરિત્ર’ વગેરે
અન્યોની રચના તેમણે કરી હતી. એક પ્રભર અને
પ્રતાપી જૈનાચાર્ય તરીકે તેમની કીર્તિ ત્યારે ફેલા-
ચેલી હતી. ઉદ્યન મન્ત્રોશર જેવા રાજપુરુષો પણ
તેમનો ઉપદેશ સાંભળતા અને તેમનું માર્ગદર્શન
સ્વીકારતા હતા.

આમ છતાં....સનાતનીએનો સફળ પ્રતિકાર
કરવામાં જ્યારે આચાર્યશ્રી હેવચન્દ્રસૂરીશરળ

કામિયાબ ન બની શક્યા ત્યારે, એક રાતે તેઓ ઐચેન બની ગયા. તેમનું હૃદય ઉંખ અનુભવવા લાગ્યું.

એએશ્રીની મનોવ્યથાના આ રહ્યા તે સંસ્કૃત-ભાષાના શબ્દો :

“પાદનિપ્ત-વણભટ્ટિ-વજ્રાર્ય-ખપુટાદયઃ પ્રભાવ-કાઃ પુરાઽભવન् સૂરયો દૂરિતાસ્યાઃ (?) આચાર્યઃ વહવ્રઃ સન્તિ ઇદાનીમસ્મદાદયઃ । ન તેષુ તાવશઃ કોડપિ શાસનોન્તતિકારકઃ । ઉપદ્રવન્ત્યહો જૈનાન્ ભૂણં મિથ્યાદ્વશોઽધ્વના । ધિગસ્માન् અશ્મસંકાશાન્, યેષુ તેષુ સમત્સરાઃ ॥”

અર્થ : “પાદનિપ્તસૂરિ, ખપુટસૂરિ, વજ્રસ્વામી, ખપુટસૂરિ, વગેરે અનેક પ્રભાવક-પુરુષો પહેલાં થઈ ગયા. અત્યારે અમારા જેવા આચાર્યો તેં ઘણ્યા છે. પરંતુ તેમાં કોઈ શાસનની મહાન ઉન્તિ કરનારો હેખાતો નથી. અત્યારે મિથ્યાદ્વિષિયો (વિધમીંએ) જેનેને હેરાન-પરેશાન કરી રહ્યા છે ત્યારે, જેને ન તેને વિષે હજ્યાળું એવા પથ્થર જેવા અમેને ધિક્કાર થાએઓ.”

આ મનોવેદનામાંથી એમની આંખોમાં આંસુધસી આવ્યા. શ્રી જિનશાસનની જિંડી દાજ અને શાસનરાગની ઉત્કટ આગમાંથી પ્રગટેલાં એ જિનાં જિંનાં આંસુએ શાસનદેવીને નીચે ધરતી પર એંચી

લાવ્યા. સુરિજીએ પોતાની મનોવેદનાં વાણી ક્ષારા શાસનહેવી સમક્ષ વ્યક્ત કરી. ત્યારે, શાસનહેવીએ કહ્યું : “આપ નિશ્ચિંત બની જાએ અને ધંધુકા તરફ પ્રયાણ કરો. ત્યાં આપને એક તેજસ્વી બાળની પ્રાપ્તિ થશે. ‘ચાચ’ નામના મોઢ લખુકના તે ‘ચાંગા’ નામના બાળકને તમે દીક્ષા આપજો. જીનશાસનના આકાશમાં તે અપૂર્વ સૂરજની જેમ ચમકશે અને તમારી સમય ચિંતાએને તે ફૂર કરશે.”

આમ....કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના પ્રાગટ્યનું કારણ બન્યું....

હેવચંદ્રસૂરીજીના આંખના આંસુ !
જેણે બદલી નાંખ્યું
જૈન શાસનના ઈતિહાસનું પાસું !!
હવે....જીવનકથાના એ ઘટનાકુમમાં આગળ વધીએ....



પાહિણીનું ઉત્તમ સ્વર્ણ :

ચાંગાના જન્મ પહેલાં, આચાર્ય શ્રી હેવચંદ્રસૂરીધરજી જેવા પરમશ્રુત વિક્રાન-પુરુષ પાસે આવીને પાહિણીએ, ગુરુવંદના કરીને એક દિવસ એક વાત કરી હતી : “ભગવાન ! મેં એક સ્વર્ણ જેયું હતું, મેં એક અતિ ઉત્તમ અને અદ્ભુત

ચિંતામણીરત્ન આપને સમર્પિત કર્યું ! પ્રલો !
મને આ સ્વરૂપનું કૃળ-કથન કરશો ?”

ક્ષણુભર ગુરુ દેવચન્દ્રસૂરિજી વિચારમાં પડી
ગયા... તે ક્ષણે તેમને શાસનહેવીએ ભાઘેલી લવિષ્ય-
વાણીનું સમરણ થયું. સ્વયં તો ખડુશ્રુત હતા જ.
તેમની જ્ઞાનદાટિ લાવિના લેખને ઉકેલી રહી :
“પાહિણી ! તું ચિંતામણીરત્નની પ્રસૂતા બનીશ.
તારું તે પુત્રરત્ન સંસારને ઉનાળશે. તારો તે પુત્ર
તું અમને અર્પણું કરજો. વીતરાગના શાસનનો
પ્રકાશ સર્વત્ર ફેલાવનાર તે જિનશાસનનો સૂરજ
બનશો. અપૂર્વ જ્ઞાન-વિજ્ઞાનનો તે મહાસાગર બનશો.”

પાહિણી ગુરુ-કથન સાંલળીને અતિ પુલકિત
બની ગઈ. વિનત-નયનોએ તેણું ગુરુવાણીનો સ્વી-
કાર કર્યો.



[२]

‘ચંગાહેવ’ માંથી ‘સોમચંદ્ર’

વષેં બાદ....ચાંગાનો જન્મ થયો અને તે માતાની આંગળી પકડીને ચાલતો થયો. ત્યારે....ખાળ ચંગાહેવને લઈને પાહિણી ગુરુશ્રી હેવચંદ્રસૂરીધરજીને વંદના કરવા આવી.

તે સમયે એક ઘટના ઘટી.

આચાર્ય ગુરુહેવ તેમના આસને ન હતા. આસન ખાલી પડયું હતું. ત્યારે....અચાનક ખાળ ચાંગો, માતાની નજર ચૂકવીને ગુરુહેવના આસન ઉપર બેસી ગયો. માતા પાહિણીહેવી જ્યારે ખાજુના ખંડમાં બિરાજમાન ગુરુહેવને વંદન કરીને ખણાર આવી ત્યારે પળલર તેની વિહુળ નજર ચંગાહેવને શોધવા આકુળયાકુળ બની ગઈ. પોતાનો ચાંગો અટ નજરે ન પડતાં ક્ષાણુલર વત્સલા-માતાનું છુદ્ય

ઘૂંજુ બોઠયું : એણે સાદ હીથો : “એટા ચાંગા ! તું કયાં ગયો ?” અને ત્યાં જ પાહિણીની નજર ચાંગા પર પડી. નાનકડો ચંગહેવ, ગુરુહેવની પાટ ઉપર કોઈ યોગીપુરુષની અનોખી છટાથી બેઠેલો હેખાયો.

માતા વ્યચ્ચ બની ગઈ. એ હોડી... અને બાળ ચંગહેવને ઉઠાડતી બોલી : “એટા ! ત્યાં આપણાથી ન એસાય. એ તો ગુરુહેવનું આસન છે.” ત્યાં તો પાછળથી એક વત્સલ-વાળી ઉપાશ્રયમાં ગૂંજુ બોઠી :

ચંગહેવ માટે ગુરુની માંગણી :

“પાહિણી ! એ બાળ ભલે બેઠો ! એ બાળ કોઈ સામાન્ય બાળ નથી; એ તો લાવિનો જિન-શાસનનો રખેવાળ છે. વિધાતાનું એ વિરલ સર્જન છે. યાદ કર ! તે દિવસે તને આવેલા સ્વર્ણને ! એ સ્વર્ણમાં તે મને અર્પણું કરેલું અફલુત ચિંતા-મણીરતન તે આ જ બાળક છે.

નિસર્ગની મહાયોજના પ્રમાણે આ બાળક આ જીવન દરમ્યાન સુધર્મા ગણુધરની પાટને ઉનળશે-અજવાળશે. આ ચંગહેવ કોઈ ચણ્ણા-મમરા વેચ-નારી કરિયાણુંની ફુકાનનો માલિક થવા સર્જન્યે। નથી. કોઈ મેલો મુત્સદી રાજકારણી કે સંસારના લોગો લોગવનારે। વિલાસી લખપતિ થવા નથી સર્જન્યે।

એ તો બનશે.... ધર્મનો ધારણુહાર !

સમાજનો તારણુહાર !!

હેશ અને હુનિયા માટે હીવાદાંડી સમે આધાર !!

એક પ્રતાપી દિવાકર !

જે બનશે વિશ્વના લાખો હુઃખી લોકોના અંધકાર—
—મય જીવનપથને ઉજળનાર !!!

જિનશાસનના મરટક-મુગુર પર એ મણિસમ સોહશે.
માટે જ.... આને આ બાળરતને હું તારી પાસે,
પ્રત્યક્ષપણે ચાચું છું. પેલા સ્વર્ણને સત્ય કરવાનો
લાખેણો અવસર આજ તારા હાથમાં આવી લાગ્યો
છે. તું એક વાત્સલ્યમથી માતા છે. પુત્રના ભાવિ-
હિતને ખાતર અવસ્થર આવે. માતા પોતાના સર્વસ્વને
ન્યોધાવર કરવા તૈયાર થાય છે. માટે જ હું કહું
છું કે તારા પુત્રની અનંતકાળની ભાવ હુઃખ-
પરંપરાને મિટાવવા અને જિનશાસનના એક ઉજ્જવળ
ઇતિહાસનું નિર્માણ કરવા તું તારા મોહનું બદિ-
દાન આપ અને પ્રભુશાસનના ચરણે આ બાળને
અર્પણું કરી હૈ.”

ગુરુની વાણી સાંલળાંને પાહિણી ક્ષણુભર
વિહૃળ બની ગઈ. એનો પુત્રપ્રેમ વિરહની કદ્દપના—
માત્રથી એને પ્રુણવી ગયો. એ બોલી : “ગુરુહેવ !
ચંગદેવના પિતા તો ખંલાત ગયા છે. તેમની રણ
વગર હું શું કરી શકું ?”

પાહિણીએ કરેલું ‘કલેજના કુકડાનું’ દાન :

પણ....ત્યાર બાદ તુરંત પાહિણીની કદ્યના-
ચક્ષુ સમક્ષ... પોતાનો પુત્ર હેવચન્-દ્રસૂરીશ્વરલુના વાર-
સદાર તરીકે હેખાયો.... આ મારો લાડલો ગૃહદીપ
નહીં, પણ સમય જિનશાસનનો તેજદીપ
બનશે. દીપ મટીને પોતાના સહભગુણકિરણોએ
સંસારને પ્રકાશથી ભરી હેતો આકાશભાનુ અનશે....
એ શ્રદ્ધાએ અને એ અરમાનોએ પાહિણીનું હૃદય
મજઘૂત બની ગયું. અને કો’ અગમ-ઉલ્લાસથી
તેણે ગુરુ-ચરણોમાં ચંગદેવને ધરી હીથો....ના....
પોતાનું સર્વ્ય જાણે સમપી’ હીધું.

એ પણ...એની આંખોમાં આંસુ હતા....
વાત્સલ્યના ! પુત્રપ્રેમના ! પોતે અણીના અવસરે
લીધેલા અણુમોદ અને અનુપમ આત્મનિર્ણયના !
એના એ આંસુ માતૃહૃદયની ગહરી વ્યથાના ન હતા.
એ આંસુ તો જિનશાસનના ઈતિહાસને બદલી
નાખનાડું એક અજખ પાસુ હતું. હુઃલાટે દિલે
લીધેલાં કોઈ હુઃખ નિર્ણયનું એ આંસુ ન હતું.
એ આંસુ તો હતું....જિનશાસનના યશોજનવલ
સમુદ્ધાર આતર, એક મહાન શ્રાવિકા પોતાના
કલેજના કુકડાનું દાન અને પુત્રમોહનું ખલિદાન
કેવી શાસનાનોઠાથી આપી શકે છે....એનું લુવંત
અને જાગૃત પ્રતીક !

પાહિણીના આંસુનો મહાન સંદેશ

ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિવરે પાહિણીની આંસો-
માંથી ટપકતું એ આંસુ જેથું.... અને એ આંસુમાં
પુત્રના આધ્યાત્મિક ઉત્થાન કાને અને ગ્રલુશાસનની
સેવા કાને એક ધન્ય માતાની અફલુત સમર્પણ-
ગાથાની પ્રતિચ્છાયા પ્રતિબિમ્બિત બનેલી હેખાઈ.
પાહિણીનું એ આંસુ માણુસ જાતને મહાન સંદેશ
આપે છે કે.... “હે માનવ ! આત્મકલ્યાણુની અનોખી
યાત્રા સુવર્ણ અને સુન્દરીના સાતત્યહીન સુખમા
નથી. સાચો અને વાસ્તવિક આનંદ અત્રીશા પ્રકવાજ
અને છત્રીશા શાકલર્યા ભોજનના રસથાળમાં નથી.
માનવળુવનનું પૂર્ણ-સુખ એ બાળકોથી અને પ્રેમાળ
પત્નીથી હૃદ્ય-લર્યા કુદુર્ભમેળામાં નથી. માનવમાત્ર
માટે ધર્મની આરાધના એ જ કલ્યાણુયાત્રા બની
રહેવી ધરે. હેહધારણામાં જે મૂલ્ય પાણી અને
પવનનું છે.... એવું જ મૂલ્ય આત્મવિકાસમાં સર્જર્મની
સેવનાનું છે.

“આત્મવિકાસની આ અનોખી યાત્રામાં સકૃદાતા
ત્યારે જ સાચ્ય બને છે કે જ્યારે ઉત્તમ ગુરુને
ઉત્તમ અને સમર્પિત શિષ્યની પ્રાપ્તિ થાય છે. અને
ત્યારે તે અનોખી—યાત્રા મુક્તિના મંગલક્ષારે જઈને
જ અટકે છે. લોકશાસનમાં માતા અને પુત્રના
સર્બ-ધને સૌથી ઉત્તમ ગણુવામાં આવ્યો છે. પણ
જિનશાસનમાં ગુરુ અને શિષ્યના સર્ગમ-ધને સર્વો-
તમ ગણ્યો છે.”

આવું તર્તવણાન માતા પાહિણી પીને પચાવી ચૂકી હતી. માટે જ તેણે પોતાની આંગાના અણુમોદ રતન જેવા ચંગદેવને, ગુરુદેવના ચરણે સમપીં દીધે. ત્યાગ અને બલિદાનની આ કથાને જગતના ઈતિહાસમાં સૌથી પ્રથમ પંક્તિમાં પહેલું સ્થાન મળવું ઘટે. આ જ ચંગદેવ આગળ જતાં ‘કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ તરીકે પ્રસિદ્ધ થયે.

પિતા ચાચની પણ સપ્રેમ સંમતિ :

પાહિણી, આચાર્યશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને ચરણે ચાંગાનું સમર્પણ કરી તો આવી. પરંતુ દેશાવરેથી પાછા કર્યો બાદ ચાંગાના પિતાની નજરે ધરમાં આવીને ચાંગાને શોધવા લાગી : “એટા ! ચાંગા ! તું કયાં છે ?” પિતા સાંદ દઈ રહ્યા.

પણ....ન્યારે ધરમાં ચાંગો ન હેખાયો, ત્યારે માતા પાહિણીએ જણાવ્યું કે, “આપણા ચાંગાના ઉજન્યાળ ભર્વાય કાને ગુરુ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજની આજાથી મેં ચાંગાને ગુરુચરણે સેંપી દીધેા છે.”

અને....પિતાનું હૈયું કાટી ગયું. પુત્રપ્રેમમાં ઝૂરતા પિતાના શોકનો પાર ન રહ્યો. તેએ દોડતા ખંલાત આવ્યા. પોતાના પુત્રને આ રીતે અન્યાયથી ગુરુદેવે આંચકી લીધો છે એમ તે માનતો હતો. પુત્રને પાંછા મેળવવા ચાચે, તે સમયના ખંલાતના સૂખા અને જૈનકુલભૂષણ મનીશ્વર ઉદ્ધયન પાસે

ધા નાંખી. “મન્ત્રીશર ! આ તો હડહડતો અન્યાય છે. મારી ગેરહાજરીમાં મારી પતનીને લોળવીને શુરુએ મારા પુત્રને પડાવી લીધે છે. તમે મને મારો પુત્ર પાછો અપાવો...”

પણ ઉદ્યન ખૂબ ચાલાક અને વણ્ણિઝુદ્ધિનો સ્વામી હતો. આહું ધર્મનો તે અનોએ આરાધક હતો. તેણે પોતાની મધુર વાણીથી અને કુશળતાથી ચાચને સમજલવતાં કહ્યું : “ભવિષ્યમાં પોતાના અનુપમ ધર્મંતેજથી ગુજરાતભરમાં ધર્મધજને ક્રદ્ગાવનારો અને સાહિત્યના અણુમોદ સર્જન ક્ષારા સંસારની સૂરત સુધારનારો સરસ્વતીપુત્ર, તે તારું જ આ લાઇલું સંતાન હશે. પોતાની સમ્યજ્ઞાનની પ્રભાથી સમય ગુજરાતને અને મહારાજ સિદ્ધરાજની ઈન્દ્રસભા સરખી રાજસભામાં વિરાળુને ગુજરાની ત્યારની રાજધાની પાટણુને શોલાવનારો એ યશસ્વી સાધુ, પાહિણી અને ચાચનો સુપુત્ર હશે.”

અને....અંતરમાં એ હિંદ્ય અરમાનો અને એ ભવ્ય આશાએ લઈને ચાચે, ચંગાદેવને સંયમી ઘનાવવા કાન્જે, આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને સપ્રેમ સમૃતિ સમીપી દીધી....

‘ચંગાદેવ’ બન્યો ‘ખાલમુનિ સોમચન્દ્ર’

વિ. સં. ૧૧૫૪ માં, નવ વર્ષની વચ્ચે શ્રીમદ્ દેવચન્દ્રસૂરિજીના વરદ કરકમણો ક્ષારા અંભાતને

આંગણે ચંગદેવનો લારે ઠાડમાડ સાથે ભન્ય દીક્ષા-મહોત્સવ ઉજવાયો. ચંગદેવના ઉછેર, જીવન-ઘડતર અને દીક્ષામાં મન્ત્રીશર ઉદ્ઘાટને ખૂબ મહત્વનો લાગ લજવ્યો.

દીક્ષા બાદ, ચંગદેવ બાલમુનિ સોમચન્દ્ર બન્યા. દીક્ષા લીધા બાદ બાર વર્ષ સુધી સોમચન્દ્રમુનિ શુરુચરણેણુંની સેવા અને શાસ્ત્રોના અલ્યાસમાં રમમાણુ બન્યા. પોતાની કુશાંત્ર ખુદ્ધિ અને પારદશી પ્રતિલાના બળે, ન્યાય-વ્યાકરણુ-કાંય-તત્ત્વજ્ઞાન-ચોગ-ઈતિહાસ-પુરાણુ-આગામ-સાહિત્ય અને શાખા-શાસ્ત્ર વર્ગોરેમાં તેમણે પરમ નિપુણતા પ્રાપ્ત કરી. અને આમ ચોગી, સંચભી, પરમ તેજસ્વી અને ચુવાન છતાં જિતેન્દ્રિય સાધુવર સોમચન્દ્રે પોતાની એકાશ્રચિત-પ્રતિલાના બળે સમ્યજ્ઞાનના મહા-સાગરને પોતાના અંતરમાં લરી દીધેલા.

આ ઉપરાંત... તત્કાલીન દેશ-કાળની પહેંચાન, રાજ અને પ્રજાના મનોભાવેનું મર્મસ્પશી અવ-લોકન કરવાની હીર્દ્દિષ્ટિ, હૃદયની ઉદ્ધાર અને વિશાળ મનોવૃત્તિ, દંલવિહોણું જીવન, ભાષામાં નીતરતી સુમધુરતા, મોટા ચ્યમરખંધી શહેનશાહની પણ શરમમાં ન તણ્ણાય તેવી ઉજાજી તેજસ્વિતા, આવા અનેક શુણેલા સોમચન્દ્રમુનિમાં શોભવા લાગ્યા. આ બધાના પ્રતાપે સંસારને મા શારદાના એક એવા દિવ્ય-પુત્રની લેટ મળી... જેણે ગુજરાતની

ધરતીને અહિંસાના ઓજસ્થી અજવાળાં વેરતી બનાવી હીધી....

મીનળહેવીને સમજવવામાં સર્કુળ સોમચન્દ્રજી :

મુનિવરક્ષી સોમચન્દ્રજીની ઉજ્જવળ શાન-પ્રતિલા, અતિ જડપી જાનોપાર્જનશક્તિ અને પ્રખર ખુદ્ધિમત્તાના કારણે ગુરુ દેવચન્દ્રસૂરિજીના હૃદયમાં તેઓ વિશિષ્ટ સ્થાન પામ્યા હતા. ગુરુ પોતાના આ પ્રતિલાસંપત્ત શિષ્ય પ્રત્યે વિશેષ પ્રસન્ન રહેતા હતા....

સિદ્ધરાજની સલામાં જ્યારે દિગંભર સમગ્ર-દાયના પ્રખર વાડી આચાર્ય કુમુદચન્દ્ર સાથે વાદીહેવસૂરજ મહારાજનો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો, ત્યારે રાજમાતા મીનળહેવી દિગંભર-તરદ્ધી હતા, તેમની સહાનુભૂતિ શ્વેતાભર પણ મેળવવામાં આલમુનિ સોમચન્દ્રે વિશિષ્ટ ભાગ લઈયો હતો.

વાત આમ બની હતી.

એક વાર આલમુનિ સોમચન્દ્રને મીનળહેવીનો જેટો થઈ ગયો. ત્યારે રાજમાતાએ સાહજિક રીતે પૂછ્યું : “કેમ છો; આલમુનિ !”

સોમચન્દ્રજી ઓલ્યા : “માતાજી ! બધું ક્ષેમ-કુશળ છે. પણ એક વાતની મને ચિંતા થાય છે.”

રાજમાતા કહે : “ભાલમુનિજી ! તમને વળી શાની ચિંતા છે ?” ત્યારે અતિ ચાલાક ભાલમુનિએ કહ્યું : “મને તો આપની ચિંતા થાય છે ! આ દિગભરે અમારી સાથે રાજસભામાં શાસ્ત્રવાર્થ કરી રહ્યા છે તે તો આપ જણો જ છો. તે દિગભરે કહે છે કે આપનો-સ્ત્રીનો-મોક્ષ કદાપિ થાય જ નહીં. કેમ કે તમે સત્ત્રી છો. ન્યારે અમે તો એ સિદ્ધ કરવાના છીએ કે સ્ત્રીનો પણ મોક્ષ થઈ શકે છે. સ્ત્રી, સ્ત્રીદેહધારી હોય તેથી તેને મોક્ષે જવાનો અધિકાર નથી તેવું તમારું (દિગભરોનું) કથન જૂકું છે. આમ અમે તો આપની (સ્ત્રીની) તરફેણુભાં છીએ.”

આ સાંલળી રાજમાતા ચોંકી ઉઠ્યા. તેમણે સિદ્ધરાજને જણોયું કે, “મેં તને પહેલાં કહ્યું હતું કે તું દિગભરની હાર થાય તેમ ન થવા દઈશ. દિગભરોનો વિજય જ થવો જોઈએ. પરંતુ હવે હું તને કહું છું કે જેની વાત સત્ય હોય, તેનો જ વિજય થવો જોઈએ. પછી ભલે તે શ્વેતાભર હોય કે દિગભર !”

અને....કુમુદચન્દ્ર સાથેના વાદમાં વાદીહેવ-સૂરિજી મહારાજ જભરદસ્ત વિજયને વર્ણો. તેમાં મીનળદેવીને નિષ્પક્ષ બનાવવામાં અને કાંઈક અંશો શ્વેતાભર પ્રત્યે પ્રેમાળ બનાવવામાં મુનિ સોમ-ચન્દ્રજીનો અસાધારણ ઝાળો હતો. તેમની વિશિષ્ટ

શક્તિઓથી ત્યારે શુરુવાયો અને સકળ શ્રીસંઘ પ્રલા-
વિત થયા હતા.

મા સરસ્વતીનું વરદાન

એક સમયે મુનિ સોમચંદ્રજીને સરસ્વતી દેવીની
વિશિષ્ટ સાધના કરવાનું મન થયું. તે સમયે
કાશમીરમાં ખાણીદેવી (સરસ્વતીદેવી) નું ખાસ
સાધના-મથક હતું. ત્યાં જર્દને જે સાધના કરવામાં
આવે તો, જદ્દી સિદ્ધિ પ્રાપ્ત થાય. આ માટે
મુનિવર સોમચંદ્રે શુરુદેવની સમૃતિ પણ મેળવી
લીધી અને કાશમીર જવા માટે વિહાર પણ
આદ્યો.

તેઓ ગિરનાર સુધી પહોંચ્યા. પોતાં એક રાત્રે
સરસ્વતીના ધ્યાનમાં જેડા હતા. તે વખતે સરસ્વતી-
દેવીએ સાક્ષાત् દર્શાન આપ્યા અને પ્રસન્ન થઈ ને
જણાવ્યું કે, “તમારે મારી સાધના કરવા માટે
કાશમીર સુધી આવવાની જરૂર નથી. તમે કયાંય
પણ સાધના કરશો તો પણ વિદ્વા પ્રાપ્ત કરી શકશો.
વળી તમે ગુજરાતમાં જ રહો કારણું કે તમારા ક્ષારા
ગુજરાતમાં ધણો ઉપકાર થશો.”

ત્યાર બાદ....વરો બાદ...આતિમક સંયમ-
સાધના અને સમ્યજ્ઞાનના બણે ગુર્જર દેશની સંસ્કાર-
લક્ષ્મીના સર્જક સૂરીધર હેમચંદ્ર, અવનિ પરના

આકાશને આહું તૂ-દર્શનરૂપી સહસ્રભાનુના તેજસ્વી કિરણોથી પ્રકાશમાન બનાવી હીધું. ગુજરાતને અહિંસાનો અખુમોદ વારસો લેટ ધરનારા જૈના-ચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીધરજી આજે નવસો—નવ-સો વર્ષો પસાર થવા છતાં વિક્ષણજોના છૃદ્ય-ભુવનમાં એક વન્દનીય અને વિશેષ સ્મરણીય વિભૂતિ તરીકે વિલસી રહ્યા છે.



[૩]

આચાર્યપદનો અભિષેક

ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીધરજી વૃદ્ધાવસ્થાએ
પહેંચ્યા ત્યારે પોતાના પ્રલાઘક અને પુણ્યવાન
પદ્મધર સોમચન્દ્રમુનિને આચાર્ય પદવી આપવાનો
નિર્ણય કર્યો.

તે સમયની એક પ્રસિદ્ધ દંતકથા આ ગ્રમાણે છે :
કોલસામાંથી હેમ (સુવણુ)

પાટણમાં તે સમયે એક શ્રીમંત શેઠ રહેતા
હતા. ધનદ તેમનું નામ. અશુલ કર્મના ઉદ્દેયે તેઓ
દરિદ્ર બની ગયા. એક વખત વીરચન્દ્રજી નામના
એક વૃદ્ધ મુનિવરની સાથે બાલમુનિશ્રી સોમચન્દ્રજી
ગોચરી વહેરવા ધનદ શેરને ત્યાં ગયા. ત્યારે
સોમચન્દ્રમુનિને ધનદશેઠ જેવા ઉત્તમ શ્રાવકની આવી

દરિદ્ર-અવસ્થા જોઈને હુઃખ થયું. તેમણે વડીલ મુનિ-
શ્રી વીરચન્દ્રમુનિને ધનદ શોઠની દરિદ્રતાનું કારણ પૂછ્યું.

ત્યારે વીરચન્દ્ર મુનિએ કહ્યું : “ ધનદ શોઠ
અશુભ કર્મની પ્રભળતાના કારણે દરિદ્ર છે.
શોઠના ઘરમાં અઠળક સંપત્તિ છે. પરંતુ અશુભ
કર્મના ઉદ્દેશ્યે તેમના ઘરમાં રહેતી સુવર્ણમહોરે
પણ તેમને કોલસાની ભૂકીઝે હેખાય છે અને તેથી
તેને ગમે ત્યાં પડી રહેવા હે છે. ”

અને ખરેખર....ત્યારે ઘરની બહાર કોલસાની
ઢગલીએ - જે વાસ્તવમાં સુવર્ણમહોરે હતી-
સોમચન્દ્રમુનિએ જોઈ. તેથી તેઓ ત્યાં જોઈ જ રહ્યા.
તેઓ ધનદ શોઠ પૂછ્યું : “ બાલમુનિલ! આપ
આ શું જોઈ રહ્યા છો ? ”

બાલમુનિએ ઉત્તર આપ્યો : “ તમે ઘરની
બહાર આ રીતે આ ‘ હેમ ’ (હેમ એટલે સોનું)
રખડતું મૂક્યું છો, તે હું જોઈ રહેયો છું : ”

યોગાનુયોગ વીરચન્દ્રમુનિની વાત ધનદ શોઠ
સાંભળી ગયા હતા. તેથી તેમણે તરત જ બાલ-
મુનિને જણાવ્યું : “ શુરુદેવ ! આ કોલસીના ઢગલાને
સ્પર્શ કરો અને આપની પવિત્રતાના ખળે મારી
દરિદ્રતા ફૂર કરો.” મુનિ સોમચન્દ્રે તે ઢગલાને સ્પર્શ
કર્યો અને તરત જ કોલસા જેવી કાળીમેશ સુવર્ણ-
મુદ્રાએ કુરી અગમગ અગમગ તેજ વેશવા લાગી.

‘સોમચન્દ્ર’માંથી ‘હેમચન્દ્રસૂરિ’

આ પ્રસંગ બાદ કેટલાક વર્ષોં પછી, વિ. સં. ૧૧૬૬ની સાલે....અક્ષયતૃતીયાના પવિત્ર દેવસે રાજસ્થાનમાં નાગપુર (નાગોર) મુકામે ગુરુહેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સંયમી અને સુવિનીત સોમચન્દ્ર મુનિને સૂરિપદ (આચાર્યપદ) સમર્પિત કર્યું....તે સમયે અદ્ભુત મહોત્સવ ઉજવાયો હતો..

સોમચન્દ્રમુનિને આચાર્યપદ અપિત થયું ત્યારના વિધિ-પ્રસંગનું વર્ણન કરતાં પ્રલાવક-ચારત્રમાં લખયું છે કે, “ચારે તરફ મંગલ-ધ્વનિ દર્શાવતાં વાધો વાગી રહ્યાં હતાં, ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરજીએ પોતે સોમચન્દ્રમુનિના શ્રવણુને (કાનને) અગરુ, કપૂર અને ચંદનથી અર્ચિત કર્યા અને સૂરિમન્ત્ર સંભળાવ્યો.”

સંયમ-સ્વીકારના બાર વર્ષ બાદ, સોમચન્દ્ર મુનિ આચાર્યપદ પામ્યા ત્યારે, કોલસામાંથી હેમ (સુવર્ણ)ના નિર્માણના પ્રસંગની સમૃતિ ચિરંજિવ રાખવા માટે ‘હેમ’ શબ્દને નામમાં જોડી હેવા માટે ધનદ શેઠે વિનંતી કરી. તે વિનંતીને ગુરુહેવ સ્વીકારી અને ગુરુએ સોમચન્દ્રજીનું નવું નામકરણ કર્યું—“આચાર્ય હેમચન્દ્રસૂરિ.” ત્યાર બાદ જગતે એમને વિશેષતઃ ‘હેમચન્દ્રાચાર્ય’ તરીકે જ એળાયા.

માત્ર એકવીશ વર્ષની નાનકડી ઉમરમાં તેએ

આચાર્યપદ પાઢ્યા. તે જ તેમની પરમ ચો઱્યતા, સર્વચારિત્રરીતા અને અનુપમ જ્ઞાનપ્રતિલાને દર્શાવવાં પૂરતાં છે.

પુત્રના પંથે પાહિણીનું પ્રયાણું

નિજપુત્રના આચાર્યપદના આ પનોતા પ્રસંગ-ને પ્રત્યક્ષ નિહાળવા, શ્રદ્ધા અને વાતસદ્યના સાગર-સમી માતા પાહિણીદેવી હાજર રહ્યા હતા અને પોતાના જીવનની સાર્થકતા અનુભવતા હતા. એક વખતનો પોતાનો લીકુડો લાડકો લાલ, આજે ધવલ-વસ્ત્રોમાં વિરાગમૂર્તિ વિરલ મહાત્મા તરીકે શોલી રહ્યો છે. જૈન શાસનનો જવાહીર બન્યો છે અને જૈનાચાર્યપદ આરૂઢ થયો છે-એ જેઈને પાહિણીદેવીની રોમરાળ વિકસવર બની ગઈ હતી. ત્યારે ધર્મવિસોર બનેલી માતાએ લાવલીના છુદ્યે નવો-દિત આચાર્ય હેમચન્દ્રને મધુર-વાણીમાં જણ્ણાંયું કે, “હે શાસન સૂરજ નૂતન સૂરિરાજ! મને પણ તમારો આ પુનિત-પંથ પ્રાપ્ત થાએ. આપના સાધ્વી-સંઘમાં મને સંયમધર્મ આપો.”

આ સાંલળીને હેમચન્દ્રસૂરિજી પરમ પ્રસન્નતા પાડ્યા અને પ્રેમમૂર્તિ માતાને લાવસલરનેત્રે નિરખી રહ્યા. પછી બોલ્યા: “માતાજી! જે ધર્મપંથ મને દર્શાવીને તમે મારા ઉપર અદ્વિતીય ઉપકાર કર્યો છે, તે ઉપકારઝણુને અદા કરવાનો આથી અનુપમ માર્ગ ખીને શો હોઈ શકે ? તમારી કૃપાથી જ

લાઘેલો આ ધર્મધવજ (એઠો) તમને પણ અર્પણુ કરા-
વીને આજે મનલર આત્મતોષ હું પામીશ."

પછી નૂતન આચાર્ય હેમચંદ્રસૂરિજીના માતા
પાહિણીને ગુરુદેવ શ્રી હેવચંદ્રસૂરીશ્વરજીએ સાધ્વી-
જીવન સમભૂતું આમ પાહિણી માનવજીવનને કૃતાર્થ
ખનાવવા કટીબદ્ધ બન્યા.

પુત્રના પંથે પ્રયાણુ કરીને પાહિણી પુલકિત
બની ઉઠ્યા.

માતાને મુક્તિનો મંગલમાર્ગ અર્પિને મુનિવર
મલકી ઉઠ્યા.

પ્રમન્યા (દીક્ષા) સ્વીકાર બાદ, સાધ્વી પાહિણી-
એ પણ સુંદર શાસ્ત્રાલ્યાસ કર્યો. ઉત્તમ પ્રકારે ચારિન્ય
પાળ્યું. તેમની ચોગ્યતાને કારણે તેમને 'પ્રવતિંની'
પદ અપાયું. વર્ષો સુધી દીક્ષા પાળ્યા બાદ,
વિકુમ સં. ૧૨૧૧માં તેઓ સમાધિપૂષ્ટ કાળધર્મ
પામ્યા.

માતાના સાધુતામય સાધ્વીજીવનની અને
સમાધિમય પંડિતમરણુની અનુમોદના નિર્મિતો હેમ-
ચંદ્રાચાર્યે એક કરોડ નવકારમન્ત્રનો જાપ કર્યો.

હેમચંદ્રાચાર્યનું પાટણુ-પ્રયાણુ

જ્યારે શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના દૌત્રનકાળ-
માં અપૂર્વ જ્ઞાન-તેજવડે અને વાગ્વૈલવવડે ફૂલારો
પ્રજાજીનોમાં પરમ આદર પામ્યા હતા, ત્યારે.... તે

સ મયે.... ગુજરાત-ધરા પર મહોન રાજવી સિંહરાજ જ્યસિંહ ગુજરાતની રાજ્યાની પાઠણુમાં એવું સુન્દર રાજ્ય ચલાવતો હતો કે જેની કીર્તિ સારાયે ભારતદેશમાં સર્વત્ર પ્રસાર પામી હતી.

સિંહ જેવો શૂરવીર હતો. શત્રુ રાજા-એને જુતી દેવામાં પરાંકભી હતો. રાજ્ય, નીતિ અને ધર્મ, આ ત્રણેયને તે પૂરતું મહત્વ આપતો હતો. આ ત્રણેય ગુણોની ઉત્તમ વૃત્તિ અને પ્રવૃત્તિ-એનું ધમધમતું મથક તે સમયે પાઠણ શહેર હતું.

આથી જ હેમચન્દ્રસૂરિજીએ વિચાર કર્યો કે પાઠણ શહેરમાં જવાથી જિનધર્મનો જ્યજ્યકાર ફેલાશે. રાજા અને પ્રજા, સહુ જિનધર્મના રાગી અને તેના અહિંસાદિ સિંહાન્તોના અનુરાગી બનશે. આથી જ આચાર્યશ્રી પાઠણ પધાર્યો.



[૪]

સિદ્ધરાજ અને સૂરિહંવ

પાટણું પથાર્યો બાદ, ખુવાન, પરમ તેજસ્વી અને પ્રખર વિક્ષાન જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિજીની કીર્તિ જેતનેતામાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી. સિદ્ધરાજને પણ આચાર્યશ્રીની જ્ઞાનપ્રતિલાની વાતો સાંભળી ને તેમને મળવાની અંખના જાગી હતી.

સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યની પ્રથમ મુલાકાત અંગેનો પ્રસંગ ‘પ્રલાવક-ચરિત્ર’ અને ‘કુમાર-પાલ-પ્રખંધ’ માં વર્ણવવામાં આવ્યો છે.

**હેમચન્દ્રાચાર્યના સિદ્ધરાજને આશીર્વદ
એક વખતની વાત છે.**

પાટણના મુખ્ય માર્ગો પરથી સિદ્ધરાજ હાથી ઉપર એસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે હેમચન્દ્રસૂરિજી ખીજ મુનિઓ સાથે સામેથી આવી રહ્યા હતા.

રાજ હાથી ઉપર આવી રહ્યા હતા, તેથી હેમ-
ચન્દ્રાચાર્યંજી બાંજુ ઉપર જિલા રહ્યા.

આ બાંજુ સિદ્ધરાજને કોઈએ જણાવ્યું કે : “આ
માઝે જિલા છે તે પ્રખર જૈનાચાર્ય શ્રી હેમચન્દ્ર-
સૂરજી છે.” તેથી તરત જ સિદ્ધરાજે સૂરીશ્વરને
પ્રણામ કર્યો અને આરીવાંદ આપવા જણાવ્યું.

ત્યારે સૂરિદેવ હેમચન્દ્રે કહ્યું :

‘કારય પ્રસરં સિદ્ધ ! હસ્તિરાજમશંકિતમ् ।
ત્રસ્યન્તુ દિગ્ગજા : કિ તૈભૂત્વયૈબોદ્ધતા યતઃ ॥’

અર્થાતું : “હે રાજ સિદ્ધરાજ ! તમારા હસ્તિ-
રાજને (હાથીને) નિઃશાંક બનીને આગળ વધવા
હો. તેનાથી દિગ્ગજે લયક્ષીત થાય તો લલે થાય.
કારણ કે ભૂમિનો લાર તો હવે તમે જ વહુન ઠરો
છો. એથી એ દિગ્ગજનેની પરવા હવે કોને છે?”

આ શ્લોક સાંભળીને સિદ્ધરાજ અત્યંત પુલ-
કિત અને પ્રલાવિત થયા હતા. ત્યારે જ તેમણે
પોતાની રાજસભામાં પધારવા માટે હેમચન્દ્રસૂરજને
આમન્ત્રણ આપ્યું.

ત્યારખાં હેમચન્દ્રાચાર્યંજના નિરંતર
સહવાસ અને સત્સંગથી સિદ્ધરાજને તેમના પ્રત્યે
ખૂબ જ આકર્ષણી અને સન્માન પેઢા થયા હતા.
હેમચન્દ્રાચાર્ય દ્વારા થતી સિદ્ધરાજની અવસરોચિત
પ્રશસ્તિની પાછળ સિદ્ધરાજ દ્વારા ભાવિમાં અનેકવિધ

ધર્મપ્રલાવક સત્કૃત્યો કરાવવાની ફરદેશિતા અને ખુદ્ધિમત્તા નિર્હિત હતી.

હેમચંદ્રાચાર્યની પ્રતિભાથી પ્રભાવિત સિદ્ધરાજ

આવો જ એક બીજે પ્રસંગ પણ આ પ્રમાણે છે.

ગુજરાતના પાટણ અને માલવાની વચ્ચે વધેંથી પેઢી દર પેઢી-વૈર ચાદ્યું આવતું હતું. સિદ્ધરાજે બાર વર્ષ સુધી અસીમ પુરુષાર્થ દ્રોરવીને અવંતીને જીતી લીધું હતું. સિદ્ધરાજના પ્રતાપી પૂર્વનો-ચાસુંડ, ફર્લાલરાજ, ભીમ અને કર્ણ-સહુએ અવંતીના વિજયની ઝંખના કરી હતી પણ અવંતીના માથે પાટણની વિજયધળ લહેરાવવાનું ભવ્ય સૌલાગ્ય સિદ્ધરાજને જ મળ્યું.

બાર બાર વર્ષ સુધી ચુદ્ધ કરીને પોતાના અપૂર્વ સામર્થ્યબણે સિદ્ધરાજ માલવા ઉપર વિજયની વર્માળા વરીને પાટણમાં પ્રવેશી રહ્યો હતો. આથી સમસ્ત પાટણની પ્રભા રાજના વિજયોત્સવમાં પાગલ બની હતી. સિદ્ધરાજને વધાવવા સહુ ઉત્સુક બન્યા હતા. પાટણના ઘેર ઘેર મંગળ તોરણો બંધાયા હતા. વિક્ષાનો પ્રશસ્તિગીતો લલકારતા હતા. આ ભવ્ય વિજયચાત્રામાં સિદ્ધરાજ ગજરાજ ઉપર આરુદ્ધ બનીને આવી રહ્યો હતો.

વિજયચાત્રામાં કેદ કરેલા માળવાના રાજને અને વિજય આદ પ્રાપ્ત થયેલા અઠળક ધનવૈલવ,

મૂલ્યવાન ચીનો-વસ્તુઓને પણ મારો ઉપર ફેરાયા હતા.

આ પ્રસંગે સિદ્ધરાજને ઉદ્દેશીને હેમચન્દ્રાચાર્યે, તેમની અદ્ભુત કદમ્બનાશકિતના પ્રતીક સમેનીચેનો શ્રદ્ધોક કૃષ્ણો :

‘ભૂમિ કામગવિ ! સ્વગોમયરસેરાસિજ્જ રત્નાકરા !
મુક્તા સ્વસ્તિકમાતનુ ધ્વમુડુપ ! ત્વં પૂર્ણકુમ્ભો ભવ !
ધૃત્વા કળ્પતરોર્ડલાનિ સરલેદિગવારણ સ્તોરણા
ન્યાધત્ત સ્કકરૈવિજિત્ય જગતોં નન્વેતિ સિદ્ધાધિપ : ॥’

અર્થાત्—“ હે કામધેનુ ! તું તારા ગોરસ (દ્વધદહીં)થી પૃથ્વીને સીંચી હો.

હે રત્નાકરો ! તમે મોતીઓના સાથિયા રચો.

હે ચન્દ્રમા ! તું પૂર્ણ કુમ્ભ બની જા.

હે દિગ્યુહસ્તિઓ ! તમે પણ કદમ્બતરુના પણોનાં
સુન્દર તોરણો રચો....કારણ કે આજે સિદ્ધરાજ
પૃથ્વીને જીતીને આવી રહ્યો છે.”

હેમચન્દ્રાચાર્યની આ અદ્ભુત કાવ્યશક્તિ,
કદમ્બનાશકિત અને જ્ઞાનપ્રતિલાના કારણે સિદ્ધ-
રાજનું હૃદય આચાર્યશ્રી પ્રત્યે વધુ ને વધુ આક-
ષિંત થવા લાગ્યું.

વ્યાકરણ-નિર્માણ માટે સિદ્ધરાજની પ્રાર્થના

આ દરમયાન એક ઘટના ઘટી.

માલવહેશ ઉપર વિજય મેળવ્યા બાદ પ્રાપ્ત થયેલી ઉત્તમ ચીજવસ્તુઓમાં એક અતિ ઉત્તમ ચીજ હતી અને તે ચીજ એટલે રાજ લોજનું ‘સરસ્વતી કંડાલરણ’ નામનું મહાન વ્યાકરણ ! રાજ લોજ અને માલવની અનુપસ્થિતિમાં ય વિક્રનજ્ઞનોના ઝુદ્ધયમંહિરમાં તે બનેની અમર ઉપસ્થિતિને શાખત રાખનારું એક ચિરંલું વ્યાકરણ !

તત્કાલીન વિક્રાનોના મુખેથી પણ જેની પુષ્ટણ પ્રશંસા સિદ્ધરાજે સાંભળી હતી અને શત્રુરાજની પ્રશંસા પણ સાંભળવા નહીં ઈચ્છતું એનું મન, અંખતું હતું કે ગુજરાત દેશનું ગૌરવ જગતમાં દન્તત કરે તેવા નૂતન વ્યાકરણની રચના કોઈ ગુજરાત પરમ વિક્રાનના હાથે થાય.

સિદ્ધરાજે ભરી સલામાં પ્રશ્ન કર્યો કે : “ છે કોઈ એવો મહાપંડિત આ ગરવી ગુજરાતમાં, કે જે ગુજરાતની ધરાને જગતમાં શિરોમણી સાભિત કરી શકે એવા નવીન વ્યાકરણનો રચયિતા બને ! માલવ હેશ અને ત્યાંના રાજને તો મેં જીત્યા, પરંતુ માલવની વિદ્યા જીતવામાં હું અસરૂણ રહ્યો છું. હું ઈચ્છું છું કે ગુજરાતનો કોઈ પનોતો પુત્ર ગુજરાતની માતા શારદાને ય સહા સર્વોપરી રાખી શકે તેવી વ્યાકરણ-વિદ્યાનો નિર્માતા બને. અને ગુજરા-

તની અસ્તિમતાને જાંચે આકાશમાં સદા જગત્ગતી રાખી શકે. છે કોઈ એવો ગૂર્જરધરાનો દિવ્ય લાલ ૧”

અને....સલામાંથી કોઈ સિદ્ધરાજનો પડકાર જીલવા તૈયાર ના થયું. ત્યારે અનેક વિદ્ધાનો અને પંડિતો ચુવા-આચાર્ય હેમચન્દ્રસૂરિજી તરફ સસુસુક નજરે જોવા લાગ્યા. સિદ્ધરાજને પણ આવા મહાન કાર્ય માટેનું સામચર્ય અને શક્તિ હેમચન્દ્રાચાર્યમાં હોવાની સવિશેષ શ્રદ્ધા જગી. ત્યારે સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યજીને વિનંતી કરતાં કહ્યું.

“યશો મમ તવ ખ્યાતિ:, પુણ્ય ચ મુનિનાયક !
વિશ્વલોકોપકારાય, કુરુ વ્યાકરણં નવમ् ॥”

અર્થાતુ- “હે મુનિનાયક ! મને યશ મળશે અને આપને પ્રસિદ્ધ અને પુણ્ય-ઐઉ મળશે. તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણું રચના કરો. ”

હેમચન્દ્રાચાર્યના હૈયે આનન્દને ઉદ્ઘિ ઉછાળા મારી રહ્યો કારણું કે સિદ્ધરાજની વિનંતિ-વાણી માં તેમને પોતાની અંતરભૂમિનું સપનું જાણે આકાર ધારણું કરીને સત્ય બનતું હેખાતું હતું.

એક વર્ષમાં સાંગોપાંગ વ્યાકરણનું નિર્માણ

ગુજરાતની અસ્તિમતાને ધર્તિહાસના આકાશમાં ચિરંજિવ કરવાનું ઝીડું હેમચન્દ્રાચાર્યે અડપી

લીધું. આ માટે ઉપરોગી તમામ સાહિત્યસામગ્રીએ સિદ્ધરાજે મંગાવી આપી. કેઠ કાશમીરથી પણ વિર્શાટ અન્થે મંગાવવામાં આવ્યા.

અને.... એક પ્રાતઃકાળના પુનિત પહોરે હેમચન્દ્રસૂરિએ હાથમાં કલમ થાણું કરી. ભાગિરથીના ખળખળ વહેતાં સલિલની જેમ સૂરિદેવની કલમમાંથી સાહિત્યની સરવાળી સદા વહેતી જ રહી. જેના શર પર સાક્ષાત્ મા સરસ્વતીની કૃપાધારા વહેતી હોય એનું સાહિત્યનિર્માણું ‘અદ્ભુત’ હોય એમાં સંહેઠ શાનો !

હેમચન્દ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુલ દિવસે આરંભાચેલું વ્યાકરણસજ્ઞનતું મહાન કાર્ય બીજુ કાર્તિક પૂર્ણિમાએ—ખરાબર એક વર્ષ—પૂર્ણ થયું. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણુપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણું પૂર્ણ રચના તેમણે કરી. જેમાં પ્રાકૃત અને અપખ્યાન લાખાનું વ્યાકરણું પણ સમાવી બેવામાં આવ્યું હતું. કુલ સવા લાખ રીતોક પ્રમાણ આ વ્યાકરણું રચના થઈ.

હેમચન્દ્રસૂરિએ વ્યાકરણનું નામ રાખ્યું : “સિદ્ધશખાનુશાસન” ! મહારાજ સિદ્ધરાજે જ્યારે એ નામ વાંચ્યું, ત્યારે તે અહોલાવથી આચાર્યને ઝૂકી પડ્યા. સૂરિદેવ એલ્યા : “આ વ્યાકરણું

તમારી વિનંતિના કારણે સંજ્ઞયું છે, તેથી મેં ‘સિદ્ધ’ શાહી સ્થાપને છે.”

સિદ્ધરાજ કહે : “પણ ગુરુદેવ ! મારી વિનંતીથી સંજ્ઞયેલું આ મહાવ્યાકરણ સંજ્ઞયું તો આપે જ ને ! તેથી તેમાં આપનું નામાંકન પણ કરવું જ જેહાએ.”

અને.... એ વ્યાકરણનું નામ “સિદ્ધહેમચન્દ્રશાહાનુશાસન” રખાયું. સંસ્કૃત-પ્રાકૃત લાખાનો એ અદ્ભુત વ્યાકરણ ગ્રન્થ આજે ય અદ્દીક્રિક છે. મા સરસ્વતીના શિર પર જે સુગુટમણિની જેમ શોભી રહ્યો છે.

‘સિદ્ધહેમ’નું શાહેનશાહી સંમાન

આ વ્યાકરણ “સિદ્ધહેમ” એવા ટૂંકા નામે વધુ જાણીતું બન્યું. સિદ્ધરાજના હૃદયમાં હથનો મહાસાગર ઉછળી રહ્યો હતો. કારણ કે પોતાની ગુજરાતી રધરાના એક પરમસાધુપુરુષે ગુજરાતની વિમલ-કીર્તિને દિગંતવ્યાપી બનાવે એવું સાંગોપાંગ વ્યાકરણ સંજ્ઞયું હતું. અને તેમાં નિમિત્તભૂત પોતે બન્યો હતો.

સાક્ષાતું મા શારદાને સંમાને એ રીતે, રાજ્યના મુખ્ય હાથી ‘શ્રી કરણ’ ઉપર અંબાડીમાં “સિદ્ધહેમ”ની સુવર્ણપ્રતને સ્થાપિત કરીને સિદ્ધરાજે પાઠણના વિશાળ રાજમાર્ગો ઉપર તેની મહાન શોભાયાત્રા કાઢી. શોભાયાત્રામાં આ મહાગ્રંથને

એ ચામરધારિણીએ. ચામર વીંઅતી હતી. અને ઉપર શૈત છત હતું. ત્રણુસો લહિયાએ. પાસે તેની હજારો નકલો તૈયાર કરાવી. તેની સુવર્ણાક્ષરે લખાયેલી પ્રતો પણ તૈયાર કરીને બહુમાનપૂર્વક રાજ્ય-લંડારમાં સ્થાપિત કરી.

રાજ્યસલામાં એ સમય વ્યાકરણું વાંચન કરાયું.

તત્કાલીન વિદ્ધાનોએ એ વ્યાકરણુને હૈયાના હર્ષથી વધાવ્યું અને પોતાની હાદિક સંમતિ અર્પી.

નેપાલ, કર્ણાટક, કેંકણુ, સૌરાષ્ટ્ર....અરે ! ઈરાન અને લંકા સુધી-તે નકલોને મોકલવામાં આવી. કાશ્મીરમાં આ વ્યાકરણુની આઠ નકલો મોકલવામાં આવી હતી.

પાટણુમાં ‘કક્કલ’ નામના વિદ્ધાન અને હેમવ્યાકરણુના સૌ પ્રથમ વૈયાકરણી દ્વારા આ નવીન વ્યાકરણ ભણુંવવાની વ્યવસ્થા કરવામાં આવી. દર મહિનાની સુધ પાંચમે તેની પરીક્ષાએ લેવાતી અને તેમાં ઉત્તીર્ણ થનારા વિધાથીએનું રાજ્ય તરફથી શાલ, સુવર્ણમુદ્રા વગેરે અર્પિને સન્માન કરાતું.

સંસ્કૃતભાષાના ઈતિહાસમાં પાણીનીએ રચેતાં વ્યાકરણુને બાદ કરતાં, “સિદ્ધહેમ” જેવું સર્વોત્તમ

અને સુચ્યવસ્થિત વ્યાકરણ બીજું કોઈ રચાયું નથી
એમ અવશ્ય કહેવું જોઈએ.

સિદ્ધરાજની સલામાં હેમચન્દ્રાચાર્યનું અદ્વિ-
તીય સ્થાન હતું. હેમચન્દ્રાચાર્યના સત્તસંગથી
સિદ્ધરાજમાં અનેરો સાહિત્યપ્રેમ અને ધર્મપ્રેમ
જાગૃત થયો હતો. સિદ્ધરાજે આચાર્યશ્રીને પોતાના
માર્ગદર્શક, ભિત્ર અને ગુરુ તરીકે લુલનમાં સ્થાન
આપ્યું હતું.



[૫]

સમદર્શી અને સમયજ્ઞ

સૂરિસાટ

હેમચન્દ્રાચાર્યની કુશળતા, ખુદ્ધિમત્તા અને
વિક્રતા ખરેખર અનેડ હતી. તેમની તાર્કિક પ્રતિલા
અને વાઢ—કૌશાલ્ય પણ ખરેખર અફલુત હતું.

હેમચન્દ્રસૂરિલું એક વખત પાઠથુમાં ચાતુર્માસ
બિરાજમાન હતા ત્યારે, લગવાનશ્રી નેમિનાથસવા-
મીના જીવનચરિત્ર ઉપર પ્રવચન આપતા હતા.
ત્યારે તે સાંભળવા માટે અનેક વિક્ષાનો, પંડિતો
અને રાજ પણ આવતા હતા.

ત્યાજ્યાનમાં પંડવોનો વિષય આવ્યો, ત્યારે
“જૈન મહાભારત” પ્રમાણે સૂરિદેવે જણ્ણાવ્યું કે,
“પંડવોએ જૈન દીક્ષા અહણું કરી હતી અને તેઓ
શત્રુંજયગિરિ ઉપર મોક્ષે પધાર્યો હતા.”

આ સમયે અજોન વિક્રાનોએ સિદ્ધરાજ આગળ ફરિયાદ કરી કે : “હેમચ-દ્રાચાર્યજી પાંડવોએ જૈન દીક્ષા લીધી અને શત્રુંજ્ય ઉપર મોષે પદ્ધાર્યાની વાતો રજૂ હરે છે....ને આપણા ધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ છે. આ તો ન જ ચાલી શકે.”

સિદ્ધરાજે હેમચ-દ્રાચાર્યજીને મળીને આ બાધ-તનો ખુલાસો આપવા અને વિક્રાનોના મનની શંકાનું સમાધાન કરવા વિનંતી કરી.

ત્યાર બાદ હેમચ-દ્રાચાર્યજીએ, સિદ્ધરાજે આયોજેલી વિક્રાનોની સલામાં જણ્ણાવ્યું : “અમારા જૈન શાઓમાં જણ્ણાવ્યા પ્રમાણે પાંડવોએ જૈન દીક્ષા લીધી હતી. અને તેઓ શત્રુંજ્ય ઉપર મોષે પદ્ધાર્યો હતા. ત્યાં પાંડવોની મૂર્તિએ પણ છે. પરંતુ એક જ નામની અનેક વ્યક્તિએ આ અનંત ભૂતકાળમાં થઈ હોય છે. તેથી શત્રુંજ્ય ઉપર મોષે પદ્ધાર્યો તે પાંડવો અને તમારા મહાલારતના પાંડવો જુદા-જુદા હોઈ જ શકે છે. આથી કોઈ વિરોધ રહેતો જ નથી.”

“જે આમ નહિ માનો તો, તમારા મહાલાર-તમાં સીઝમપર્વમાં એમ જણ્ણાવ્યું છે કે લીઠમ-પિતામહે પોતાના કુદુરભીજનેને એમ કહું હતું કે ‘ત્યાં કોઈનો પણ કયારેય અગ્નિહોષ થયો ન હોય ત્યાં મારો અગ્નિસંસ્કાર કરનો.’”

“પછી....લીણ પિતામહના શખને હિમાલયના શિખર ઉપર અગિન-સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો, અને જ્યાં અગિનહાહ હેવાની તૈયારી કરવામાં આવી ત્યારે આકાશવાળી થઈ કે....

અત્ર ભોજમશતં દગ્ધં, પાણડવાનાં શતત્રયમ् ।
દ્રોણાચાર્યસહસ્ર તુ, કર્ણસહસ્રાંખ્યા ન વિદ્યતે ॥

અર્થાતું : “આ જગ્યાએ તો સો લીણમનાં, ગ્રણુસો પાંડવોનાં અને હંજર દ્રોણાચાર્યના શખોને અગિનસંસ્કાર થઈ ગયો છે. અને કર્ણના શખોની સંખ્યાને તો પાર નથી.”

“આમ તમારા મહાભારતમાં જ અનેક લીણમો, અનેક પાંડવો, અને અનેક દ્રોણ-કર્ણોની વાત આવે છે. આથી “પાંડવોની લૈન હીક્ષા અને શત્રું જ્ય પર મોક્ષની વાતથી” તમારે વિરોધ કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.”

હેમચંદ્રાચાર્યની કુશળ બુદ્ધિમત્તા અને તર્ક-પ્રતિભાથી પંડિતો ઠંડાગાર થઈ ગયા. કોઈની પાસે બીજુ કોઈ દલીલો બાકી રહી ન હતી. તેથી પંડિતોએ હેમચંદ્રાચાર્યની ક્ષમા માંગી. સૂરિહેવની સતર્ક-પ્રતિભાથી સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થયો.

હેમચંદ્રાચાર્યની તર્કપ્રતિભાનો બીજો એક પ્રસંગ આ પ્રમાણે છે.

હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષ્યાલાવ ધરાવતા આદ્ધારું એક વાર સિદ્ધરાજને કહ્યું : “રાજનુ ! તમે જેનું ખૂબ બહુમાન કરો છો તે સૂર્યને હેમચન્દ્રાચાર્ય ‘લગવાન’ રૂપે સંમાન આપતા નથી.”

સિદ્ધરાજે સૂરિદેવને આ અંગે ખુલાસો પૂછ્યે..
ત્યારે સૂરિદેવરે કહ્યું : “અમે જૈનો સૂર્યને જેટલું બહુમાન આપીએ છીએ તેટલું તો આદ્ધારું કદી આપતાં નથી. કારણ કે જૈનો સૂરજ દૂધી ગયા બાદ, તેના વરહના શોકમાં ખાવા-પીવાનું (રાત્રિ-જોજન) છોડી હે છે. અને જ્યારે બીજે દિવસે દૂરી આકાશમાં સૂર્ય જિગે પછી અડતાળીશ મિનિટ પછી જ અન્ન-પાણી લેવાનું શરૂ કરે છે. સૂર્ય-દેવનું આથી ઊંચું બહુમાન બીજું કોણું કરે છે ?”

સૂરિદેવના, તેમની ગીતાર્થતાને છાજે તેવા, આ જવાબથી સિદ્ધરાજ વિશેષ પ્રસન્ન થયે.

કૃષાયવિજેતા સૂરિદેવ

‘પ્રભ-ધ-ચિંતામણિ’માં પંડિત વામર્ષિનો એક પ્રસંગ વર્ણિવાયેલો છે. વામર્ષિ શ્રીવ-પંડિત હતો. તેને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે વિદેશ હતો.

હેમચન્દ્રાચાર્ય તો અન્ય-ધર્મી પંડિતો અને કિદ્ધાનો પ્રત્યે પણ સહાનુભૂતિ અને સમલાવ જ ધારણ કરતા.

એક વાર હેમચન્દ્રાચાર્યને લોઈને વામર્ષિએ, વદ્ધત્સલામાં એક શ્રીદોક ઠઢ્યો. જે શ્રીદોકનો અર્થ

હેમચન્દ્રાચાર્યની ટીકા-મશકરી સ્વરૂપ હતો વામ-
ર્ધિએ કહું :

“સોઽયં હેમડસેવડઃ પિલપિલત્ત્વલિ. સમાગચ્છતિ”

આ સમયે હેમચન્દ્રસૂરિજીએ અત્યારે સ્વર્ણ-
તાથી કહું. “તમારી શલોક-રચના ખરેખર સુંદર
છે. પણ તેમાં વ્યાકરણું દિશિએ દોષ છે. ‘હેમડસેવડ’
ના બદલે ‘સેવડહેમડ’ જોઈએ. કારણ કે વિશેષણ
પહેલાં અને વિશેષય પછી આવે.”

વામર્ધિની કહેપના હતી કે મારો શલોક સાંલ-
જીને હેમચન્દ્રાચાર્ય ગુસ્સે થશે, કોધિત થશે. પરંતુ
આચાર્યની સરળતા તથા વ્યાકરણું વિક્રિત અને
ચોતાની ભૂલ જોઈને વામર્ધિ ઠંડોગાર થઈ ગયો.

કેવા કોધાહિ કષાયના વિજેતા હતા હેમ-
ચન્દ્રાચાર્ય !

આચાર્યવરની હાજરજવાખી

આચાર્યવરની પ્રત્યુત્પન્નમતિ [તત્કાળ હાજર
જવાબ આપવાની પ્રતિલાં]ને જણાવનારો એક
સરસ પ્રસંગ બન્યો હતો. તેઓ વિનોદવૃત્તિના
અને હાજરજવાખી પણ હતા.

એક વખત જુદા જુદા ધર્મોના પંડિતો-વિક્ષા-
નોની સલા મળી હતી. તેમાં હેમચન્દ્રાચાર્યનું ને
પણ આમ-ત્રણ અપાયું હતું. બીજા પંડિતો ગૃહંદથ

હોવાથી સુંદર વબાલંકારોથી સુસજજ બનીને આવ્યા હતા. જથારે હેમચન્દ્રાચાર્યાંજુ તો સાધુ-પુરુષ હતા. તેથી તેઓ ધ્વલ વસ્ત્રોમાં, હાથમાં ઢાંડો અને ખલે કામળી નાંખીને આવ્યા.

તે સમયે હેવણોધિ નામના પંડિતે-જૈને હેમચન્દ્રાચાર્યે પ્રત્યે દર્શાવ્યાલાં હતો—મશ્કરી કરતાં શ્રલોકાધ્રી કહ્યો :

‘આગતો હેમગોપાલો દણડ—કમ્બલમુદ્વહન् ।’
[અર્થાતૂ-ઢાંડો અને કાંબળીને ધારણુ કરનારો ‘હેમ’ નામનો ગોવાળિયે આવી ગયો.]

આ શ્રલોકાધ્રીની પાદપૂર્તિ કરતા હેમચન્દ્રાચાર્યે તુરત જ શ્રલોકનો ઉત્તરાધ્રી કહ્યો :

‘ષઢ્દર્શનપશુગ્રામં, ચારયન્ જૈનવાટકે ॥’

[અર્થાતુ-જૈન દર્શનરૂપી વાડામાં છ દર્શનરૂપી પશુઓના સમૂહને ચરાવનારો આ હેમગોપાલ છે.]

આમ હેમચન્દ્રાચાર્યે છ દર્શનને પશુતુલ્ય ગણ્યાવી જૈનદર્શનને તેના નાયકરૂપે વર્ણુંબું. હેમચન્દ્રસૂરિઝુની આવી અદ્ભુત હાજરજ્વાણી જોઈને સલા ખુશખુશાલ બની ગઈ. અને હેવણોધિ પંડિત જંખવાણો પડી ગયો.

‘હ’ હવે હસે છે

હેમચન્દ્રાચાર્યાંજુ રમૂળવૃત્તિના પણ હતા.

એક સમયે કપર્દી નામના મન્ત્રીશ્વર, સૂરીશ્વરને

વન્દન કરવા આવ્યા. તેમની બંધ મુહૂર્માં ‘હરડે’ હતી. હેમચન્દ્રાચાર્યે પૂછ્યું :

“મન્ત્રીશર ! હાથમાં શું છે ?”

કપર્દીએ જવાબ આપ્યો : “હરડઈ” (‘હરડઈ’ એ હરડે માટે પ્રાકૃતભાષામાં વપરાતો શબ્દ છે.)

હેમચન્દ્રાચાર્યે રિમત સાથે શ્રલેખ કરતાં કહ્યું : “હ રડઈ ? અર્થાત્ હજુ ‘હ’ રડે છે ?”

વર્ણોક્ષરોમાં ‘હ’ છેલ્દો હોવાથી રડે છે, એમ કહેવાતું હતું. ત્યારે કપર્દી હેમચન્દ્રાચાર્યેનો શ્રલેખ સમજુ ગયા. તેમણે કહ્યું : “ના ! ગુરુદેવ ! હ પહેલાં રડો હતો. કેમ કે તે વર્ણોક્ષરોમાં છેલ્દો છે. પરંતુ હવે તો આપના નામમાં હ પ્રથમ આવી ગયો. તેથી હવે હ હસે છે.”

શત્રુ પ્રત્યે સમહણિ-મિત્રહણિ

દેવબોધિ પંડિતને હેમચન્દ્રાચાર્યે પ્રત્યે છણ્ણો-ભાવ હતો. છતાં ય સૂરિદેવ તો તેના પ્રત્યે પણ નિર્મળ સ્નેહભાવ-મિત્રભાવ રાખતા હતા.

સિદ્ધરાજે રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. તેમાં ભગવાનશ્રી આદીશરપ્રભુની પ્રતિષ્ઠા-પ્રસંગે દેવબોધિ ત્યાં આવ્યા હતા. દેવબોધિ પ્રખર પંડિત હતો. તેણે એક સંસ્કૃત-શલોક કહ્યા. જેમાં જિન-ભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી. તે શ્રલોકનો ભાવાર્થ આ પ્રમાણે હતો :

“શંકર જેવો કોઈ રાગી નથી; જે સદા

અર્ધનારીશર રહ્યો. અને જિન જેવો કોઈ વીત-
રાગી નથી. જે સંપૂર્ણપણે નારીસંગથી સુકૃત રહ્યો
છે. બાકીના બધા તો વચ્ચે અટવાયા છે. નથી
તેઓ પૂરા વિષયો ભોગવી શક્યા કે નથી તો તેના
પૂર્ણ ત્યાગી બની શક્યા.”

આ સાંભળીને સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થયો.
તેણે હેવણોધિ પંડિતને એક લાખ સુવર્ણમુદ્રાએ
આપવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે પાછળથી
સિદ્ધરાજે જાણ્યું કે હેવણોધિ સુરાપાન (દારૂપાન)
કરે છે ત્યારે તે ઈનામ આપવાનું મુલતવી રાખ્યું.

કેટલાક સમય બાદ, હેવણોધિ સાવ દર્દી
બની ગયો. આ વાતની હેમચન્દ્રસૂરિજીને ખખર
પડી. તેમણે હેવણોધિને બોલાવ્યો. તેને સિદ્ધરાજ
પાસેથી ધન અપાવવા અંગે આશ્ચર્યાસન આપ્યું.
અને જણ્યાંયું કે : “પંડિતવર ! તમારી અસાધારણ
વિક્રતા પ્રત્યે મને અત્યંત આદર છે.”

આ સાંભળીને હેવણોધિ મનથી સ્વસ્થ અને
પ્રસન્ન બન્યો. એક સમય એવો હતો કે જ્યારે
હેવણોધિ અને શ્રીપાણ જેવા પ્રખર પંડિતો પરસપર
ઇંદ્રિયાથી અઘડતા હતા, ત્યારે તે એ વચ્ચે હેમચન્દ્ર-
સૂરિજીએ પોતાની અત્યંત કુશળતાથી મૈત્રી પ્રસ્થા-
પિત કરાવી હતી. હેવણોધિની આ વિષમ સ્થિતિના

અવસરે આ જ શ્રીપાળ નામના વિક્રાન કવિ દ્વારા રાજ સિદ્ધરાજને હેમચન્દ્રસૂરિજીએ લલામણુ કરી અને જથ્થાબ્યું કે એક લાખ સુવણું મુદ્રાઓનું જે ધનામ, સિદ્ધરાજે હેવાએધિને આપવા પહેલાં નક્કી કર્યું હતું, તે તેને અવશ્ય આપવું.

કલિકાલસર્વંજશ્રીની સૂર્યનાથી સિદ્ધરાજે હેવાએધિને લાખ સુવણું મહોરે આપી. આનાથી હેવાએધિનું મન સૂરાધર પ્રત્યે ઘૂંઘ અહોભાવયુક્ત બન્યું. છેલ્લે તેણે બધું ત્યાગી દીધું. અને આત્મકલ્યાણ માટે ગંગા કિનારે નિવાસ કર્યો.

શત્રુભાવ ધરનારા પ્રત્યે પણ સૂરિહેવ હેમચન્દ્રની આ કેવી મહાન ઉદ્ઘારતા !

સર્વધર્મો પ્રત્યે સમદર્શિતા

સિદ્ધરાજ જ્યસિંહ ઉપર હેમચન્દ્રસૂરિજીનો પ્રખર પ્રભાવ હતો. હેમચન્દ્રાચાર્યની ઉદ્ઘારતા, ખુદ્ધિમત્તા, વિક્રતા, ક્ષમાશીલતા, સ્નેહાળતા, કુનેહ અને કુશાળતા, આ બધા શુણોએ સિદ્ધરાજના હૃદય ઉપર અમિત છાપ મૂકી હતી.

પોતાના મનની શંકાઓના સમાધાન માટે સિદ્ધરાજ હેમચન્દ્રસૂરિજીને પ્રશ્નો પૂછ્યતા. એક વાર જુદા જુદા પંડિતોને પોતાની સલામાં સિદ્ધરાજે પ્રશ્ન પૂછ્યો:

“જગતમાં અનેક ધર્મો છે....તો સાચો ધર્મ કયો હો ?”

આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા પંડિતોએ આપ્યો.
ત્યારે સહુએ જણ્ણાંયું કે પોતાનો જ ધર્મ સાચો છે.

પરંતુ જ્યારે હેમચન્-દ્રાચાર્યને પૂછવામાં આંયું
ત્યારે તેમણે જણ્ણાંયું કે, “આ પ્રશ્નના જવાબદ્દે
હું એક પૌરાણિક કથા કહુશા.”

“શાંખપુર નામના નગરમાં શાંખ નામનો એક
વેપારી વસ્તો હતો. તેને યશોમતી નામની પતની.
જ્યારે શાંખ યશોમતી પ્રત્યે વિરક્ત થઈને બીજી
સ્ત્રીના પ્રમભાં પડ્યો. ત્યારે યશોમતી હુઃખી હુઃખી
થદ્ધ ગઈ તેણું અનેક યોગીએ અને સિદ્ધપુરુષોને
પતિને વશમાં રાખવાનો ઉપાય પૂછ્યો.

એમાં એક સિદ્ધપુરુષે પતિને મન્ત્રપ્રયોગ કારા
પશુ બનાવી હેવાની વિધા યશોમતીને શિખવી. યશો-
મતીએ મંત્ર પ્રયોગ કારા શાંખને બળદ બનાવી
દ્વારા. પણ પાછળથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. હવે
તે પોતાના પતિને પુનઃ માણુસ બનાવવા ઈચ્છા
હતી. પણ તે માટે તેની પાસે કોઈ મન્ત્ર કે વિધા
ન હતી.

તે સતત વિલાપ કરતી. રડતી. પોતાના બળદ-
પતિને ચારો ચરાવવા એતરમાં લઈ જતી. એક
દિવસ યશોમતી એક આડ નીચે એસીને વિલાપ
કરી રહી હતી.

“ત્યારે આકાશમાગે શિવ-પાર્વતી પસાર થઈ રહ્યા હતા. પાર્વતીએ શિવજીને આ સ્ત્રીના રડવાનું કારણું પૂછ્યું, ત્યારે શિવજીએ પૂરી હકીકત પાર્વતીને જણાવી. પાર્વતીએ પૂછ્યું : “એવો કોઈ ઉપાય છે કે જેનાથી આ સ્ત્રીને પતિ પુનઃ માણુસ બની જાય?”

ત્યારે શિવજી બોલ્યા : “હા....આ જ વૃક્ષની પાસે એક વનસ્પતી-ઔષધ છે કે જે ખાવાથી આ બળદ કરી માણુસ બની શકે.”

આ વાર્તાલાપ યશોમતીએ સાંભળ્યો. પણ તેટલી વારમાં તો શિવ-પાર્વતી આગળ ચાલ્યા ગયા. હવે યશોમતી વિચારવા લાગી કે એ ઔષધિને ઓળખવી શી રીતે? તેણે તે વૃક્ષની આસપાસની તમામ વનસ્પતિઓ પોતાના પતિને ખવડાવવા માંડી. એમાં જ્યાં પેલી ઔષધિ આવી કે તે બળદ કરી માણુસ બની ગયો.”

આ વાર્તાનો ઉપસંહાર કરતાં હેમચંડ્રાચાર્યજી-એ જખાયું કે : “રાજનૂ! બરાબર આ જ રીતે કર્યો. ધર્મ સાચ્ચા તે એકાંતે કહેલું બહુ સુશકેલ છે. પરંતુ તમામ ધર્મોનો અને તેના સુખ્ય અન્થોનો અલ્યાસ કરવામાં આવે તો સત્ય ધર્મની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય....અને આત્મકલ્યાણુનો માગ્યું અવશ્ય પ્રાપ્ત થઈ જાય.”

આ વાતનો સંસ્કૃત—શલોક ને સૂરિહ્ને સિદ્ધ-
રાજને કહેલો તે આ પ્રમાણે છે:

“તિરોધીયતે દભાદ્યૈર્યથા દિવ્યં તદૌષધમ्,
તથાડમુષ્મન् યુગે સન્યો ધર્મો ધર્માન્તરેનૃપ ! ।
પરં સમગ્ર ધર્મણાં સેવનાત્ કસ્યચિત્ કવચિત્ ॥
જાયતે શુદ્ધધર્માપ્તિદેર્ભચલનૌષધાપ્તિવત् ॥”

ભાવાર્થ: “ જેમ દલોહિ (ધાસ વગેરે) સાથે લેળ-
સેળ થઈ જવાથી દિવ્ય ઔષધ છાનું રહે છે તેમ
આ યુગમાં અનેક ધર્મોમાં લેળસેળ થઈ જવાથી
સાચો ધર્મ છુપાઈ ગયો છે. જેમ દલ્લ (ધાસ) વગેરેમાં
છુપાયેલી ઔષધિ તે સર્વંના સેવનથી મળી જાય
છે; તેમ સમગ્ર ધર્મોના સેવનથી (જાણુકારી-જ્ઞાન-
મેળવવાથી) કયારેક કોઈને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ
જાય છે.”

હેમચન્દ્રાચાર્ય લુચે આપેલા નિષ્પક્ષ અને સર્વ-
ધર્મો પ્રત્યેની ઉદારતાથી લરેલા ઉત્તરથી સિદ્ધરાજ
પ્રસંગતાને પામ્યા. તેનું સૂરિહ્ને પ્રત્યેનું માન વધી ગયું.

સિદ્ધરાજની સલામાં અનેક કવિઓ, પંડિતો,
ચારણો અને વિદ્ધાનો આવતા હતા. સિદ્ધરાજને
જ્ઞાનનો ભારે ગ્રેમ હતો. તેથી તે અવારનવાર જ્ઞાન-
ગોઠિ અને ધર્મગોઠિઓ ગોઠવતો જ રહેતો. આ
ખધા પ્રસંગોમાં હેમચન્દ્રાચાર્ય પ્રમુખસ્થાને રહેતા.
આચાર્યશ્રી અન્ય પંડિતો અને કવિઓને પણ મહત્વ
આપતાં. તેમને પૂરી રીતે સંતોષ પમાડતાં. આથી

આચાર્યશ્રી અને સિદ્ધરાજની યશઃકીતિં ચારે-
ખાળુ ગવાવા લાગી.

અગાધ જ્ઞાનના મહાસાગર છતાં અત્યંત નિર-
લિમાની, જૈન ધર્મમાં પરમ નિષ્ઠાવાન છતાં અન્ય
ધર્મો પ્રત્યે પણ ઔદ્ધાર્ય ધરાવનાર હેમચંદ્રાચાર્ય,
રાજ સિદ્ધરાજ અને સમય પ્રબલમાં પરમ પ્રેમાદરનું
પાત્ર બની ગયા હતા.

સોમનાથની યાત્રાએ સિદ્ધરાજ અને સૂરિદેવ

સિદ્ધરાજને કોઈ સંતાન ન હતું, તેથી તેનું
મન છેલ્લા વર્ષોમાં સંતાપશીલ રહ્યા કરતું. તેને
પુત્રની પ્રાપ્તિની ઝંખના અહંકાર હતી. તે માટે તે
સોમનાથ મહાદેવની યાત્રા કરવા નીકળ્યો. સિદ્ધરાજ-
ની ચિત્ત પ્રસન્નતા ઘાતર તેની વિનંતીથી હેમચંદ્રા-
ચાર્યજી પણ સાથે આવવા તૈયાર થયા.

આચાર્યશ્રીની સૂર્યનાથી શત્રુંજય અને ગિરનાર
તીથોએ જઈને સોમનાથ જવાનો રસ્તો સિદ્ધ-
રાજે નકફી કર્યો. આ માટે પાઠખૂથી વિરાટ ‘સંધ’
નીકળ્યો. જેમાં હાથીએા, ઘોડાએા, જંટ, બળદો
અને વાહનોનો કોઈ પાર ન હતો.

સાગરની જેમ ગાજ્યો અને ગજ્યો એ સંધ,
અનેક જગ્યાએ પડાવો નાંખતો આગળ વધવા
લાગ્યો. સિદ્ધરાજે અને સકળ સંધે શત્રુંજય અને
ગિરનાર બન્ને તીથોની ભક્તિપૂર્વક યાત્રા કરી. સેવા-

પૂજા પણ કરી. ગિરનારમાં જિનલકૃત એવા સાજન મન્ત્રીની કુશળતાથી ગિરનાર તીર્થનો જિરોદ્ધાર સિદ્ધરાજે પોતાના ખર્ચે કરાવ્યો.

ત્યાંથી હેમચન્-દ્રાચાર્યજી, સિદ્ધરાજ અને શ્રી સંધ્ર સોમનાથ આવ્યા. સોમનાથના મંદિરમાં મહા-દૈવ (શિવજી)ના દર્શન કરતાં સૂર્યદૈવ અર્થગંભીર સ્તુતિ બોલ્યા હતા;

“યત્ર તત્ત્ર સમયે યथા તથા
યોડસિ સોડત્યભિધ્યા યયા તયા ।
વૌતદોષકલુષઃ સ ચેદ્ ભવાન्
એક એવ ભગવન् । નમોડસ્તુ તે ॥”

[અર્થ: ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામવડે જે વીતરાગ અર્થાત્ રાગદ્રેષાદિ પાપોથી સર્વથા રહિત છે, તે વીતરાગ એક જ છે. અને તે તું હો તો, હે લગવાન ! તને મારા નમરકાર હો.]

“ભવબીજાઙ્કુરજનના રાગાદ્યા: ક્ષયમુપાગતા યસ્ય ।
બ્રહ્મા વા વિષણુર્વા હરો જિનો વા નમસ્તસ્મૈ ॥”

[અર્થ : સંસારના બીજાંકુરને પેદા કરનારા (અર્થાત્ ભવ પરંપરાને વધારનારા) રાગ-દ્રેષ-મોહાદિ દોષો જેના ક્ષીણુ થઈ ગયા છે, એ પછી-પ્રદ્ધા હો, વિષણુ હો, મહાદૈવ હો કે જિન હો-ગમે તે હો, તેમને મારો નમરકાર થાઓ.]

હેમચન્-દ્રાચાર્ય મહાગીતાર્થ (શાસ્ત્રમર્મસ)

પુરુષ હતા. જૈનદર્શનના ઉત્સર્ગ-અપવાડ માર્ગના સમર્થ જાળુકાર હતા. આથી કથા સમયે, કથી પ્રવૃત્તિ સરયગુ છે કે અસર્યગુ, તેનો યથાયોગ્ય વિવેક અવશ્ય કરી શકતા. અલખત સાધારણુ કલ્ખાના સાધુઓ કે સંસારીઓ તેમનું અનુકરણુ કરી શકે નહિ.

ગમે તેમ, પણ હેમચંદ્રાચાર્યની ઉદાર અને વિશાળ મનોવૃત્તિના કારણે સિર્ફરાજ જીવનના અંત સુધી તેમનો પ્રખર આદર કરતો રહ્યો. સૂર્યિદેવને તેણે પોતાના પરમ કલ્યાણમિત્ર અને સત્તમાર્ગ દર્શક તરીકે સ્વીકાર્યો હતા.

[૬]

રાજ કુમારપાળને પ્રતિષેધ

પુત્રપ્રાપ્તિની સિદ્ધરાજની અંખના જીવનના અંત સુધી અધૂરી જ રહી. તેને પુત્ર ન જ થયો. તેથી તેનું મન વારંવાર વિષાદચુક્ત બની જતું હતું. તેને અંભિકાહેવીની ઉપાસના કારા જાણુ થઈ હતી કે, “ હે સિદ્ધરાજ ! તને પુત્ર નહીં થાય અને તારા પછી તારી ગાઢીએ કુમારપાળ આવશે. ”

કુમારપાળ પોતાના પછી રાજ બને તે વાત સિદ્ધરાજને મંજૂર ન હતી. તેથી કુમારપાળને મરાવી નાંખવા સિદ્ધરાજે ઘણ્ણાં પ્રયત્નો કર્યો હતા. પણ સિદ્ધરાજના દરેક પ્રયત્નને કુમારપાળે નિષ્ઠળ બનાવ્યા અને લલાટના લેખ સિદ્ધ થઈને જ રહ્યા.

કુમારપાળને સંરક્ષતા સ્તુરિવિદ્ય

કુમારપાળને સિદ્ધરાજના ભયથી સહા નાસતા

ભાગતા રહેવું પડતું. એક સમયની વાત છે. કુમારપાળ ત્રણુસો તાપસોના ટોળામાં તાપસવેશો પાઠણ આવ્યા હતા.

પરંતુ કુમારપાળના પગમાં રહેલી રાજરેખા-ઓના કારણે સિદ્ધરાજના શુપ્તચરોને વહેમ પડ્યો. કુમારપાળને પકડવા માટે સિપાઈઓ ઢાડયા. પણ કુમારપાળ છટકી ગયા. ભાગીને તે સીધા હેમચંડ્રાચાર્યાંજુના ઉપાશ્રેયે આવ્યા. ત્યારે કુમારપાળને ભયલીત જાણીને, સર્વસત્વસાધારણી કરેણુના સાગરસમા સૂરિદ્વિપ્રે તેમને તાડપત્રોના ઢગલાની વચ્ચે સંતાડી હીધા. આખી રાત કુમારપાળ ત્યાં રહ્યા અને વહેલી પરોઢ સૂરિદ્વિપની સલાહ મુજબ તેઓ શુપ્તવેશો નાસી છુટ્યા.

આ પછી આચાર્યાંદેવે પાઠણથી વિહાર કર્યો. સૂરિવરની લોકહિતકારી ધર્મોપદેશની પાવનગંગા ગુજરાતના આમ-નગરોમાં વહેવા લાગી. સૂરિદ્વિપ ફરતા ફરતા ખંભાત આવી પહેંચ્યા. ખંભાતમાં ને પૌષધશાળામાં સૂરિવર બિરાજમાન હતા, ત્યાં તો જ્ઞાનપ્રેમી સન્જનોની વિરાટ ભીડ જમા થતી. જણે કોઈ મહાવિદ્યાલયન હોય, તેવું દશય સંબંધું હતું.

સૂરિજીની ભવિષ્યવાણી

એક વખત કુમારપાળ ખંભાત આવી ચઢ્યા. શુપ્તવેશો રાતના સમયે તે સૂરિદ્વિપને મળવા આવ્યા.

સામુદ્રિક શાસ્ત્રના જાણુકાર સૂરજિએ કુમારપાળના લક્ષ્યણે જોઈને તેને જણ્ણાંયું કે, “હે કુમારપાળ ! તમારા ઉજ્જવળ દિવસે હવે નજદિકમાં જ છે. આજથી સાતમા વર્ષે તમે રાજ થશો. વિક્રમ સંવત ૧૧૬૬ના માગસર વદ ચોથ અને રવિવારે ત્રીજા પહેંચે પુણ્યનક્ષત્રમાં તમારો રાજ્યાલિષેક થશો.”

આવી ચોછ્ઝસ અને સચોટ આગાહી સૂરિદેવે કરી તે સાંલળીને કુમારપાળ પ્રસન્ન થયા. અને તેણે જણ્ણાંયું કે, “સૂરિવર્ય ! જે આપની આગાહી સાચી પડશે અને હું રાજ થઈશ તો, આપને મારા શુકુ તરીકે સ્થાપિત કરીશ. પણ હું....તે માટે મારી એ શરતો છે. એક, હું શિવજીનો કદર ભક્તા છું. તેથી તમારે મને ‘નૈન’ બનાવવાનો પ્રયત્ન કરવો નહિ, અને બીજી, તમારે મને માંસાહાર છોડવાની વાત ઊવી નહિ, કેમકે માંસ મને અતિ પ્રિય છે.”

ત્યારે સૂરિદેવે કહ્યું : “કુમારપાળ ! આવી શરતો કરવાની કોઈ જરૂર નથી. એ તો જે સમયે, જે ચોણ્ય હશે તે થશો.”

ત્યારખાદ મન્ત્રી ઉદ્ઘયન સાથે કુમારપાળનો પરિચય કરાવીને તેને સંપૂર્ણ સહાયતા કરવાની ખાસ સૂચના સૂરિદેવે ઉદ્ઘયનને આપી.

કુમારપાળે કરેકી શરતો ઉપરથી સમજી શકાય છે કે તેનું લુલન મિથ્યાત્મ અને અવિરતિના

કેવા લીખણું સક્ષમાં લીંસાચેલું હતું છતાં, આવા પુરુષને પણ પોતાની જ્ઞાનપ્રતિલાં અને સંયમશુદ્ધિના ગ્રબળ સામથ્યથી હેમચન્દ્રાચાર્યે ‘પરમાહૃત’ની કક્ષા સુધી લાવી મૂક્યો. આ વાત હેમચન્દ્રસૂરિજીના પ્રખર અને પનોતા પ્રલાવનું પ્રતીક છે.

કુમારપાળનો રાજ્યાલિષેક

હેમચન્દ્રાચાર્યની લવિષ્યવાણી સાચી પડી. સિદ્ધરાજ જ્યસિંહના મૃત્યુ ખાદ, છેલ્લાં સાત-સાત વર્ષનો કાળ કપરા સંકોટામાં પસાર કરીને, અંતે વિ. સં. ૧૧૬૬માં કુમારપાળ ગાઢીએ આવ્યા. સૂરિદ્વારે ભાગેલી તિથિ, વાર અને નક્ષત્ર સમયે જ કુમારપાળનો રાજ્યાલિષેક થયો.

સિદ્ધરાજના અવસાન ખાદ, તેના અમાત્યોએ જ કુમારપાળની યોગ્યતા જેઈને તેને રાજ તરીકે પસંદ કર્યો.

પચાસ વર્ષની ઉભમરે તેઓ રાજ બન્યા.

કુમારપાળને પોતાના પ્રાણુરક્ષક જીવનદીતા હેમચન્દ્રાચાર્ય પ્રત્યે અથાગ બહુમાન હતું. તેથી તેણે ખાસ વિનંતી કરી અને તેથા હેમચન્દ્રસૂરિજી પાટણું પદ્ધાર્યો.

કુમારપાળે સૂરિદ્વેવનું ભારે બહુમાન કર્યું. તેમને નમસ્કાર કરીને કહ્યું : “આચાર્યવર ! આપે તો મને જીવનદાન આપ્યું છે. વળી આપની આ-

ગાહી સંપૂર્ણ સાચી પડી છે. માટે આ રાજ્ય આપનું જ છે. આપ તેનો સ્વીકાર કરો. અને મને ઝણુમુક્ત કરો.” ત્યારે હેમચન્દ્રાચાર્યે કહ્યું : “ હે રાજ્ય ! અમે તો સંયમી સાધુ છીએ. પંચ મહા-પ્રતોના પાલણુહાર છીએ. અમને ધન, સંપત્તિ કે સત્તાનો પરિશ્રેષ્ઠ ન ખપે. પરંતુ તમે તમારા રાજ્યમાં અહિંસાનું સામ્રાજ્ય સ્થાપો. તો અમે ખૂબ પ્રસન્નતા પામીશું.”

પરંતુ કુમારપાળ સમગ્ર રાજ્યમાં અમારિની ઘાથણું ત્યારે જ કરાવી શકે....કે જ્યારે તે પોતે માંસાહારનો ત્યાગી બને. સૂરિદેવ આ માટે કોઈ સુયોગ્ય તકની પ્રતીક્ષામાં હુના અને એ તક એક સમયે સાંપડી ગઈ.

સૂરિદેવ સાથે સોમનાથયાત્રા

પ્રલાસ પાટણના સોમનાથ મહાદેવના મંદિરનો જિરોંદ્રાર કરીને તેને પત્થરનું લભ્ય મંદિર બનાવવા માટે પુજારીઓએ કુમારપાળને વિનંતી કરી. ત્યારે તણે સૂરિદેવને પૂછ્યું : “ ગુરુદેવ ! આપ જાણો. છો કે હું શિવજીનો લક્ષ્ય છું. મારા ભગવાનનું મન્દિર જલની પૂર્ણ થાય અને નિર્વિદ્ધને અની જાય તે માટે હું શું કરું ? ”

ત્યારે સમયજ્ઞ સૂરિદેવ બોલ્યા : “ રાજ્ય ! આ માટે તો કાં તો તમારે પૂર્ણ પ્રલાચયં-મૃત લેલું

નેછાંએ અથવા તમને ખૂબ વહાલી ને ચીજ હોય
તે છોડવી નેછાંએ. તો વિધનોના વાદળાં વિભેરાઈ
નાય. ”

કુમારપાળે પોતાને અતિ પ્રિય માંસનો—જ્યાં
સુધી મન્દિર નિર્માણનું કાચ્ય પૂણું ન થાય ત્યાં સુધી-
ત્યાગ કર્યો. એ વર્ષમાં જ મન્દિરનો પુનરુક્ષાર પૂણું
થયો. ત્યારે વિનયી કુમારપાળે ગુરુદેવને પૂછ્યું:
“ ગુરુદેવ ! હવે તો હું માંસ આઈ શકું ને ? મારી
પ્રતિજ્ઞા પૂણું થઈ ગઈ છે. ”

ત્યારે અતિકુશળ આચાર્ય બોલ્યા : “ જ્યાં
સુધી સોમનાથના શિવલુના દર્શન ન કરે ત્યાં
સુધી તમે આ પ્રતિજ્ઞા છોડો તે ઉચ્ચિત નથી. ”

કુમારપાળને આ વાત ચોગ્ય લાગી. તેણું પો-
તાના પુરોાહિતોને જણાવ્યું....ત્યારે તેઓ, ‘જિન-
ધર્મના પરમોપાસક આ જૈનાચાર્ય શિવજી પ્રત્યે
આઠલો આદર કેમ દર્શાવે છે.’ તે માટે નવાઈ
પામ્યા. પણ તેમણે વિચાર્યું કે, ‘જે આ આચાર્ય
કુમારપાળને ‘પોતાનો’ બનાવવા માટે જ આવી
ચાલખાજી રમતા હોય તો આપણે તેમને ઉધાડાં
પાડી દઈશું.’

પુરોાહિતોએ કહ્યું : “ રાજનુ ! આચાર્યશ્રીની
વાતો તો ઘણી સારી છે. આપે જરૂર સોમનાથની
યાત્રાએ જવું નેછાંએ, પણ તે માટે આપે સૂર્યિકરને
પણ સાથે જ લેવા રહ્યા. ”

રાજાલુએ જ્યારે સૂરિહેવને પણ સાથે જ સોમનાથયાત્રા પ્રસંગે પધારવા વિનંતી કરી ત્યારે સૂરિવરે તેનો સ્વીકાર કર્યો. તે જાણીને પુરોછિતો ખરેખર સ્તબ્ધ બની ગયા.

સોમનાથ મહાદેવનું મન્દિર દેવવિમાન તુલ્ય ભવ્યતાને પામ્યું હતું. શત્રુંજયની યાત્રા કરીને સૂરિહેવ સોમનાથ પધારી ગયા. ત્યારે કુમારપાળની સાથે, રાજાની વિનંતીથી સૂરિહેવે મહાદેવની સ્તુતિ કરતાં ‘યત્ તત્ સમયે.’ અને ‘ભવબોજાંકુર જનના.’ શ્રદ્ધાંકો ઉચ્ચાર્યાં અને મહાદેવને (નિશ્ચયથી તો વીતરાગદેવને) નમસ્કાર કર્યા. ■

કુમારપાળને સૂરિહેવની આ સમર્થિતા અને નિષ્પક્ષવૃત્તિના કારણે અતિશય બહુમાન પેઢા થઈ ગયું.

મંદિરના ગલારામાં કુમારપાળે સૂરિવરને પૂછ્યું : “ ગુરુહેવ ! મહાદેવ જેવો આ જગતમાં કોઈ હેવ નથી. આપના જેવા કોઈ ગુરુ નથી. અને

■ એક મતાનુસાર આ બને શ્રદ્ધાંકો સિદ્ધરાજ સાથેની સોમનાથયાત્રામાં હેમચન્દ્રાચાર્ય બોલ્યા છે. અન્ય મતે, કુમારપાળ સાથેના ઉક્ત પ્રસંગે સૂરિહેવ આ શ્રદ્ધાંકો બોલ્યા છે. બને રાજાએ સાથે સૂરિહેવ યાત્રા કરી હોય, અને બને વખતે આ શ્રદ્ધાંકો બોલ્યા હોય, તેમ પણ અસ્થાન્ય નથી.

મારા કેવેઃ કોઈ તત્ત્વાથી (તત્ત્વજિજ્ઞાસુ) નથી. કેવો ભવ્ય થયો છે આ ત્રિવેણી સંગમ ! તો આપ મને કહો કે, બધા ધર્મો પરસ્પર વિરોધી વાતો કરે છે તો તેમાં સાચું શું ? ”

ત્યારે સૂરિદ્વિલે જણાયું : “આ બધી શાસ્ત્ર-ચર્ચાઓનો કોઈ અંત નથી. અને તેનો અત્યારે અર્થ પણ નથી. પરંતુ તારો આ સવાલ તું શિવ-જીને પૂછી લે. તેઓ તો અવશ્ય સાચો જનાબ આપશે ને ? હું મન્ત્રજાપ કરું છું. અને તું તેમના ઉપર કપૂર નાંખતો રહો. અને હમણાં જ શિવજી પ્રગટ થશો. ”

બસ....સૂરિવિદેશ મન્ત્રજાપ શરૂ કર્યો. અને થોડી જ ક્ષણોમાં એક દ્વિત્ય વર્તુળ પેઢા થયું. એક તેજ-પુંજમાંથી શિવજી (મહાદેવ) પ્રગટ થયા. ગળામાં સર્પ ! સર્પના માથે ઝણુા ! માથામાંથી ઉડતી ગંગાની ઉદ્ઘગમ જલધારા ! સૂરિદ્વિ બોલ્યા : “આ રહ્યા મહાદેવ શિવજી ! રાજન્ ! તમે તમારો પ્રશ્ન પૂછી વ્યો. ”

કુમારપાળે પૂછ્યું : “મહાદેવજી ! સાચો ધર્મ કર્યો ? ”

ત્યારે મહાદેવજીએ કહ્યું : “રાજન્ ! તને ધન્ય છે. તારી તત્ત્વજિજ્ઞાસાને પણ ધન્ય છે. ને ખરેખર તું સાચો ધર્મ જાણવા ઈચ્છતો હોય તો,

તારા સફશુરુની જ તું ઉપાસના કર. તેઓ જ તને
સદ્ગર્મનો રાહ ચીંધશે. તારા આ ગુરુ સંયમી
(શરેદામણી છે. પ્રત્યક્ષ પરમથ્રદ્વારા છે. તેમની સેવાથી-
આજાના સ્વીકારથી-તું તારો આ જનમ સફળ કરી
શકીશ. ”

કુમારપાળનો માંસાહારત્યાગ

બસ આટલું કહુને શિવજી અન્તર્ધાન થઈ
ગયા. ત્યારબાદ કુમારપાળે હેમચન્દ્રાચાર્યને કહું :
“બસ ગુરુદેવ ! હવે તો આપજ મારા ગુરુ છો. મારા
જેવા પતિતના પાવન-સમુદ્ધારક છો. ”

આ સમયથી કુમારપાળે હેમચન્દ્રાલુસુરિને
પોતાના પરમકલ્યાણુભિત્ર સફશુરુ તરીકે, જીવનના
સમુદ્ધારક સર્વસ્વ તરીકે, સ્વીકારી લીધા. પછી તેણે
પૂછ્યું : “ગુરુદેવ ! આપે સિદ્ધરાજ્યો મને બચાવ્યો।
અને જીવનદાન આપ્યુ.... મારો આ લવ સુધાર્યો. હવે
આપ મને સદ્ગર્મનું દાન કરો અને મારો આત્મા
સુધારો. મારા પરલવને પણ સુધારો. ”

આ સમયે, સમયજી સૂરીશરે, જેમ તપેલા
લોઢા પર કુશળ લુહાર ધા ઝીંકી હેછે તેમ, કુમાર-
પાળને જણ્યાંનું : “સદ્ગર્મ પામવા માટે જૌથી
પહેલાં, હે રાજનુ ! તમે માંસલક્ષણુનો જીવનલક્ષ
સંપૂર્ણ ત્યાગ કરો. ”

અને....કુમારપાળે ગુરુવાણીને, ચાતક જેમ

મેધજળને પીઓ તેમ, અંતરમાં ઉતારી લીધી. શુકુ-
આદેશ અનુસાર કુમારપાળે માંસાહારત્યાગની
પ્રતિજ્ઞા લઈ લીધી. એટલું જ નહિ, શુકુઆદેશના
પ્રતાપે માંસ, મદિરા, જુગાર, શિકાર, ચોરી અને
અસત્ય-આ સધળા પાપો કુમારપાળે તળુ હીધા.

આ પછી તો ધીરે ધીરે હેમચન્દ્રાચાર્યના
સત્સંગની અને સન્મૈત્રીની એવી પ્રચંડ અસર કુમા-
રપાળ ઉપર થઈ, કે સિદ્ધરાજ અને હેમચન્દ્રસૂરિ-
જીની સન્મૈત્રી કરતાં પણ તે જખરજસ્ત પૂરવાર થઈ.
ગુજરાતની ધરતીને અહિંસાથી મઠી હેવામાં, ના-
નામાં નાની જૂને મારનારને પણ સખત શિક્ષા
કરવા કારા અહિંસાને ગુજરાતમાં-આજ દિન સુધી
વ્યાપક બનાવવામાં કુમારપાળ કારા હેમચન્દ્ર-
સૂરીશરજી મહાન સિદ્ધિ હાંસલ કરવામાં સક્ષળ
બન્યા હતા.

કુમારપાળ જૈન બન્યા. ચુસ્ત શ્રાવક બન્યા.
સમ્યગુર્હર્થન પાંચ્યા. તે અંગે પણ ચમત્કારથુકૃત કથા
પ્રચલિત છે.

હેવાધિ કારા ચમત્કાર

હેવાધિ નામનો એક પંડિત મન્ત્ર-તન્ત્ર અને
ચોગવિદ્યાનો પ્રખર જાણુકાર હતો. તેને જૈનધર્મ
પ્રત્યે ભારે દ્રેષ હતો. કુમારપાળ હેમચન્દ્રાચાર્ય
તરફ વિશેષ પ્રીતિ ધરાવતા અને જૈન ધર્મ તરફ
અનુરક્ત થયા છે તે જાણીને તેને જૂબ અકળામણુ

થઈ. તે પાટણું આવ્યો. અને વિવિધ ચમત્કારો ક્ષારા પાટણું પ્રભાને મોહિત કરવા લાગ્યો. કુમારપાળે પણ તેને રાજસભામાં આવવાનું આમન્ત્રણું આપ્યું.

તે કુમારપાળની રાજસભામાં આવ્યો. તે જે રીતે આવ્યો. તે જેઈને રાજ અને સભાજનો આશ્ર્યથી સ્તપદ બની ગયા. એ પાલખીમાં એઠો હતો. કમળની કેમળ નાળના દંડવાળી તે પાલખી હતી. કેળના પાંદડાંએનું આસન હતું. કાચા સૂતરના તાતણે તે બંધાચેલી હતી. આઠ વર્ષના બાળકેએ તેને જાંચકી હતી. તેમાં કદાવર કાચાવાળે. પંડિત દેવાધિ વિરાજિત થયો. હતો. ચોગવિદાના પ્રભાવથી તેણે પોતાની કાચાને હલકી કુલ જૈવી બનાવી દીધી હતી. દેવાધિએ બીજા પણ અનેક પ્રયોગો કરીને રાજસભાને આશ્ર્યચુક્ત કરી મૂકી.

રાત્રિનિવાસ તેણે ત્યાં જ કર્યો. દેવાધિએ રાજ સાથે ધર્મચર્ચા કરતાં કહ્યું : “રાજનું ! જૈનો વેહાને ‘અપ્રમાણુ’ (ઝાટાં) માને છે. તેથી તમારે જૈનાનાચાર્યોને બહુમાન આપવું ન જોઈએ.”

ત્યારે કુમારપાળે સારુ કહ્યું : “પંડિતજી ! વેહામાં પરસ્પર ધણેં વિસંવાદ (અગડંબગડ્) આવતો હોવાથી હવે મને વેહા પ્રત્યે બહુમાન રહ્યું નથી.”

તરવચર્ચામાં દેવાધિ ન કૂટયો, તેથી તેણે

કરી ચમત્કારો બતાવવા માંડયા. દેવષોધિએ પ્રહૃતી વિધ્યુ અને મહેશને સાક્ષાતું હાજર કર્યો. મૂળરાજ વગેરે કુમારપાળના સાત પેઢીના પૂર્વને-તેના માતા પિતાને પણ સદેહે હાજર કર્યો. અને તે સહુએ કુમારપાળને કહ્યું : “એટા ! તેં આપણો કુલધર્મ” (કુળપરંપરાથી ચાલ્યો આવતો વૈદિક ધર્મ) છોડી દીધો અને જૈન ધર્મ સ્વીકારો છે તે ચોંચ કર્યું” નથી. તારે વેહાને જ પ્રમાણુ (સાચાં) માનવાં જોઈએ.”

આ બધાં દશ્યો જોઈને કુમારપાળ ખૂબ સુંગ-વણુમાં પડી ગયા. તેમણે મન્ત્રીશર વાગ્ભટને બધી વાત કરી અને છેલ્લે પુછ્યું : “મારા ગુરુર્દેવ પાસે આવા કોઈ ચમત્કારો હશે ખરા ?”

“મારા ગુરુ” આ શાખાં સાંભળતાં જ મન્ત્રીશર પુલક્તિ બની ગયા. તેમને થયું : ‘ગમે તે થયું’ હોય પણ હેમચંદ્રસૂરિજી પ્રત્યે કુમારપાળનું મમણે ત્વ-બહુમાન-અવિચલ છે. અને તેથી ચોક્સ તેને પુનઃ જિનધર્મમાં સ્થિર કરી શકાશે.”

મન્ત્રીશર તરત સૂરિર્દેવ પાસે ગયા. અને તેમણે દેવષોધિના ચમત્કાર વગેરેની વાત કરી. કુમારપાળના મનનું સમાધાન કરવા માટે સૂરિર્દેવે મન્ત્રીને જણાવ્યું કે : “મન્ત્રીશર ! ચિંતા કરવાની જરાય જરૂર નથી. આવતીકાલે રાણને પ્રવચન સાંભળવા મારી પાસે લઈ આવનો.”

હેમચય-દ્રાચાર્ય કારા સવાઈ ચમતકારે।

ઓને દિવસે કુમારપાળ, મન્ત્રીશર વગેરે સહુ પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવ્યા ત્યારે સૂરિ-હેવ હેમચય-દ્રે સાત પાઠો જોડવડાવી. અને તેની ઉપર એસીને પ્રવચન આપવા લાગ્યા. પછી શિષ્યો કારા-એક પછી એક-એમ પાઠો ખસેડાતી ગઈ. આમ સાતે ય પાઠો જ્યારે ખસેડાઈ ગઈ ત્યારે આકાશમાં અદ્ધર-કોઈ પણ જાતના આધાર વગર એઠેલા આચાર્યદેવે હોઠ પ્રહૃત સુધી ધર્મહેશના આપી. કુમારપાળ તો આશ્રીયથી સ્તરબ્ધ બની ગયો.

હેવએાધિ કરતાં પણ આ દશ્ય તો અતિશય આશ્રીયંકારક હતું....કેમકે હેવએાધિ તો પાલભીમાં કેળના પાંડડા ઉપર એઠા હતા, જ્યારે સૂરિહેવ તો સાવ જ અદ્ધર એઠા હતા.

ધર્મહેશના પૂરી કરીને હેમ-દ્રસૂરિઝ નીચે પોતાના આસને એઠા. થોડી વારમાં તો ઉપાશ્રયની ખહાર વાળ વાગવાં લાગ્યા. કુમારપાળે પૂછ્યું : “ગુરુહેવ ! આ શેનો અવાજ છે ?”

સૂરિહેવ જોવ્યા : “ચોવીશ તીર્થંકરે અહીં પધારી રહ્યા છે. મૂળારાજ વગેરે તારા એકવીશ પેઢીના પૂર્વને પણ અહીં તને મળવા આવે છે.”

અને....ખરેખર ! આ બધા જ ત્યાં પધાર્યા. અને તે સહુએ રાજને કહ્યું : “એટા ! તેં ને અરિ-

હંત પ્રલુનો ધર્મ સ્વીકારો છે તે ખૂબ જ સરસ કર્યું છે. તને જે ગુરુ મહિયા છે તે અતિ ઉત્તમ છે. માટે તું સદ્ગર્મ એવા જિનધર્મથી ચાલેત થઈશા નહીં.”

કુમારપાળની મુંઅવણુનો પાર ન રહ્યો. તેમણે કહ્યું : “ગુરુહેવ ! મને હેવઓધિ દ્વારા આવેલા પૂર્વને કહે છે કે, ‘શિવધર્મ પાળજે.’ અને આપના દ્વારા આવેલા પૂર્વને કહે છે કે ‘જિનધર્મ પાળજે.’ તો આ બધામાં સાચું શું ?”

ત્યારે હેમચંદ્રાચાર્યે કહ્યું : “રાજનુ ! હેવઓધિ દ્વારા સર્જાંયેલા દર્શયો કે મારા દ્વારા સર્જાંયેલા દર્શયો-એમાંથી એકે સાચું નથી. આ બધી માયાજાળ છે. ઈન્ડ્રાજાળ છે. સાચું માત્ર તે જ છે કે... કે તમને સોમેશ્વર મહાહેવે કહ્યું હતું. માટે તમે કે જિનધર્મ પાણ્યા છો તેમાંથી ચલાયમાન થવાની જરૂર નથી.”

આ પ્રસંગ બાદ....કુમારપાળના મનતું સમાધાન થઈ ગયું. તેઓ નિર્મણ સમ્ભગદૃષ્ટિ બન્યા. જિનવચનમાં તેમનો વિશ્વાસ ચ્યાલમજીઠના રંગ જેવો બની ગયો. ત્યારઝાદ તેઓ ઉત્તમ દેશવિરતિધર શ્રાવક બન્યા. એટલું જ નહીં, એક સમયે તેઓ એવી સિદ્ધિ પાણ્યા કે સૂરિહેવ હેમચંદ્રે તેમને “પરમાહૃતુ” [પરમ શ્રાવક] અને “રાજર્ષિ” [રાજ છતાં ઋષિ] જેવા માનવંતા બિરુદ્ધાથી સન્માન્યા.

કુમારપાળની પ્રલુબ-પ્રાર્થના

સૂરીશ્વર હેમચન્દ્રના પુનિત પ્રતાપે કુમારપાળને જિનધર્મ પ્રત્યે કેવેા અવિહૃદ પ્રેમ જાગ્યો હતો તે તેમની નીચેની પ્રાર્થના ઉપરથી સમજુ શકાય છે :

“ વિષયાનુબન્ધબન્ધુર-મન્યન્ન કિમપ્યતઃ ફલં યાચે । ઇચ્છામ્યેક જન્મનિ, જિનમતરાગં પરત્રાડપિ ॥ ”

અર્થાત्—“જેના ક્ષારા વિષયેની પર'પરાનું સર્જન થાય તેવા કોઈ સુંદર (ભૌતિક રીતે સરસ) અન્ય કોઈ ક્ષળની હું, હે પ્રલો ! યાચના કરતો નથી.

“હું તો, પ્રલો ! નવા જ-મમાં પણ એક માત્ર જિનમતના અનુરાગને પાસું એ જ ઈચ્છું છું.”

આ ઉપરાંત, કુમારપાળની વિક્રતાના પ્રતીક સમી, તેણે સ્વયં રચેલી ‘આત્મનિન્દા-ક્ષત્રિંશિકા’ ની છેલ્લી-તેંત્રીશમી સ્તુતિ પણ અતિશય લાવવાહી છે અને કુમારપાળના જિનવચન પ્રત્યેના અર્વિહૃદ આદરભાવને અનુપમ રીતે રજૂ કરે છે. આ રહી તે સ્તુતિ:

પ્રાપ્તસ્ત્વં બહુભિ: શુભેસ્ત્રિજગત-શ્ચૂડામળિર્દેવતા,
નિર્વાણપ્રતિભૂરસાવપિ ગુરુ: શ્રીહેમચન્દ્રપ્રમુ: ।

તન્નાત: પરમસ્તિ વસ્તુ કિમપિ
તવાગ્રતોઽભ્યર્થે

કિન્તુ ત્વદ્વચનાદરઃ પ્રતિભવં
સ્તાદ् વર્ધમાનો મમ ॥
(શાલ્લાલિકિડીડિત)

અર્થાત्—“ધણ્ણા પુણ્યના ઉદ્ઘાટની મને તારા જેવો
ત્રણુ જગતના ચૂડામણુ—સમાન ‘હેવ’ પ્રાપ્ત થયો
છે !! અને નિર્વાણુ (મોક્ષ)ને અપાવી શકવામાં
સમર્થ આ ગુરુ શ્રી હેમચંદ્રસૂરિજી મળ્યાં છે !!
આનાથી અડિયાતી કોઈ ચીજ આ હુનિયામાં નથી,
કે જેની હું તારી આગળ માંગણી કરું ! હા !!
માત્ર એટલું માગું છું કે લવોલવને વિષે મારો
તારા વચ્ચેનો પ્રત્યેનો આહરલાવ સતત વર્ધમાન
(વધતો જતો) બની રહો. ”

પ્રભુ પ્રત્યેની આ પ્રાર્થનાઓમાં કેવો અફ્લુટ
અગારાં મારી રહ્યો છે : રાજ કુમારપાળનો વાંછનીય
જિનમતપ્રેમ !

[૭]

‘પતિત’ માંથી ‘પરમાહોત’

કુમારપાળને જૈનદર્શનનો સ્યાફવાદ (અનેકાતવાદ) ખૂબ ગમી ગયો હતો. સ્યાફવાદ નો સિદ્ધાંત અને સ્યાફવાદ-શૈલીના જીવંત સમારાધક સૂરિશ્રીના સત્તસંગના કારણે કુમારપાળ પનોતા પ્રલાવક પુણ્ય-પુરુષ બન્યા.

આ સિવાય અન્ય કારણોમાં—કુમારપાળને રાજ-ગાડી મળી ત્યારે તેની વચ્ચે પચાસ વર્ષની હતી. ત્યાર બાદ લગભગ બીજા કેટલાક વર્ષો તેને રાજકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં ગયા. આ બધા વર્ષોમાં હેમચન્દ્રાચાર્યનો સત્તસંગ અને ચૌહુકયવંશની પરંપરાની પણ અસર તેના ઉપર થઈ હતી. રાજ-કાજમાં તેને મળેલા ઉદ્ઘાન, આગ્રબદ્ધ અને વાગ્-ભટ્ટ વરેરે મંત્રીઓ ચુસ્ત જૈન હતા. અને હેમચન્દ્ર-સૂરિના લક્ષ્ણ હતા. આ બધાના કારણે પણ હેમ-

ચંદ્રાચાર્ય પ્રત્યે કુમારપાળનું આકર્ષણું વધુ રહ્યું. સતત આચાર્યશ્રીના સત્તસંગના કારણે તે પરમ અહિંસાપ્રેમી અને વૈરાગી બની ગયો હતો.

કુમારપાળ દ્વારા અમારિનું પ્રવર્તન

“ સગગ્હો કેહિ કરિ જીવદ્યા ”— સ્વર્ગ અને અપ્રવર્ગની પ્રાપ્તિનો માર્ગ જીવદ્યા જ છે, તેથી તેનું જ તું પાલન કર—હેમચંદ્રાચાર્યના આ ઉપદેશને કુમારપાળે જીવનમાં વધી લીધો. પરિણામે કુમારપાળ જીવ માત્ર પ્રત્યે કરુણાનો સાગર બની ગયો. અન્ય જીવાની પીડાને સ્વયં અનુભવતો આ રાજનું, રાજ મટીને ‘રાજખિ’ બની ગયો.

જે ઓલી શક્તા નથી તેવા મૂંગા પ્રાણીએનો વધ થતો અટકાવવા માટે, કુમારપાલે ખાસ આદેશો (વટહુકમો) બહાર પાડ્યા હતા. ગુજરાતના કવિ નાનાલાલના શફ્ફોમાં કહીએ તો — જે જીવને જીવવાનો હક્ક—આ શફ્ફોને “ અમારિધોષખા ” દ્વારા કુમારપાળે યથાર્થ ઠરાવ્યા હતા. અને એ રીતે ગુજરાતલરમાં ગ્રેમ અને અહિંસાનું તેમણે સામ્રાજ્ય સ્થાપ્ય હતું.

રાજ કુમારપાળના અઢાર રાજયોમાં—સર્વત્ર—જીવહિંસા ઉપર સખત પ્રતિબંધ હતો. એક વાર એક પ્રસંગ બન્યો.

એક ઝીએ ચોતાના માથામાંથી જૂ કાઢીને તેના પતિને આપી. પતિએ તે જૂને મારી નાંખી

અને બોલ્યો : “હે ! આ જૂ મારી નાંખી. પેલો કુમારપાળ મને શું કરી નાંખવાનો છે ?”

રાજના ગુપ્તચરે આ વાત સાંભળી ગયા. તે જૂ મારનારા લાખોપતિ શેઠને પકડવામાં આવ્યો. તેનું તમામ ધન રાજએ લઈ લીધું અને તેમાંથી “ચુકાવિહાર” નામનું જિનમન્દિર બંધાવાયું.

રાજ કુમારપાળે પોતાના અઢાર રાજ્યો ઉપરાંત બીજા ચૌદ રાજએના રાજ્યોમાં પણ મૈત્રીના સંબંધે કે અઢળક ધનદાન કરીને તે રાજ્યોમાં પણ સમૃષ્ટું ‘અમારિનું’ પ્રવર્તન’ કરાવ્યું હતું. એક સમયના માંસાહારલક્ષી કુમારપાળનું આ કેવું આહૂલાદપ્રેરક અને અનુમોદનીય જીવનપરિવર્તન !!

મંકોડાની પણ જીવરક્ષા કરતા રાજ

એક વાર રાજ કુમારપાળે પૌષધવત આરાધ્યું. તેમના હાથ ઉપર એક મંકોડો ચેંટી ગયો. તેને દૂર કરવા તેમણે પ્રયત્ન કર્યો. બીજા શ્રાવકો જ્યારે તેને ખેંચી લઈને દૂર કરવા તૈયાર થયા ત્યારે કુમારપાળે તેને અટકાવ્યા, કારણે કે તેમ કરવામાં મંકોડો મરી જવાનો સંલવ હતો. તેમણે તરત એક ધારદાર છરી મંગાવી અને જાતેજ તેટલી ચામડી ઉતરડી લીધી. અને ચામડી-સહિત મંકોડાને દૂર ભૂકીને તેને જીવનદાન આપ્યું.

ગુજરાધિપતિ કુમારપાળ પાસે અગિયાર લાખ

ઘોડાએ હતા. આ તમામ ઘોડાએને કુણુંઘેર ગામ-માં (જે આજે ય પાટણું પાસે વિધમાન છે) રખાતા. ત્યાં વિશાળ અંધશાળાએ હતી. આ તમામ ઘોડા-એને ગાળેલું જ પાણી પીવડાવવાની ગોઠવણું કરવામાં આવી હતી. દરેક ઘોડાની પલાણું ઉપર એક પૂંજણી ખાંધવામાં આવતી. પૂંજણી દ્વારા પલાણુંને પૂંજયા ખાંદ જ તેની ઉપર અસ્વાર સવાર થઈ શકતો. રાજાની આ આજાનો ચુસ્તતાપૂર્વક અમલ કરવામાં આવતો હતો.

દ્યાળુ છતાં સત્ત્વશાળી કુમારપાળ

નિર્દોષ જીવોની સદા રક્ષા કરતા કુમારપાળ અવસર આવે, રાજ્યના શત્રુઓની સામે તલવાર ચલાવવામાં જરા ય ઉણું ઉત્તરતા ન હતા.

એક વખત તેમને ચુદ્ધમાં ઘોડાની પલાણુને પૂંજણીથી પૂંજતા અને નાના જીવોની રક્ષા કરતા જોઈને એક રાજ્યપૂત હસી પડ્યો અને ઓદ્યો : ‘આવો દ્યાળુ રાજ શત્રુઓને શી રીતે મારી શકશો ?’

આ વાત કુમારપાળ સાંભળી ગયા. અને તેઓ ઓદ્યો : ‘આ કુમારપાળનું સત્ત્વ તારે જોલું છે ! તો કે લે.’ આમ કહીને રાજાએ પોતાના જ પગ ઉપર તલવારનો લાદો ઝીંકી ઢીધ્યો. લોહીની સેર વધુટી. પણ કુમારપાળનું સુખ મલકી રહ્યું હતું. પછી તેમણે કહ્યું : ‘જે કુમારપાળ નિર્દોષ અને અણોલ

પ્રાણીઓની દ્યા અને રક્ષા કરી શકે છે, તે જ કુમારપાળ અવસર આવે રાજ્ય, ધર્મ, સંસ્કૃતિ અને નિર્ણાયક પ્રભાજનોના ફુઝમનોના માથા પણ વાઠી શકે છે, એ ભૂતીશ નહિ. રાજ્યિ અને મહર્ષિના ધર્મો જુદા જુદા છે. કુમારપાળ રાજ્યિ છે. અને રાજ્યિનો ધર્મ છે : સહોખને શિક્ષા અને નિર્ણાયની રક્ષા ! જ્યારે મહર્ષિનો (સાધુનો) ધર્મ છે : સહોખ અને નિર્ણાય બેઉની રક્ષા ! બેઉની હ્યા ! ”

રાજ્યિ કુમારપાળની આ શૂરવીરતા અને આ ધર્મધીરતા જોઈને પેઢો રાજ્યપુત ઝુશ થઈ ગયો. તેણે રાજ્યિની ક્ષમા માંગી.

કંટકેશ્વરીના રોપ સામે આણુનમ રાજ

હેમચ-દ્રસ્સુરિલુના પુનિત સત્તસંગના પ્રલાવથી કુમારપાળે પશુવધના પ્રતિબંધની રાજાણા ઝરમાવી હતી. પણ તેની સામે તે સમયના રુદ્ધિયુસ્ત ધર્માંધ્યો. તરફથી વિરોધી સૂર જ-ભ્રા હતા. રાજાએ કંટકેશ્વરી દેવીને આપાતો પશુલોાગ બંધ કરાવ્યો. ત્યારે, એવી વાતો પ્રભામાં ફેલાવાઈ કે, ‘જે દેવીને પશુભલિ આપવામાં નહિ આવે તો રાજ્ય ઉપર અને પ્રભ ઉપર તેની મહાન આકૃત ઉતરી આવશે.’ પરંતુ કુમારપાળે તે વાતોની કશી જ પરવા ન કરી.

કંટકેશ્વરી દેવીએ, કુળપરંપરાથી ચાલ્યા આવતા પશુલોાગને આપવા માટે કુમારપાળને

આથહ કચો ત્યારે તેણે સારુ ના પાડી હીધી. તે ખાતર જરૂર પડે અઠાર દેશનું સ્વામિત્વ તળ દેવાની તત્પરતા પણું બનાવી અંતે ઉત્ત્ર રોષે લરાયેલી હેવીએ ત્રિશૂળ દ્વારા કુમારપાળને કુષ્ટ રોગી બનાવી હીધો. પરંતુ પાછળથી, જિનધર્મની અવહેલના ના થાય તે માટે, ચોગલબિધના લંડાર એવા હેમચન્દ્રાચાર્યજીએ કુમારપાળનો દેહ પુનઃ પૂણું નારોગી અને સ્વસ્થ બનાવી હીધો.

આમ, જીવમાત્રની ચુરક્ષા કરવા માટે ચોતે કરેલી ‘અમારિદ્વાષણું’ ને કુમારપાળે પ્રાણુના લોગો જાળવી રાખી હતી. કુમારપાળે સમય ગુજરાતમાં અહિંસાનો મહાન વિજયધવજ લહેરાતો મૂક્યો. નિવંશનું ધન રાણ કંબને કરી કે, આવા અમાનુષી નિયમને કુમારપાળે રહભાતલ કરાવ્યો. હતો. કુમારપાળના હુદ્દયમાં હેમચન્દ્રસૂરીધરજીએ જગાવેલી પરમ કારુષ્યવૃત્તિના પ્રતીક ઇપ આ હકીકતો આપણુંને ‘કુમારપાળ અને હેમચન્દ્રાચાર્યે’ ગુજરાતને અપોલી અફલુત સંસ્કાર સમૃદ્ધિ નો જ્યાલ આપી જાય છે.

ભગવાન મહાવીર કરતાં થ
ચાહિયાતી જીવરક્ષા

હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ દ્વારા જે મહાન જીવરક્ષાનો ધર્મ ફેલાયો હતો, તે ખુદ ત્રિલો-

કનાથ જગતપુરુજનીય પરમાત્મા મહાવીરહેવ અને રાજ શ્રેણીક કરતાં પણ મહાન હતો....

આ અંગે એક અતિ સુંદર શ્લોક છે :

શ્રી વોરે પરમેશ્વરે�પિ ભગવત્યાખ્યાતિ ધર્મ સ્વયં,
પ્રજાવત્યભયેઽપિ મન્ત્રણિ ન યાં કતું ક્ષમઃ શ્રેણિકઃ ।
અકલેશોનાપિ કુમારપાલ નૃપતિસ્તાં જીવરક્ષાં વ્યધાદ,
યસ્યાસાદ્ય વચઃ સુધાં સ પરમઃ શ્રી હેમચન્દ્રો ગુરુઃ ॥

અર્થાત् — “જે સમયે પરમાત્મા મહાવીરહેવ સ્વયં ધર્મહેશના વહોવી રહ્યા હતા; શ્રી અભય-કુમાર જેવા બુદ્ધિનિધાન મહામંત્રી હાજર હતા; તે છતાં શ્રેણીક જેવા પરમ શ્રાવક જે જીવરક્ષા કરાવી ના શક્યા, તે જીવરક્ષાને, પરમગુરુ શ્રી હેમચન્દ્ર-સૂરિજીની અમૃતતુલ્ય વચનધારાને પીને (પામીને) અતિ સહજતાથી (કલેશરહિતપણે) કુમારપાળ રાજ કરાવી શક્યા.”

કુમારપાળના હૃદયમાં રહેલી દ્વારાવૃત્તિ, કારુષ્ય-ધર્મ, વિનભ્રતા, સરળતા, સહૃદયતા, વિશ્વ પ્રત્યેનો વાત્સલ્યલાલ, જિનધર્મ પ્રત્યેની અસીમ નિષ્ઠા અને શુકુ પ્રત્યેનો લક્ષ્ણિતલાલ.... આ બધા સફશુલ્લોના કારણે કુમારપાળને મળેલું ‘પરમાર્થતુ’ બિનુદ યથાર્થ જ હતું. અને આ રીતે એક સમયના ‘પતિત’ કુમારપાળને ‘પરમાર્થતુ’ બનાવવામાં હેમચન્દ્રાચાર્યજીનો નિઃશંકપણે આપૂર્વ કર્ણો હતો.

આરતિ ઉતારી રાજ કુમારપાળે

કુમારપાળ અરિહંત લક્ષ્ણિનો અનોખો આરાધક હતો. પોતાના લુવનકાળમાં તેણે ચૌદસો શિખ-રખંધી જિનાલયો સ્વદ્રવ્યથી (પોતાના પૈસે) બંધાવ્યા હતા. પોતાના પિતાશ્રી ત્રિલુલુવનપાળના નામનું ‘ત્રિલુલુવનપાળ-વિહાર’ છન્ઠું કરેાડ સોના મહોરેના સફ્ફુલ્યયપૂર્વક બંધાવ્યું હતું. સોણસો પ્રાચીન જિનમનિદરોનો તેણે જિણોદ્ધાર કરાવ્યો હતો!. રોજ ચતુરંગિણી સેના સાથે, મધ્યાહ્નકાળે ભારે ઠાકુર્પૂર્વક રાજ જિનપૂજા કરવા જતા, ત્યારે અનેક કરેાડાધિપતિઓ રાજબિં સાથે જોડાતા. રાજબિં જાતે પ્રલુલુની લભ્ય અંગરચ્ચના કરતા. ઉત્તમ કોટિના તાજ પુણો દ્વારા તેઓ ‘કુલપૂજા’ કરતા.

એક વાર એક જિનાલયમાં, ધૂળેવા મંડપમાં આરતિ ઉતારતા છ યે ઋતુના કુલો એક સાથે ચઢાવીને તેના દ્વારા પરમાત્માની આંગળી બનાવવાનો મનોરથ કુમારપાળને પેદા થયો. અને સંકલપના પ્રચંડ બળો હૈવીશક્તિના પ્રલાસે ષદ્ધાષ્ટુઓના કુલો બગ્ગીચામાં પેદા થઈ ગયા. તેની લભ્ય આંગળી બનાવીને રાજબિંએ પોતાના ઉપવાસનું પારણું કર્યું હતું. આથી જ આપણે આરતિમાં ગાઈ એ છીએ ને કે.... ‘આરતિ ઉતારી રાજ કુમારપાળે.’

રાજએ સાત વખત શત્રુંજય તીર્થનો છ ‘રી’ પાળતો સંધ કાઢ્યો હતો. યાત્રિકોને શીળી છાંયડી

દેતા વૃષ્ણોને પણ તે પ્રણામ કરતા. ખુલ્લા પગે ચાલતા કંઠા અને કંઠરાઓ પણ વાગતા. છતાં તેની પરવા કર્યો વગર ધર્મનિષ્ઠ આ પરમાર્હતુને જ્યારે સૂરિ-હેવે અપવાહ રૂપે જોડા વાપરવાની ધૂટ આપી ત્યારે પણ તે ધૂટનો રાજર્ષિએ વિનન્દતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો.

આમ, હેમચન્દ્રસૂરિજીના પુનિત પ્રલાવથી, રાજ કુમારપાળ :

અત્યંત વિનન્દ અને વિશિષ્ટ ગુરુલક્ત બન્યો.

સંસારના પ્રાણીમાત્રનો તે પરમભિત્ર બન્યો.

અહિંસા-ધર્મનો તે અઠંગ ઉપાસક બન્યો.

અરિહંતલક્તિનો તે અનોષો આરાધક બન્યો.

સર્વજ્ઞાનનો તે અનુપમ રસિક બન્યો.

પચાસ વર્ષે કુમારપાળ રાજ્ય પામ્યો હતો, છતાં તેનું બાહુભણ અને ખુદ્ધિભણ- બન્ને બહુ જોરદાર હતા. બાહુના બળો તેણે સુન્દર રીતે રાજ્ય ચલાવ્યું અને ખુદ્ધિના બળો તેણે મોટી ઉંમરે પણ પોતાનો જ્ઞાનપ્રેમ, સાહિત્યપ્રેમ જળવી રાખ્યો હતો. સાઈઠ વર્ષની ઉંમરે કુમારપાળે આજું ‘હેમવ્યા-કરણું’ [છ હંજર શ્વેષક પ્રમાણું] કંઠસ્થ કર્યું હતું.

સાધભીંકેનો સમુદ્ધારક કુમારપાળ

કુમારપાળે પોતાના સાધભીંકેના ઉષ્ણાર માટે પણ અનેરું ધન વાપર્યું હતું. તેનો એક સુંદર પ્રસંગ છે.

હેમચંદ્રાચાર્યજી જાડું ખરખચડાં જેવું વબ્ધ
પહેરીને એક લભ્ય શોલાયાત્રામાં ચાલી રહ્યા હતા.
ત્યારે કુમારપાળે સૂરજિલુને જેયા. તેનું શુરૂભક્તા
હૈયું વ્યથિત થયું. ઉપાશ્રયે આદ્યા બાદ તેણે સૂરી-
શરને પૂછ્યું : ‘ગુરુહેવ ! અઠાર હેશનો રાજ કુમા-
રપાળ આપનો લક્તા હોય અને આપને આવું
ખરખચડું વબ્ધ પહેરવું પડે, તે શું ચોંય છે ? આમાં
તો મારી નાલેશી થાય.’

ત્યારે હેમચંદ્રાચાર્ય એાદ્યા : ‘કુમારપાળ !
આવું વસ્ત્ર મને વહોરાવનાર તારા જ રાન્યમાં
રહેતો તારો હૈન સાધર્મિક છે. એ કેવો દરિદ્ર
હશે ! જેની પાસે ઉત્તમ વબ્ધ વહોરાવી શકાય તેટલું
ક્રદ્ય જ નથી. આવા દીન-દુઃખી જીવોના ઉદ્ધાર
માટે તું શું કાંઈ જ નહિ કરે ?’

અને ત્યારખાદ દર વખે એક કરોડ સુવર્ણ-
મુદ્રાઓ કુમારપાળ દીન સાધર્મિકોના ઉદ્ધાર માટે
વાપરતા હતા. આ ગ્રસંગ બાદ ચૌદ વર્ષ કુમાર-
પાળ જીવ્યા હતા. અને ચૌદ કરોડ સુવર્ણમુદ્રાઓ
દીનોના ઉદ્ધાર માટે તેમણે ખરી હતી.

આમ સિદ્ધરાજ અને કુમારપાળે—ગુજરાતના
એ મહાન રાજવીચોની સહાયથી હેમચંદ્રાચાર્યેં
ગુજરાતને તેના અણુમેલ સંસ્કારવારસાથી સમૃદ્ધ
કરી આપ્યેં. સાહિત્યથી સમૃદ્ધ, સંસ્કારથી સુશો-
લિત અને અહિંસાથી આલોકિત ગુજરાતું નિર્માણું

કરવામાં હેમચંદ્રસૂરિજીને અદ્વિતીય ક્ષાળો છે,
એમ નિઃશાંક કહેવું જેઠું.

ગુજરાતમાં સમન્વયિતા છે અને વિધાન્યાસં-
ગાની વિશિષ્ટતા છે, સહિષ્ણુતા અને સમભાવના
છે, ઉદ્ઘાર-મતવાદિતા છે, તેમાં હેમચંદ્રાચાર્ય, જૈન
ધર્મનો સ્થાનવાદ અને ઐ રાજવીચો : સિદ્ધરાજ
અને કુમારપાળ-આ ચતુઃસંગમ મહાન કારણ છે.

[<]

નમ્રતાના ઉત્તુંગ શિખર પર

જ્ઞાનની સિદ્ધિ છતાં નમ્રતાની ટોચે
હેમચન્દ્રસૂરિ

‘લઘુતામે’ પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ ફર-’
જે માણુસો પોતાની જતને પ્રભુ (સમર્થ-મહાન) માની કે છે.... ખરેખર તેઓ પ્રભુતાથી પરમ ફર
હોય છે. સાચી પ્રભુતા તો પોતાની અજ્ઞતાના સ્વી-
કારમાં છે-ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કાર તો
પાયાના ગુણુ રૂપે સ્વીકૃત છે. સાધુપુરુષોમાં આ
ગુણુ તો શિરમોરસ્થાને હોય જ ને !

જ્ઞાનની સિદ્ધિની સાથે સાથે નમ્રતા ભળે
તો એનો મહિમા અપરંપાર બની જાય છે. શાસ્ત્રજ્ઞો
અને શાસ્ત્ર-સિદ્ધાંતસંરક્ષકોના મુગજળાસી આ
ચુગમાં આચારોમાં આજે વિનમ્રતા હોયલી બની

ગઈ છે ત્યારે, પોતાની અજ્ઞતા અને અદ્વિતીયતાને સ્વીકાર કરનારા સૂરીશ્વર હેમચંદ્રના આ ગુણુ પ્રત્યે સવિશેષ સમાદર થયા વગર રહેતો નથી.

જે સમયે તત્કાલીન વિદ્ધાનો અને પંડિતો જેમને ‘કલિકાલસર્વજ્ઞ’ કહીને નવાજ્તા હતા, ત્યારે હેમચંદ્રસૂરિ પોતાની જાત માટે ‘વીતરાગ સ્તોત્રમાં’ ‘પશુથી પણ હું પશુ’! એવા શાબ્દો આલેખે છે.

“ક્વાડહં પશોરપિ પશુર્વીતરાગસ્તવः ક્વ ચ ।”

અર્થાતુ—‘કયાં હું પશુથી પણ પશુ ! અને કયાં વીતરાગપ્રભુની સ્તવના ।’

માત્ર વીતરાગપ્રભુની સામે જ પોતાની અદ્વિતીયતા અંગે સૂરીશ્વર સલાન હતા, એમ નહિ.... પોતાનાથી પૂર્વકાલીન પૂજય પુરુષો પ્રત્યે પણ તેઓ અતિ વિનાન્દુ હતા. તે પૂર્વપુરુષોની ઉત્તમતા જહેર કરતાં અને જહેરમાં તેમની પ્રશંસા કરતા તેમણે સંકોચ પણ અનુભવ્યો નથી.

પોતે સમર્થ કવિ હોવા છતાં પોતાના પુરોગામી મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિનું તેમણે ‘સર્વોત્તમકવિ’ જહેર કરતાં કહ્યું છે ‘અનુસિદ્ધસેન’ કવય:’ અર્થાતુ ‘બધા કવિઓ સિદ્ધસેનસૂરિની પાછળ છે.’

સિદ્ધસેનસૂરિની સ્તુતિઓની પ્રશંસા કરતાં

અને પોતાની જતને તેમની તુલનામાં અશિક્ષિત (અભણુ) કહેતાં પણ તેઓ ખમચાયા નથી.

‘વ સિદ્ધસેનસ્તુતયો મહાર્થા ।

અશિક્ષિતાલાપકલા વ ચેષા ॥’

અર્થાત् - ‘કૃયાં સિદ્ધસેનદિવાકરસૂરિજીની મહાન અર્થવાળી ગંભીર સ્તુતિએ ! અને કૃયાં મારી - આ અભણુ માણુસની-આલાપકલા જેવી સ્તુતિ ! ! ’

કવિ ધનપાળની સ્તુતિએ ગાતા સૂરિદેવ
‘કુમારપાંદ્ર પ્રભંધ’ માં હેમચંદ્રસૂરિજીની વિનભ્રતાનો એક પ્રસંગ આ પ્રમાણે છે.

એક સમયે હેમચંદ્રાચાર્યજી કુમારપાળની સાથે શત્રુંજ્ય તીર્થે ગયા હતા. ત્યારે ત્યાં યુગા-દિહેવ ઋષલદેવ લગવંતની સમક્ષ કવિવર્યશ્રી ધનપાલ પંડિતે રચેલી ‘ઋષલ પંચાશિકા’ ની ગાથા-એ ઓલવા દ્વારા તેમણે પ્રભુની સ્તવના કરી.

અવસર જેઈને કુમારપાળે પૂછ્યું : ‘શુરુદેવ ! આપ તો સ્વયં મહાન સ્તુતિકાર અને શિલોક્કાર છો. અનેક અંશોના રચયિતા એવા આપ શીધ્રકવિ પણ છો. તો પછી આપ આપની સ્વરચિત સ્તુતિએ પરમાત્મા સમક્ષ ન ઓલતાં, ધનપાળ કવિની સ્તુતિએ શા માટે ઓદ્યા ? ’

ત્યારે મૂર્ધન્યકક્ષાના મહામનીષ આચાર્યશ્રી ઓદ્યા : ‘ધનપાળ કવિએ જે સ્તુતિએ રચી છે.... તે એવી ઉત્કૃષ્ટ અને સફલક્તિ ગર્ભિંત છે કે તેવી

ઉત્તમ સ્તુતિએ મારી પણ નથી.' હેમચન્-દ્રાચાર્ય-
જીની આ પરમ વિનાગ્રતા, આપણા જેવા મિથ્યા-
લિમાનીએ માટે મહામૂલા ઓધપાડ જેવી છે.

હેમચન્-દ્રસૂરિજીની વિનાગ્રતાના અનેક ઉદાહરણો।
ટાંકી શકાય તેમ છે. પોતે રચેલી 'સિદ્ધહેમશબ્દા-
નુશાસન' ની બૃહ્દફટીકામાં તેમણે કહ્યું છે: 'ઉત્કૃષ્ટ
મહાકવિ તો સિદ્ધસેનસૂરિજી હતા. ઉત્કૃષ્ટ મહા-
તાકિક તો મહાલવાદિજ હતા, શ્રેષ્ઠ સંઘર્ષકાર
તો ઉમાસ્વાતિજ અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાનકાર તો
જિનતદ્રગણી ક્ષમાક્રમણું હતા.'

આ રીતે અન્ય મહાન વિદ્ધાનો અને પૂર્વા-
ચાર્યો પ્રત્યે પોતાનો ગુણાનુરાગ તેમણે ખુલાંદ કંઠે
ગાયો છે.

સદા સંધર્ષ નિવારણના પક્ષકાર સૂરિદેવ

'ઉપશમલકાદ વિદ્યાબીજાત' — 'વિદ્યાભીજનુ'
ને કોઈ કુળ હોય તો તે ઉપશમદ્દિપ કુળ છે.' આ
વાતને હેમચન્-દ્રાચાર્યજીએ પોતાના જીવનમાં ઉતારી
હતી. તેએ રૂપણે, ધર્મનું કુળ ઉપશમલાવની
પ્રાપ્તિ છે, તેમ માનતા હતા. ધાર્મિકપુરુષોમાં વ્રત-
સ્થેા સાધુ-અગ્વંતો મૂર્ધન્ય સ્થાને છે. તેથી વ્રત-
સ્થ સુનિએનું પરમ અને પ્રથમ કર્તાંય છે કે તેમણે
વિરોધનો ઉપશમ અવશ્ય કરવો જેઠાંએ. 'આદો
ધર્મો વ્રતસ્થાનાં, વિરોધોપશમઃ સ્તલુ ।'

અને તેમની આ વિચારધારાની સંપુર્ણિતમાં એક સચોટ પ્રસંગ પણ ઉપલબ્ધ થાય છે, ‘કુમાર-પાળચરિત્રસંશોષ’ [લેખક : શ્રીસોમતિલકસૂરિજી : પૃષ્ઠ ૩૧-શલોક-૬૭૪ થી ૬૮૩]માં આ પ્રસંગ વર્ણવાયો છે.

વરોથી – કલિકાચાર્યજી મહારાજાએ ભાઈરવા સુધ ચોથની સંવત્સરી કરી તે પહેલાં – ભાઈરવા સુધ પાંચમની જ સંવત્સરી હતી. અને અષાડ સુધ પૂનમના દિવસે ચૌમાસી – શરૂઆત થતી. પરંતુ કલિકાચાર્યજીએ અસુક વિશિષ્ટ કારણોસર ભાઈરવા સુધ ચોથની સંવત્સરી અને અષાડ સુધ ચૌદશની ચૌમાસી શરૂ કરી.

પ્રસંગ એવો બન્યો કે કેટલાક પ્રાક્ષણોએ રાજને (કુમારપાળને) ચડાવ્યા કે : ‘તમારા જૈનો-માં પણ પૂનમ-ચૌદશના મતાન્તર છે ?’ આ વાત જ્યારે રાજાએ હેમચંદ્રાચાર્યજીને કહી ત્યારે સૂર્ય-હેવે કહ્યું : ‘જલ અને જલધરની જેમ આ લેદ કેાઈ ખડુ મહત્વનો નથી. તળાવ, નહી વગેરે લિન્ન લિન્ન ભૂમિમાં હોવા છતાં તેમાં કાંઈક અલેદ તો છે જ. એ જ રીતે પૂનમ-ચૌદશના લેદ હોવા છતાં સહુના જિનપતિ તો એક જ છે. પૂનમ-ચૌદશના લેદ તો પાછળથી થયા છે, તે વિદ્ધાને ચિંતા કરવા લાયક નથી.’

ત્યાર બાદ રાજના મનની કલૂષિતતા દુર કરવા માટે સૂરિદેવે પૂનમીયા ગરછના બધા મુનિ-પુંગવેને તેડાવ્યા. અને તેમણે કહ્યું : ‘તમે બધા ને સાધુએ કરેલી પ્રતિષ્ઠાને માન્ય કરતા હો, તો અમે પણ આગમમાં કહેલી વિધિ મુજબ પૂનમની પણખી સ્વીકારીએ.’

આ વાતનો ત્યારે તો સ્વીકાર કરીને પૂનમીયા ગરછવાળા સાધુએ વિદ્યાય થયા. પરંતુ પાછળથી મૂહલ્લાવાળી એક વૃદ્ધ સાધીએ સુમતિસૂરિજીને કહ્યું : ‘શ્રાવકેની પ્રતિષ્ઠાના પક્ષને છોડી હેતાં; અને સિદ્ધાંત અને ગુરુના તિરસ્કારનું’ પાપ કરતાં તેમને શરમ ના આવી ? ’

ચંડિકા જેવી તે સાધીના ઠપકાથી સુમતિસૂરિજી પ્રહત થઈ ગયા. અને તેમણે હેમચ-દ્રાચાર્ય-જીને જઈને કહી દીધું કે : ‘અત્યારે જેમ ચાલે છે તેમજ ચાલવા હો.’ સૂરિધરે જ્યારે રાજને આ વાત કરી ત્યારે રાજએ સુમતિસૂરિજીને અન્યત્ર ચાહ્યા જવા જણાવ્યું. તેથી તંયે શુજરાત છોડીને કેંકણું ચાહ્યા ગયા. કેટલાક સાધુએ હેમચ-દ્રાચાર્યની નિશ્ચામાં રહ્યા અને સાચા સાધુત્વથી શોક્યા.

‘સમચ સંધના સંધર્ણના નિવારણ માટે અને શ્રીસંધની સમાધિની સુરક્ષા કાને આને સંવત્સરી ચોથની છે તે પાંચમની કેમ ના કરી શકાય ? ’ આ

સવાલ આજના કહેવાતા અવિચિઠન સામાચારી
સંરક્ષકેને પૃથ્વે જોઈએ.

કલિકાલસર્વજ્ઞ સૂરિહેવને આ બધી સામાચારી
એનો અને શાખાના સૈદ્ધાંતિક પાઠોનો ખ્યાલ નહિ
હોય શું ? હક્કિકત તો એ છે કે કલિકાલસર્વજ્ઞશ્રીજી
શ્રીસંધની એકતા અને સંધર્ષશાંતિને અતિશય
મહત્વની બાખત ગણુત્તા હતા.

પુત્રમૃત્યુના શોકના નિવારણાથે માત્ર એક
રાજાની વિનંતીથી જે કાલકસૂરિજી મહારાજા
પરાપૂર્વથી ચાલી આવતી પાંચમને ચોથમાં ફેરવી
શકે, તો સમગ્ર ભારતના સકળ શ્રી સંધની ઉપશ-
મલાવપ્રાપ્તિ કાને પાંચમની સંવત્સરીનો માર્ગ
વર્તમાન આચાર્યો શા માટે ન સ્વીકારી શકે તે
આજનો યક્ષપત્ર છે.

[૯]

સુવિશાલ સાહિત્યના સર્જક

અલોકિક અને દિવ્ય પ્રતિલાના સ્વામી હેમચન્દ્ર-
સૂરિવરે કે વિપુલ અને વિશાળ સાહિત્યની રચના-
ઓની જૈનસંધને અને સમય વિક્ષણજગતને લેટ
ધરી છે તેનો વિચાર કરતાં લલલલા વિક્ષાનતું
થિએ તેમના ચરણે ઝુકી ગયા વગર રહે જ નહિ.
તે સમયે ભારતમાં જેડાયેલી સમય વિધાઓમાં
હેમચન્દ્રસૂરિજીએ નવીન અને પ્રમાણુભૂત રચનાઓ
આપી. તે તે વિષયના ઉત્તમ અને અફ્લભૂત પાઠ્ય-
અન્થો તેમણે સર્જયા. આ હકીકતને સંક્ષિપ્તમાં
કહેવા માટે, હેમચન્દ્રસૂરિજીના લઘુવયસ્ક સમકા-
લીન અને ‘કુમારપાલ પ્રતિષોધ’ના કર્તાં શ્રી સેમ-
પ્રલસૂરિજીનો આ શ્રોક જાણવા જેવો છે :

“કલૃપ્તં વ્યાકરણં નવં વિરचિતં, છન્દો નવં દૃવ્યાશ્રયા-
લઙ્ઘારો પ્રથિતો નવો પ્રકટિતં શ્રીયોગજાસ્ત્રં નવમ् ।

તર્ક: સંજનિતો નવો જિનવરાદોનાં ચરિત્રાં નવમ્ભ, બદ્ધ યેન ન કેન કેન વિધિના મોહ: કૃત: દૂરતઃ ॥'

અર્થાત्—‘હેમણે નવું વ્યાકરણ (સિદ્ધહેમશાખાનુશાસન) રચ્યું. નવું છાનુશાસ્ત્ર (છાનુશાસન) રચ્યું. નવા ફંદ્યાશ્રય (સંસ્કૃત ‘ફંદ્યાશ્રય’ અને પ્રાકૃત ‘ફંદ્યાશ્રય’—કુમારપાલ ચરિત) અને અલંકારશાસ્ત્ર (કાંદ્યાનુશાસન) પ્રસિદ્ધ કર્યો. નવું યોગશાસ્ત્ર પ્રકટ કર્યું. નવું તર્કશાસ્ત્ર (પ્રમાણુમીમાંસા) રચ્યું. તથા જિનેશ્વર આદિઓનું નવું ચરિત્ર (ત્રિપણીશલાકા પુરુષ ચરિત્ર અને પરિશિષ્ટ પવ્) નિખદ્ધ કર્યું. તે હેમચન્દ્રાચાર્યે (આપણું) અજ્ઞાન કદ્ય કદ્ય રીતે ફૂર નથી કર્યું ॥ અર્થાત् સર્વ રીતે ફૂર કર્યું છે.’’

હેમચન્દ્રાચાર્યના વિવિધ સાહિત્યનો।

૩. કુ પરિચય

હેમચન્દ્રાચાર્યનું ચાર સમર્થ શબ્દકોશો રચી આપ્યાં (૧) અલિધાન ચિંતામણી. ■ (૨૬૦૫: ૧૫૪૧) (૨) અનેકાર્થ સંશેષ (૨૬૦૫: ૧૮૨૬) (૩) દેશી નામમાલા (૨૬૦૫: ૭૮૩) અને (૪) નિધંદુસંશેષ (૨૬૦૫: ૩૬૬)

‘કાંદ્યાનુશાસન’ એ અલંકારશાસ્ત્રનો અન્ય

■ ઈ. સ. ૧૮૦૮માં ‘કોલખુક’ નામના એક અંગ્રેજો મૌની પ્રથમ કલકત્તાથી ‘અલિધાન’ પ્રગટ કર્યું હતું.

હેમચન્દ્રસૂરિલુએ રહ્યો છે. તેના ઉપર ‘અલંકાર-ચૂડામણી’ નામની નાની અને ‘વિવેક’ નામની મેટી ટીકા તેમણે રહ્યી છે.

‘છંદોનુશાસન’ કુલ ૭૬૪ સૂત્રોમાં રચાયેલો અન્થ છે. ચારસોથી વધુ છંદો અને તેના પ્રયોગો સમબળવનારો આ અન્થ અસાધારણ શાસ્ત્રઅન્થ છે.

‘પ્રમાણુમીમાંસા’ એ છે પ્રમાણુશાસ્ત્ર વિષેનો અન્થ ! જૈનસૂત્ર-સિદ્ધાંતો અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષ્યમાં રાખીને લખાયેલો આ અન્થ જૈનન્યાયના અભ્યાસીઓ માટે આરીવાંદરૂપ છે.

‘ફ્લ્યાશ્રય-મહાકાવ્ય’ આ મહાકાવ્યમાં આચાર્યશ્રીએ ‘સિદ્ધહેમ’ વ્યાકરણુના ઉદ્ઘાઃરણો આપવા માટે સોલંકી વંશની કથાવસ્તુતું નિરૂપણુ કર્યું છે. આ મહાકાવ્ય સંસ્કૃત અને પ્રાકૃત બન્ને ભાષા-માં છે.

મૂળરાજ સોલંકીથી સિદ્ધરાજ અને કુમારપાણના સમય સુધીનો સોલંકી-ઈતિહાસ એક બાજુ ચાલે છે. તો બીજુ બાજુ ‘સિદ્ધહેમ’ વ્યાકરણુમાં ટાંકેલા ઉદ્ઘાઃરણોની હારમાળા ચાલે છે. આમ એ બાબતો સાથે સાથે ચાલવાથી તેનું નામ ‘ફ્લ્યાશ્રય (એ આશ્રયવાળું) મહાકાવ્ય’ પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની અસ્તિમતાનો અને સંસ્કારિતાનો આદ્વારક પરિચય આપનારું આ ખરેખર તેજસ્વી મહાકાવ્ય છે.

‘ત્રિપણિશલાકાપુરુષ ચરિત્ર’ એ હેમચંદ્રાચાર્યનો છત્તીસ હજાર શલોકમાં આવેખાયેલો અદ્રિતીય અન્થ છે. જે મહાન પુરુષો અવશ્ય મોક્ષ પામી જવાના છે એવા મહાપુરુષોને ‘શલાકાપુરુષ’ કહેવાય છે. ઋષલહેવથી મહાવીરસ્વામી સુધીના ચોવીશ તીર્થાંકરો, લરત, સગર વગેરે બાર ચડુવતીંએા, રામ, ખલરામ વગેરે નવ ખળહેવો, લક્ષ્મણુ, કૃષ્ણ વગેરે નવ વાસુદેવો, રાવણુ, જરાસંધ વગેરે નવ પ્રતિવાસુદેવો—આમ કુલ ત્રેસઠ શલાકા પુરુષોના ચરિત્રો, રાજ કુમારપાળની વિનંતીથી લખાયેલા આ મહાન અન્થમાં, વણુંવાયાં છે.

શ્રી મોતીચંદ ગિરધર કાપડિયાએ [‘હેમચંદ્રાચાર્યની કૃતિઓ’—‘પ્રસ્થાન’ વૈશાખ-૧૬૬૫. પૃ. ૫૪] લખ્યું છે કે, ‘આ મહાઅન્થ જે સાધંત વાંચવામાં આવે તો સંસ્કૃતભાષાના આખા કોશનો અલ્યાસ થઈ જય તેવી એની રચયિતાએ ગોઠવણું કરી છે.’—અને આજે પણ અલ્યાસી જૈનમુનિઓ આ અન્થનું સંપૂર્ણું પણે અધ્યયન—મનન કરે છે.

‘પરિશિષ્ટ પવ’ એ હેમચંદ્રાચાર્યનો અંતિમ અન્થ ગણ્યાય છે. આ અન્થમાં લગ્નવાન મહાવીરહેવના નિર્વાણુ પછીના, તેમની પદૃપરંપરામાં થયેલા સુધર્માસ્વામી, જંખૂસ્વામી, લદ્રભાહુસ્વામી, આચર્ણકાશતસૂરિ, વજસ્વામી ઈત્યાદિ મહાન પુરુષોનાં જીવનચરિત્રો છે. ઉપરાંત આ અન્થમાં શ્રેષ્ઠિક, સં-

પ્રતિ, ચન્દ્રગુપ્ત વગેરે રાજાનો ઇતિહાસ પણ સુંદર પદ્ધરચનામાં સાંકળી લેવામાં આવ્યો છે. આ અન્થમાં અનુષ્ટુપ છંદમાં કુલ ઉઘ્યો ૩૬૫૦ શલોકો રચાયાં છે.

યોગશાસ્ત્રની રચના

‘યોગશાસ્ત્ર’ એ ખાસ રાજ કુમારપાળની વિનાનીથી અને તેના ઉપર સવિશેષ ઉપકાર કરવા માટે હેમચન્દ્રાચાર્યે લખેલો અન્થ છે. બાર પ્રકાશમાં અને કુલ એક હજારથી વધુ શલોકોમાં નિખલ આ અપૂર્વ અન્થરતનમાં—મહાવતો, આણુવતો, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો, સમ્યકૃત્વના લક્ષણો, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, સંસારનું સ્વરૂપ, કૃષાચ્ચો, હિન્દુયસંયમ, બારે ભાવનાઓ, ગૈત્રી આદિ ચાર ભાવનાઓ, પરકાયપ્રવેશાદિ સિદ્ધિઓ, પ્રાણ્યાયામ, ધ્યાન, ધારણા વગેરે વિષયોની વિશાઢ વિચારણા કરવામાં આવી છે.

વામરાશિ નામનો એક ખાસખુલ્લ પંડિત, હેમચન્દ્રસૂર્યિલુ પ્રત્યેની ઈધર્યાના કારણે તેમની ઘૂંઘ નિંદા કરતો હતો. પરંતુ જ્યારે તેણે કેટલાક તપ્સ્વીઓના સુખેથી ‘યોગશાસ્ત્ર’ ના શલોકોનો પાઠ સાંલજ્યો, ત્યારે તે એટલો પ્રલાવિત થઈ ગયો કે તે બોલી ઉઠ્યો : “જે જરાધારી યોગીઓના કંઠમાંથી હેમચન્દ્રાચાર્ય માટે જેર નીકળતું, તેમના કંઠમાંથી હવે યોગશાસ્ત્ર ઇપી અમૃત બહાર આવી રહ્યું છે.”

વામરાશિની સૂરિહેવ પ્રત્યેની નિંદાપ્રવૃત્તિના કારણે કુમારપાળે તેની આજીવિકા બંધ કરી હીથે-લી, પરંતુ ઉપર્યુક્ત પ્રસંગ બાદ, હેમચંડ્રાચાર્ય-જીની સૂચનાથી કુમારપાળે તેની આજીવિકા કરી ચાહુ કરી આપી....અને બમણી કરી આપી. આ પ્રસંગ ‘પ્રભ’ધયિંતામણી’ માં શ્રી મેરુતુંગાચાર્યે આલેખયો છે.

એ બત્તીશીઓ અને અન્ય સ્તોત્રો

શ્રી સિદ્ધસેનસૂરિજીની રચના—શૈલીથી આલે-ખાયેલી હેમચંડ્રાચાર્યજીની એ સૌથી લઘુ કૃતિએ-‘અયોગવ્યવરછેદક્ષાત્રિંશિકા’ અને ‘અન્યયોગવ્યવ-રછેદ ક્ષાત્રિંશિકા’ આ બત્તીશ બત્તીશ ઠિકોના એ સ્તોત્રો છે.

આ બને સ્તોત્રોમાં પ્રભુશ્રી મહાવીરહેવની સ્તવના કરવા પૂર્વક ન્યાય, વૈશેષિક, વैહિક આદિ દર્શનોની સચ્ચોટ સમીક્ષા કરીને જૈન દર્શનના સ્થાનવાદ (અનેકાંતવાદ)ની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં આવી છે. વીતરાગ સવંજ પ્રણીત હોવાથી જૈન દર્શનથી શ્રેષ્ઠ ખીજુ’ કોઈ દર્શન નથી. અને અનેકાંતવાદ સિવાય બીજે કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી એ વાત સૂરિહેવે સાખિત કરી છે.

‘અન્યયોગવ્યવરછેદ ક્ષાત્રિંશિકા’ ઉપર આ. શ્રી મલ્લિષેષ્ણસૂરિજીએ ‘સ્થાનવાદમંજરી’ નામની

જૈન ન્યાયને રજૂ કરતી મહાન ટીકા રચી છે. અને એ ટીકા ઉપર ન્યાયવિશારદ પુ. મહોપાધ્યાય શ્રી યશો-વિજયજી મહારાજે ‘સ્યાદ્વાદમંજુષા’ નામની ટીકા રચી હતી. જે આજે ઉપલભ્ય નથી. ‘સકલાહોંતું સ્તોત્ર’માં ચોવીશ તીર્થંકરેની સ્તવના છે. કવિ આચાર્યવરના હૃદયમાં ઉછળી રહેલી અરિહંતલક્ષ્ણિના, આ નાના પણ ભાવવાહી સ્તોત્રમાં આપણુંને દર્શાન થાય છે.

‘મહાદેવસ્તોત્ર’ એ અનુભૂપ અને આર્ય છંદમાં લખાયેલું ચુમાળીશ શ્રદ્ધાકનું કાવ્ય છે. મહાદેવનું ખરું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે આ સ્તોત્રમાં વર્ણવાયું છે. હેમચન્દ્રસૂરિજીનો અતિ પ્રસિદ્ધ શ્રદ્ધાક, ‘ભવબોજાંકુર જનના’ આ જ સ્તોત્રનો અંતિમ શ્રદ્ધાક છે.

વીતરાગસ્તોત્રः ધર્શલક્ષ્ણિતનું અનોખું કાવ્ય

‘વીતરાગ સ્તોત્ર’ એ ધર્શલક્ષ્ણિતનું અનોખું અને આહુલાદ્વાર્યી કાવ્ય છે. કુલ ૧૮૮ શ્રદ્ધાકમાં અને ‘વીશ પ્રકાશ’ માં વહેંચાયેલી આ કૃતિ પણ કુમારપાળ રાજ માટે જ ખાસ ર્ચાઈ છે. તે તેના પ્રથમ પ્રકાશના આ શ્રદ્ધાક પરથી જાણી શકાય છે: શ્રીહેમચન્દ્રપ્રભવાદ

વીતરાગસ્તવાદિતः ।

કુમારપાલભૂપાલः પ્રાપ્નોતું ફળ—મિપ્સીતમ् ॥
અથીત् “શ્રી હેમચન્દ્રસૂર દ્વારા જન્મેલા (ર્ચાયેલા)

આ ‘વીતરાગસ્તોત્ર’ ક્ષારા કુમારપાળ ભૂપાળ પોતાના ઇચ્છિત કૃળને પ્રાપ્ત કરો”

‘વીતરાગસ્તોત્ર’ એ જૈન દર્શનની મહત્તમા, વિશિષ્ટતા અને સર્વોત્તમતાને દર્શાવનારું ખરેખર એક દિવ્ય અને મધુરું સ્તોત્ર છે. ‘ચોગશાસ્ત્ર’ના બાર પ્રકાશ અને ‘વીતરાગ સ્તોત્ર’ના બાર પ્રકાશ—કુલ અત્રીશ પ્રકાશોને સુખપાઠ કરીને પ્રતિદિન અત્રીશ દાંતના લાવમંજનરેખે કુમારપાળ રાજ, રોજ તેનો સ્વાધ્યાય કરીને પણી જ, દ્રવ્યમંજન કરતાં અને લોજનાદિ લેતા હતા.

આ ઉપરાંત, ‘અહું-નીતિ’, ‘અહું-નામસમુચ્ચય’, ‘અનેકાર્થ્યશેષ’, ‘પ્રમાણુશાસ્ત્ર’, ‘શેષસ-અહું-નામમાલા’, ‘સપ્તાસ-ધાન મહૂકાવ્ય’ વગેરે અનેક કૃતિઓ કલિકાલસર્વજ્ઞશ્રીએ આવેઓલી છે.

હેમચંદ્રાચાર્યના અન્યો વિષેની કેટલીક વિશેષ માહિતીઓ તરફ સંક્ષિપ્ત દર્શિપાત્ર કરીએ:

- ❖ આચાર્યશ્રી રચિત ‘ઉણ્ણાદિગણુ’ નું સર્વપાઠન ગ્રે. જહેાન કીસ્ટીએ કર્યું. અને પરિશિષ્ટ ટોમસ ઝંચારીએ કર્યું હતું.
- ❖ ‘શ્રી સિદ્ધહેમ-દ્વારકરણુ’ના આડમા અધ્યાય (પ્રાકૃત)ને વ્યવસ્થિતરેખે પ્રકાશમાં લાવનાર ગ્રે. પીશાલ હતા.
- ❖ આચાર્યશ્રીનો સૌથી વધુ શિવોક સંખ્યા પ્રમા-

ણુવાળે અન્થ 'સિદ્ધહેમ' (૮૪,૦૦૦ રૂપાંક) છે.

- ❖ "પ્રાકૃત વ્યાકરણ" ને વિ. સં. ૧૯૨૬માં મરાઠી વિકાનું શ્રી મહાભલકૃષ્ણે પ્રથમ વાર પ્રસિદ્ધ કર્યું હતું.
- ❖ આચાર્ય શ્રીના સૌથી નાના એ અન્થો—'અચોગ વ્યવરંછેદ ક્ષાત્રિંશિકા' અને 'અન્યચોગ વ્યવરંછેદ ક્ષાત્રિંશિકા' છે. જેમાં ૩૨-૩૨ રૂપાંકો જ છે.

મા સરસ્વતીના કૃપાપાત્ર સૂરિદેવ

હેમચન્દ્રાચાર્યજીની અસાધારણ અને ઉચ્ચ-તમ સાહિત્યસર્જકતા જોતાં એમ નિઃસંહેષ માનવું પડે કે તેઓશ્રી મા સરસ્વતીના અસીમ કૃપાપાત્ર વરદ-પુત્ર હતા. મા શારદાની કૃપા વગર આટલું અફલુત અને આટલું વૈવિધ્યપૂર્ણ વિપુલ સાહિત્ય-નિર્માણ શી રીતે સંભાવ્ય બની શકે ? સંસ્કૃત-પ્રાકૃત અને અપદ્રશ ભાષાના મહાન સર્જક, સંચોજક અને સંચાહક આ સૂરિસમાટે જીવનના અંત સુધી સાહિત્યસર્જનમાં પોતાનો કીમતી કાળ વીતાવ્યો હતો.

'સુરથોત્સવ' અને 'કણ્ઠમૃતપ્રથા' વગેરે અંથોના કર્તાં અને ચુસ્ત વૈદિક તથા વસ્તુપાળ-તોજપાળે આખ્ય અને ગિરનાર ઉપર બંધાવેલા જૈન મનિદરોના પ્રશસ્તિ-કાવ્યોના રચયિતા પંડિત સેમે-

શ્વર આચાર્ય જેવા પણ હેમચંદ્રાચાર્યનું સમરણ કરતાં કહે છે—

‘ સદા હવિ વહેમ શ્રીહેમસૂરે: સરસ્વતોમ् ॥ ’

અર્થાત्—“શ્રી હેમસૂરિની સરસ્વતી (વાણીને) ને અમે સહા હૃદયમાં ધારણ કરીએ છીએ.”

હેમચંદ્રાચાર્યજીના ગુરુદેવનું નામ ‘ હેવચંદ્રસૂરિ ’ હતું. તેમ તેમના એક શિષ્ય પણ ‘ હેવચંદ્ર ’ નામના હતા. તેમણે ‘ ચંદ્રલેખાવિજ્ય પ્રકરણું ’ નામનું કુમારપાળના વીરત્વને બિરહાવતું સુનંદર નાટક લખ્યું છે, તેમાં પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યજી માટે ઉત્તમ રાખ્યો વાપરતાં લખ્યું છે કે, ‘ વિદ્યામ્ભોનિધિમન્થ મન્દરગિરિ શ્રીહેમચન્દ્રો ગુરુઃ ॥ ’ અર્થાત् ‘ વિદ્યાઓપી સાગરના મંથનમાં મંદરાચલ (મેરી) પર્વત સમાન ગુરુ શ્રી હેમચંદ્રસૂરિજી છે.’

હેમચંદ્રાચાર્યનું તેજસ્વી શિષ્યવૃન્દ

હેમચંદ્રાચાર્યજીનું શિષ્યમંડળ પણ ખરે-ખર તેજસ્વી હતું. આવા સમર્થ ગુરુનું સાનિધ્ય પામીને શિષ્યે। પણ પ્રખર વિદ્ધાન અને તેજસ્વી બને તેમાં નવાઈ નથી.

હેમચંદ્રાચાર્યજીના હાથે જી ‘આચાર્ય’ પછીની પામનારા ‘રામચંદ્રસૂરિજી’ તેઓ શ્રીના પ્રથમ અને પ્રખર શિષ્ય હતા. તેમણે ‘ રઘુવિલાસ’, ‘નલવિલાસ’ ‘યદુવિલાસ ’ વર્ગે અગિયાર ઉત્તમ નાટકો લખ્યાં

હતા. પોતાના શુકુલાઈ ‘ગુણુચન્દ્રસૂરિલુ’ ની સાથે તેમણે ‘નાટયદર્પણુ’ એ નાટયશાસ્ત્રનો અને ‘કાવ્યાલંકાર’ એ ન્યાયશાસ્ત્રનો અન્ય પણ લખ્યે છે. રામચન્દ્રસૂરિલુ તર્ક, લક્ષ્ણ (વ્યાકરણ) અને સાહિત્યના જાતા-તૈવિધવેદી-હતા. ઉપરાંત સમર્થ કવિવર હતા.

કલિકાલસર્વજ્ઞના અન્ય શિષ્યોમાં – આ. મહે-ન્દ્રસૂરિલુએ ‘અનેકાર્થસંશેહ’ ઉપર ટીકા લખી છે. જેનું નામ ‘અનેકાર્થ કૈરવાકર કૌમુદી’ છે. વર્ધમાનગણિએ રામચન્દ્રસૂરિકૃત ‘કુમારવિહાર-પ્રશસ્તિ’ કાવ્ય ઉપર ટીકા લખીને તેના ૧૧૬ અથ્ કરી ખતાવ્યા છે. બાલચન્દ્રસૂરિ નામના થીજા એક શિષ્યે ‘સ્નાતસ્યા’ નામની સુપ્રસિદ્ધ કૃતિની રચના કરી હતી. જે કે આ શિષ્ય ઉચ્છુંખલ અને ઉદ્ઘત હોવાથી તેને ‘આચાર્યપદ’ આપવાની હેમચન્દ્રસૂરિએ ના પાડી હતી. છતાં તેણે સૂરિહેવના કાળધમ્ બાદ હું રાજ અજ્યપાળની સહાયથી પરાણે ‘આચાર્યપદ’ લઈ લીધું હતું.

ઉદ્યચન્દ્રલુ મહાન વૈયાકરણી હતા. વર્ધમાનગણિ અને હેવચન્દ્રમુનિ (ચન્દ્રલેખાવિજયપ્રકરણના કર્તા) વગેરે સમર્થ વિદ્ધાન સાધુઓ સૂરિહેવશ્રીના શિષ્યો હતા.

કુમવાર મુખ્ય શિષ્યોના નામ આ પ્રમાણે છે.
 (૧) આ. શ્રી રામચન્દ્રસૂરિલુ (૨) આ. શ્રી ગુણ-

ચન્દ્રસૂરિજી (૩) આ. શ્રી યશશ્વર-દ્રસૂરિજી (૪)
 આ. શ્રીભાતચન્દ્રસૂરિજી (૫) આ. શ્રીઉદ્યચન્દ્ર-
 સૂરિજી (૬) આ. શ્રી મહેન્દ્રસૂરિજી (૭) શ્રી
 વર્ધમાન ગણે (૮) દેવચન્દ્રમુનિ. આ બધા શિષ્યો
 પરમ વિક્રાન અને બહુશુત હતા.

હેમચન્દ્રાચાર્યજીના ચાહક અને ભક્તવર્ગમાંના
 મુખ્ય, મહારાજ સંદુરાજ જયસિંહ, પરમાર્થત
 રાજ કુમારપાણ, મહામંત્રી ઉદ્યન, રાજપિતામહ
 આપ્રલટ, દંડનાયક વાળટ, રાજધરટ ચાહડ, તથા
 સોલાક, શ્રીપાણ, આમિગ, અર્ણોરાજ, ઉત્સાહ
 વગેરે રાજપુરુષો હતા. ધનદ શેઠ વગેરે કરોડપતિ
 શ્રાવકો હતા. આચાર્ય હેમચન્દ્રસૂરિના સમકાળીન
 આચાર્યોના નામ આ પ્રમાણે છે : શ્રીસોમપ્રલ-
 સૂરિ, મલધારી શ્રીહેમચન્દ્રસૂરિ, શ્રીમલયગ્રિસૂરિ,
 વાઢી દેવસૂરિ, ઈત્યાદ મહાન જૈનાચાર્યો.

[૧૦]

મુખ્યાત્મા પ્રતિ મંગલ-પ્રયાણ

સૂરિદેવે કરેલી સ્વમૃત્યુ-આગાહી

જીવનની પળેપળનો સુનદર અને સર્જણ સર્કુ-
પચોગ કરીને સંસારને ધર્મસંસ્કારનો સહૃપદેશ
અપ્નારા અને સાડા ત્રણ કરોડ રૂલોક પ્રમાણુ
અફલુત સાહિત્ય સર્જન કરનારા આ સૂરીધર
ચોર્યાસી વર્ષનું સુધીધ આચુષ્ય લોગવી શક્યા.

પોતાના અંતકાળની (મૃત્યુની) તેઓશ્રીને
પહેલેથી જાણ થઈ ગઈ હતી. ઉત્તમ ચારિયરીલ
ચોગી પુરુષોને માટે આ સિદ્ધિ સ્વાભાવિક હોય
છે, તેમાં કશું જ અસંભવિત નથી. મૃત્યુના છ
મહિના પછેલાં તેમણે પોતાના ગુરુબંધુ શ્રો પ્રધુમન-
સૂરિને આની જાણ પણ કરી દીધી હતી. અને તેનો
શોક ન કરવા જણ્ણાંયું હતું.

અંતિમ ક્ષમાપના : રાજને આશીર્વાસન

હેમચંદ્રાચાર્યે છેલ્લા દિવસોમાં અન્નજળના ત્યાગનું (અનશન) વ્રત અંગીકાર કર્યું હતું. મૃત્યુ સમયે પૂજય આચાર્યશ્રીએ પોતાના મુખ્ય શિષ્યોને, શ્રીસંધને અને રાજ કુમારપાળને પાસે બોલાવ્યા હતા. સહુની સાથે તેમણે ક્ષમાપના કરતા કહ્યું હતું : ક્ષમયામિ સર્વાન् સત્ત્વાન्, સર્વે ક્ષામ્યન્તુ તે મયિ । મૈચ્યસ્તુ તેષુ સર્વેષુ, ત્વદેકશરણસ્ય મે ॥

અર્થાત् – ‘હું સર્વ જીવોને ખમાલું છું. સહું જીવો મારા વિષે ક્ષમા કરો. આપના (પરમાત્માના) એક માત્ર શરણે રહેલા મારે, સર્વ જીવોને વિષે ગૈત્રી-લાવ રહો.’

ગુરુહેવની અંતિમ ક્ષણો જેમ જેમ નજીફીક આવતી ગઈ, તેમ તેમ રાજ કુમારપાળનું ઝૂદ્ય વિષાદમય બની ગયું. એમની આંખોમાં આંસુ ઉમટેલા જેઈને હેમચંદ્રાચાર્યે કહ્યું : ‘રાજન્ ! મૃત્યુનો શોંક શા માટે ? આપણે તો માનવજીવનું સાર્થક્ય કરીને વિદ્યાય લઈએ છીએ. અહીં શોંક ન હોય, આનંદ જ હોય. ‘મરણ મંગલ યસ્ય સફલં તસ્ય જોવનમ्’ — જેનું મરણ મંગલ-રૂપ છે, તેનું જીવન ખરેખર સક્રિય છે... મહાત્માએ તો આવા સક્રિય જીવનને અને સક્રિય મૃત્યુને માણનારા હોય. આ મૃત્યુ તો અમારા માટે મંગલ નહોત્સવરૂપ છે, રાજન્ !’

મુક્તિયાત્રા તરફ મંગલપ્રયાણ

અને.... સહુને ક્ષમાપના અપીને, જિનચર-
ણોમાં સતત વંદના કરીને, વીતરાગ પ્રભુના ધ્યા-
નમાં લીન બનેલા ચોગીથર સૂરીથરહેમચન્દ્ર, પ્રસ-
ન્તાપુર્વક અને સમાધિરસમાં નિમગ્ન બનીને
આ નથર હેઠને તળ ગયા. અદ્ધરનંદ્ર કારા એમનો
આત્મા આ દેહ છોડી ગયો. હજરો નરનારીએ એ
એમના અંતિમ વંદન કર્યો.

ગુજરાતની ધરતીનો એક પરમ તપસ્વી, વિક્રા-
નેના મુગુટમાં ભણ્ય સમાન તેજસ્વી, ગુજરાતની
અસ્તિત્વાનો અનોખો આવિલોવક, ગુજરાભૂમિમાં
સંસ્કારની સમૃદ્ધિનો સર્જક, અહિંસાની અણુમેલ
અહાલેક જગાડનાર એ સમર્થ શક્તિપુંજ સૂરીથર
વિ.સ. ૧૨૨૬ (ઇ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની
જીવનયાત્રા પુર્ણ કરીને મુક્તિયાત્રા તરફ મંગલ
પ્રયાણ કરી ગયો.

હેમચન્દ્રાચાર્ય કાળધર્મ પામ્યા ત્યારે ‘કીર્તિ-
કૌમુદી’ ના રચયિતા શૈવધર્મી સોમેશ્વર પંડિતે
કહ્યું: ‘વૈદુષ્ય વિગતાશ્રય શ્રિતવતિ શ્રીહેમચન્દ્રે
દિવમ् ॥’ ‘અર્થાત્ હેમચન્દ્રસૂરિનું દેવલોક પામતા
વિક્રતા હવે નિરાધાર બની ગઈ.’

જિનથાસનના એ અમર જ્યોતિર્ધરનું ક્ષર-
જીવન ભલે સંકેલાઈ ગયું, પણ તેનું વિપુલ અક્ષ-

રજુવન અધારથિ સુરક્ષિત છે અને સૈકાચો સુધી ચિરંજિવ રહેશે.

ધૂસકે રડતા રાજ કુમારપાળ

સુરિદેવનો જયારે અભિનસંસ્કાર થઈ રહ્યો હતો. ત્યારે, રાજબિં કુમારપાળ પોતાના ગુરુદેવનો હેઠ લડલડ જલતી ચિતામાં વિલીન થઈ રહેલો જોઈને ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા. બાજુમાં જલેલા મંત્રીશરે પૂછ્યું : ‘રાજન્ ! ગુરુદેવની કૃપાથી આપ એટલું અવશ્ય જાણો છો કે ‘જાતસ્ય ધ્રુવં મृત્યુઃ — જે જને છે તે અવશ્ય મરે છે. ગુરુદેવ તો મહાન જીવન જીવી ગયા. અને મંગલ મૃત્યુ સાધી ગયા. આ બધું આપ જાણો છો, છતાં આવું કુદન શા માટે ?’

ત્યારે રાજબિં જોલ્યા : ‘ગુરુદેવ તો અવશ્ય ઉચ્ચ ગતિને પામ્યા છે. પરંતુ મને હેવાન મટાડી ઝિન્સાન બનાવનાર અને અંતે લગવાન વીતરાગનો પરમ શ્રાવક બનાવનાર આ પરમ ગુરુદેવના પેટમાં મારા ધરમાંથી અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું પણ ન ગયું, તેનો મને અફ્સોસ થાય છે.’

‘હું રાજ હતો અને રાજના ધરનું અન્નજળિ સાંધુને ન ખેપે એ શાખનિયમના લીધે જ તો ગુરુદેવના મેંમાં મારું જળ ન ગયું... પણ તેમના ચરણું પ્રક્ષાલનમાં ય તે ન વપરાયું, એનું મને અપાર ફુખ થાય છે.’

‘જે નરકનું’ સીધું ક્ષાર છે તે રાજ્યનો ત્યાગ કરીને હું સામાન્ય નાગરિક કેમ બની ન ગયો ? અરે ! તો તો અવશ્ય ગુરુલક્ષ્મિનો તમામ લાલ મને પ્રાપ્ત થઈ ગયો હોત ! પણ આજે મને ભાન આવ્યું ! મારી બુદ્ધિ આજે ઠેકાણે આવી. હવે પશ્ચાતાપના આ આંસુ સારવા સિવાય મારા નસો-ખમાં બીજું શું રહ્યું છે ? ’

ઉપર્યુક્ત શબ્દોમાં રાજ્યિકુમારપાળની હેમચન્દ્રાચાર્ય પ્રત્યેની, આપણા હુંયાને પણ ગફગદિત કરી મૂકે તેવી, લભ્ય ગુરુલક્ષ્મિના અમૂలાં દર્શાન નથી થતાં શું ?

અભિનિસંસ્કાર સ્થળે ‘હેમખાડ’

સૂરિસાટના પાઠ્ય હેહનો અભિનિસંસ્કાર પાઠથું શહેરમાં જ્યાં કરાયો. હતો, ત્યાં, તે સ્થળે તેઓશ્રીના નશ્ચર હેહની પવિત્ર લસ્મ લેવા માટે ભક્તોનો. એવો જખરદસ્ત ધસારો થયો. કે રાખ તો બધા લઈ ગયા પણ તે ધરતીની ધૂળને પણ પવિત્ર સમજુને દોડો લઈ ગયા. ત્યાં જોડો ખાડો પડી ગયો. આજે પણ એ સ્થળ પાઠથુમાં ‘હેમખાડ’ તરીકે પ્રસિદ્ધ છે.

આચાર્ય શ્રીને અગ્રણીઓની

અંજલિ

જીનમંડન ગણિવરે સંવત ૧૪૬૨માં લખેલા
 ‘કુમારપાળ પ્રભાદ’માં જણાયું છે કે, ‘દેવાયોધિએ
 હેમચ-દ્રાચાર્યના અગાધ જ્ઞાનથી પ્રલાભિત થઈને
 એમને ‘કલિકાલસર્વજ્ઞ’ તરીકે એળખાવ્યા હતા.’

સ્વ. સુનિરાજ શ્રી પુણ્યવિજયજી કહે છે કે,
 ‘દેશ-વિક્રિશનો લાખો જ નહિં, ખલકે કરેઠો કે અખલે
 વધોનો ઈતિહાસ એકઠો કરવામાં આવે તો પણ ભગ-
 વાન હેમચ-દ્રાચાર્ય’ જેવા નિલેંપ, આદર્થાલુલી,
 વિક્ષાન, સાહિત્ય સજ્ઞાંક, રાજનીતિનિપુણ, વ્યવહારજ્ઞ,
 વર્ચસ્વી અને પ્રતિલાધારી પુરુષની જોડ જડવી અતિ
 મુરુકેલ બને અને એજ કારણુસર ભગવાન શ્રી હેમચ-
 -દ્રાચાર્ય માટે ‘કલિકાલસર્વજ્ઞ’નું જે બિરુદ્ધ યોજ-
 વામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી.’

૫. બેચરદાસ દોશી લખે છે કે.... ‘વ્યાકરણ,
 છંદ, અદ્યાત્રાર, વૈઘક, ધર્મશાસ્ત્ર, રાજધર્મ, નીતિ-
 ધર્મ, ચુષ્ણશાસ્ત્ર, સમાજવ્યવસ્થાશાસ્ત્ર, ઈન્દ્રજ્ઞાનવિદ્યા,
 શિદ્ધપવિદ્યા, વનરપતિવિદ્યા, રત્નવિદ્યા, જ્યોતિષવિદ્યા,

સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુ પરિવર્તનવિદ્યા, ઓર્ગેની ચોસડ કળા અને પુરુષની બહેંતર કળા, રતિશાસ્ત્ર, ચોગવિદ્યા, મન્ત્ર, તન્ત્ર અને યન્ત્ર વગેરે અનેક વિદ્યાઓના તેઓ (હેમચન્દ્રાચાર્ય) મહાસાગર હતા.

આવા વિદ્યાઓના મહાસાગર સાધુપુરુષને તે કાળના લોકો કુળિકાળસર્વજ્ઞ' કહે, એ જરાચે વધુ પડતું નથી. આજની ભાષામાં 'જીવંત વિશ્કોષ' અને એ કાળની ભાષામાં 'કલિકાલસર્વજ્ઞ' એ બંને શબ્દો એક જ ભાવના વાચક છે. એમના જેવા કલિકાલસર્વજ્ઞને લીધે તે વખતે ગુજરાતનું ગૌરવ હતું, તેમ આજે પણ છે.' ['પરખ' માસિક-વર્ષ : ૨૬; અંક : ૧૧-૧૨, પૃ. ૧૨]

પ્રસિદ્ધ સાક્ષર કનોયાલાલ માણેકલાલ મુનર્શીએ કહ્યું છે કે : 'હેમચન્દ્ર માત્ર 'કલિકાલ-સર્વજ્ઞ' નહોતા, એમણે વિક્રાનો જીત્યા. અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત-સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ મુત્સહી-ઓમાં ઘૂંઘ્યા. અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્વાકંક્ષાથી ઉછળતા ગુજરાતની મહત્તાને શાફદેહ આપ્યો. પણ એ ઉપરાંત એ મહત્તાને કદ્યનાજન્ય અપૂર્વતાનો એમણે એપચડાવ્યો.'

શ્રી લોગીલાલ જ. સાંડેસરા લખે છે કે
 'સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જથ્યાય છે. એ દીપ્તિ જણે કે હેમચન્દ્રના શાંત ગતિભાવાન નયનોમાંથી બહાર પડી રહી છે. એમાં

વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મ સમલાવનું અફલુત એજસ છે. હેમચંદ્રે આપા એક દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાખ્યું.’

શ્રી ડૉ. પીટર્સન કહે છે કે, ‘હેમચંદ્ર એક માટા આચાર્ય હતા. હુનિયા પર અથવા હુનિયામાંની કોઈ પણ ચીજ પર તેમને રતિલાર પણ મોહ હતો નહિ ને હુનિયામાં રહેલો સર્વ મોહ ક્ષણુલંગુર છે, એમ તે જાણુતા હતા.’

શ્રી કે. એમ. પાણ્ણિકકર કહે છે કે ‘શ્રી હેમચંદ્રસૂરિ યોગી હતા. શાખદશાસ્ત્રના નિર્માતા હતા. મહાન કવિ હતા. ધર્મોપદેશક પણ હતા. તેમનું વ્યક્તિત્વ બરેખર અદ્વિતીય છે. ભારતવિષે ને મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષેને જન્મ આપ્યો છે તે પૈકીના એક શ્રીહેમચંદ્રસૂરિ છે.’

ડિ. બ. કૃષ્ણલાલ મેન. અવેરી લખે છે કે ‘એરિસ્ટોટલ અને પ્લેટો પણ હેમચંદ્રસૂરિની કક્ષામાં આવી શકતા નથી. કારણું, હેમચંદ્રાચાર્યની સાહિત્યકૃતિઓનો વિસ્તાર વિષય સંબંધે સર્વઆહી હતો. એરિસ્ટોટલ વગેરેનો તેવો સર્વઆહી ન હતો.’

શ્રી ચતુરભાઈ શાંકરભાઈ પટેલ લખે છે કે, ‘હેમચંદ્ર એટલે સર્વતોમુખી પરિષ્ણુત પ્રરૂપ, રસલરી સર્વોત્કૃષ્ટ સર્જ કરતા. હેમચંદ્ર એટલે વિદ્યાના મહાસાગર, જીવંત જ્ઞાનકોશ. એવા અગાધ શક્તિશાળી

સપૃત માટે ગુજરાત જેટલાં ગવ્ય અને ગૌરવ ધરે એ-
ટલાં એછાં છે. એએ જેનોના જેટલા જ જેનેતરોના,
સમસ્ત ગુજરાતીઓના માનને અને પૂજને પાત્ર છે !'

પ્રાચીન શ્રાવક કુવિ ઋપભદ્રાસે, હેમચન્દ્રા-
ચાય્ માટે બહુ સુનદર કાવ્ય રચ્યું છે :

" સર્ગ મૃત્યુ પાતાલમાં, દેસ વિદેસહમાંહિ:
હેમસૂરિ સરિખા જતિ, જગહ નહીં દીસઈ કયાંહિ;
જે નિકલંક શીલઈ લદો, ગુણ અંગિ કંઈ કેાડિ,
અવર પુરુષ જેયા ધથ્યા, દીસેં અકેકિ ખોડિ."

વિ. ભા. મુસલગાંબકર કહે છે કે, " આ.
હેમચન્દ્ર કે અન્થ નિશ્ચય હી સંસ્કૃત સાહિત્ય કે
અલંકાર હૈ. ઈનકે અન્થ રોચક, મર્મસ્પર્શી એવ
સળવ હૈં. પશ્ચિમકે વિદ્ઘાન ઈન કે સાહિત્ય પર
ઇતને મુંઘ હૈ કિ ઉંહોંને ઈનહેં Ocean of
Knowledge—જ્ઞાનકા મહાસાગર કહા હૈ."

પં. આનંદશાંકર ધ્રુવે લખ્યું છે કે,
" ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો કલિકાલ-
સર્વજ્ઞ હેમચન્દ્રના તેજથી દેહીપ્રયમાન છે. હેમચ-
ન્દ્રાચાય્ ધર્મ અને લાલાનાના પણ બેશક સારા
વિદ્ઘાન હતા, અને તે વિપ્યના ક્ષત્રિંશિકા
વગેરે એમના કેટલાક અન્થો પણ છે. પરંતુ જૈન
વાર્ષિકયને એમની ચિરસ્થાયી સેવા તો આ વિષય
કરતાં લાખા અને સાહિત્યના વિષયમાં વધારે
થઈ છે, એમાં સંશય નહીં."

પંડિતશ્રી શિવદત્ત શર્મા લખે છે કે,
 ‘ ભારત વર્ષના પ્રાચીન વિક્રાનોની ગણુનામાં જૈન
 શૈતાભરાચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ જિંચુ’ સ્થાન
 પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્ય-
 ના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું અને શ્રી
 હર્ષના દરખારમાં બાણુલદ્રનું છે, પ્રાય: તે જ સ્થાન
 ભારમી સહીમાં ચૌલુક્યવંશી ગૂજરાનરેન્દ્ર સિદ્ધરાજ
 જ્યસિંહના ઈતિહાસમાં હેમચંદ્રનું છે.’

શ્રી મોહનલાલ દલીયંદ દેસાઈ કહે છે
 કે, ‘ હેમયુગ એ જૈનશાસન માટે, વારુમય માટે
 અતિ વૈલબ, પ્રતાપ અને વિજ્યથી હેઠીખ્યમાન હતો.
 તેની અસર સમય ગુજરાત પર અનેક રીતે સમર-
 ખુમાં રહે તેવી થઈ છે. હેમચંદ્રના નામ પ્રમાણે
 તેનો ચુગ પણ હેમમય — સુવર્ણમય હતો. અને
 ચિરકાળ સુધી તેનો પ્રલાવ રહેશે.’

વિક્રાન લેખક શ્રી ધૂમકેતુએ લખ્યું છે કે,
 ‘જેમ શિવાળ રામહાસ વિના, વિક્રમ કવિકુલગુરુ
 કાલિદાસ વિના, અને લોજ ધનપાળ વિના શૂન્ય
 લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ, હેમચં-
 દ્રાચાર્ય વિના શૂન્ય લાગે છે.’

‘ ધૂમકેતુ’ એ લખેલા ‘હેમચંદ્રાચાર્ય’ પુસ્ત-
 કના અંતિમ વાક્યના આદેખનપૂર્વેંક આ જીવન-
 ચરિત્રનું આપણે સમાપન કરીએ — ‘ સૂર્યોદય સમયે
 સરસ્વતી નદીના કિનારે જિલેલી એક મહાન શક્તિ,
 પોતાના પ્રકાશથી—તેજથી આખા ગુજરાતને છાઈ
 દેતી કદ્દપો....અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.’

કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યાંજુના
જીવન ઉપર સંક્ષિપ્ત પ્રકાશ ફેંકતું આ પુસ્તક જે
આપને ગમયું હોય તો !

શું આપ આટલું નહિ કરો ?

■ હેમચંદ્રાચાર્યાંજુના સહૃપદેશથી રાજ કુમાર-
પાળે ચૌદ કરેડ સુવણુંમુદ્રાએ। અચીંને હજારેા
સાધ્મિંડેના સમુદ્ધાર કર્યો હતો, તો આપ માત્ર
એક સાધ્મિંક કુદુંબનો સંપૂર્ણ ઉદ્ઘાર કરવા ધનનો
સફળ્યથી નહિ કરો ?

■ હેમચંદ્રાચાર્યાંજુની પ્રેરણા પામીને રાજ
સિંહરાજે ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તો
શું કેંક પ્રાચીન તીર્થભૂમિમાં ચાલી રહેલા જીર્ણો-
દ્ધારમાં આપ પાંચ, ત્રણ કે એક હજાર ઇપિયાતું
દાન નહિ કરો ?

■ માતા પાહિણીએ પોતાના અતિ વહાલા
પુત્ર ચાંગાને જિનશાસનના ચરણે સમર્પિત કરી
દીધો, તો શું આપ આપના બાળકને આપની સાથે
આંગળીએ વળગાડીને રોજ જિનપૂજા નહિ કરાવો ?

■ હેમચંદ્રાચાર્યાંજુએ પોતાની અનંતોપ-
કારિણી માતાને ધર્મધ્વજ (દીક્ષા) અપીંને અદ્ભુત
માતૃભક્તિ અદ્દા કરી, તમે શું તમારા માતા કે
પિતાને પ્રતિદિન પ્રણામ કરવા દ્વારા માતા-પિતા
પ્રત્યેની ભક્તિની અલિવ્યક્તિ નહિ કરો ?

■ રાજ કુમારપાળે ૫૦ વર્ષની ઉંમરે છ હજાર શકોએ પ્રમાણું ‘હેમવ્યાકરણું’ કંડસ્થ કર્યું, તેઓ શું માત્ર બે પ્રતિક્રમણું કે પાંચ પ્રતિક્રમણુના સૂત્રોની જાતે કંડસ્થ કરવા અને તમારા સંતાનોને પણ કરાવવા, કટિબદ્ધ નહિ બનો ?

■ રાજ કુમારપાળે પોતાના અઠાર રાજ્યોમાં મહાન ‘અમારિ પ્રવર્તન’ કરાવ્યું હતું. આપણે શું વરે એક વાર એક મોટા જીવને અલયદાન અપાવવા સંપત્તિનો સફ્યય ન કરી શકીએ શું ?

■ કુમારપાળે પૌષધમાં મંકોડાની રક્ષા ખાતર પોતાના શરીરની ચામડી ઉત્તરડી લીધી. આવા અદ્ભુત પૌષધના આરાધકને આદર્શ બનાવીને આપણે પચ્છાણુના આઠે હિવસનાં-છેવટે એક સંવત્સરીનો - પૌષધ કરવાની પ્રતિજ્ઞા ન લઈ શકીએ શું ?

■ અતિ મહાન અને પરમ વિદ્ધાન હોવા હતાં હેમચંદ્રાચાર્ય પોતાના પૂર્વ-પુરુષોનો સતત વિનય-અહુમાન કરતા અને પોતાની જાતને તુચ્છ લેખતા. આપણે આપણા વડીલો, પૂજ્યો અને આચાર્યોદિ પ્રત્યે વિનય-વિનગ્રતા કેળવવા કટિબદ્ધ નહિ બનીએ શું ?

■ કુમારપાળની સ્તુતિએમાં જિનમત પ્રત્યેનો તેમનો અવિહૃત અનુરાગ અગારાં મારતો જોવા

મળે છે. એ જણયા પછી, આપણું હૈથું પણ આવા જિનવચનરાગ-સુખસાગરમાં જીલવાનું સફલાંગ પામે તેવી પ્રભુને રોજ પ્રાર્થના ન કરી શકીએ શું ?

■ રાજ કુમારપાળ રોજ ‘વીતરાગસ્તોત્ર’ અને ‘ચોગશાસ્ક’ ના કુલ ખત્રીશ પ્રકાશનો સ્વાધ્યાય કરીને જ ‘નવકારશી’ કરતા હતા. તમે કમસે કમ ‘નવકારશી’ તું પરચખખાણું કરવાનો પણ સંકદ્યે નહિ કરો શું ?

■ જે આવા કોઈ સફગુણોની સરિતાને જવનધરતી ઉપર વહેતી નહિ કરીએ, તો હેમચં-દ્રાચાર્યાંજુના તાજેતરમાં પસાર થયેલા નવસોમી જ-મજયંતિના વર્ષમાં માત્ર તેમનું ગુણકીર્તન કરી નાંખ્યાથી કોઈ અર્થ નહિ સરે !

—ધ્રનંજય કૈન

શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિઓ

ગ્રંથ

સિદ્ધહેમલઘુવૃત્તિ	૧૬૦૫
સિદ્ધહેમઘૃહફૃત્તિ	૧૮,૦૦૦
સિદ્ધહેમઘૃહન્યાસ	૮૪,૦૦૦
સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ	૨,૨૦૦
લિદ-ગાનુશાસન	૩,૬૮૪
ઉથ્યાદિગણુ વિવરણુ	૩,૨૫૦
ધાતુ પારાયણુ વિવરણુ	૫,૬૦૦
અભિધાનચિંતામણી	૧૦,૦૦૦
અભિધાન પરિશિષ્ટ	૨૦૪
અનેકાર્થ કોશ	૧,૮૨૮
નિધંદુકોશ	૩૬૬
દેશીનામમાલા	૩,૫૦૦
કાવ્યાનુશાસન	૬,૮૦૦
છંહાનુશાસન	૩,૦૦૦
સંસ્કૃત ક્ષયાશ્રય	૨,૮૨૮
પ્રાકૃત ક્ષયાશ્રય	૧,૫૦૦
પ્રમાણુ મીમાંસા (અપૂર્ણ)	૨,૫૦૦
વેદાંકુશ	૧,૦૦૦
ત્રિષ્ઠિશાલાકાપુરુષચરિત્ર	૩૨,૦૦૦
પરિશિષ્ટ પવ'	૩,૫૦૦
ચેણગશાખ સ્વેચ્છવૃત્તિ સહિત	૧૨,૭૫૦
વીતરાગ સ્તોત્ર	૧૮૮
અન્યચેણગચ્છેદકાત્રિંશિકા (કાવ્ય)	૩૨
અચેણગચ્છેદકાત્રિંશિકા (કાવ્ય)	૩૨
મહાદેવસ્તોત્ર	૪૪

હૈમી -વાણી

આદ્યો ધર્મો વ્રતસ્થાનાં વિરોધોપશમઃ ખલુઃ ॥

વિવાહો શમાવવા તે જ પ્રતધારીએનું પ્રથમ કર્ત્તવ્ય છે.

નહિ સીદન્તિ કુર્વન્તો દેશકાલોચિતાં ક્રિયામ् ॥

દેશ અને કાળને અનુઝૂળ વર્તનારે સીધાવાનું રહે નહિ.

અવર્ણવાદી ન ક્વાપિ રાજાદિષુ વિશેષતઃ ॥

કેઠનો યે અવર્ણવાદ બોલવે નહિ, રાજનો—
રાજપુરુષોનો તો નહીં જ.

ભાવિકાર્યાનુસારેણ વાગુચ્છલતિ જલ્પતામ् ॥

ભાવી જેવું નિર્માણુથયું હોય, તેવી જ વાણી નીકળે.

મહાન્તઃ શક્તિમન્તોऽપિ પ્રથમં સામ કુર્વતે ॥

મહોન શક્તિઃણી હોય તો, પહેલાં શાંતિની જ શોધ કરે છે.

યત્ કુર્વતે મહાન્તો હિ તદાચારાય કલ્પતે ॥

મૈટાએની પ્રત્યેક પ્રવૃત્તિ લોકાચારનો આદર્શ અને છે.

વિના સાવદ્યોગેન ન સ્યાદ ધર્મ-પ્રભાવના ॥

સાવદ્ય-વ્યાપાર પ્રવર્તાંત્ર્યા વિના ધર્મ-પ્રભાવના થાય નહિ.

ઉપાદેયા શાસ્ત્ર-લોક-વ્યવહારાનુગા હિ ગીઃ ॥

શાસ્ત્ર અને લોક-વ્યવહારને અનુસરનારું વચ્ચન આદરણીય છે.

કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી

[ગત વર્ષ (સં. ૨૦૪૫) ઉપર્યુક્ત નામે આ જ બેખુંશીની એક અતિલઘુ-પુસ્તિકા બહાર પડી હતી. તેની સમાવોચના વઢવાણુંથી પ્રકાશિત થતાં ‘કલ્યાણ’ માસિકના વર્ષ –૪૫- અંક- ૧૧. જાન્યુ. ૧૯૮૬ના અંકમાં (સર્જનું સાહિત્ય વિસાગમાં) પ્રગટ થયેલ. જે અહીં પ્રકાશિત છે.]

કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યજી

બેખું: શ્રી ધનંજય જે. જૈન ‘ગ્રેમકેટુ’ સી-૧૦, અરિહંત સો. ૪થે માળે, દામોદરવાડીની સામે, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી-ઈસ્ટ, સુંબાઈ-૧૦૧. ખુક્ખેટ સાઈના ૧૬ પેઝ ધરાવતી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞશ્રીનું જીવન દૂંકમાં છતાં સારાણી-શીલીમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કલિકાલસર્વજ્ઞની વિશિષ્ટ-કૃતિઓની નેંધ, ત્યારે પછીના પૂછોમાં જીવન-પ્રસંગો અને છેલ્દે ‘શું આપ આઠલું નહિ કરો ?’ શીર્ખિક હેઠળ રજુ થયેલું ગ્રેરક-લખાણું...આદિથી નાનકડી આ પુસ્તિકા ખૂબ જ ગ્રેરક બની છે. બેખન શીલી વાચકને આકષી લે એવી છે. મૂલ્ય અપ્રકાશિત છે. કલિકાલસર્વજ્ઞશ્રીના નવમ શતાબ્દી-વર્ષ ટાણે આ પુસ્તિકા જરૂર ગ્રેરક-એધક બની રહેશે.

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

❖ શ્રી ધનંજ્યને. જૈન 'પ્રેમકેતુ' દ્વારા ❖

લિખિત અથવા સંકલિત
સદ્ધોધ - પ્રેરક સુપ્રકાશનો।

■ લિખિત ■

૧. તત્ત્વજ્ઞાન-પ્રવેશિકા.	૮-૦૦
૨. કથા-પ્રવેશિકા	૮-૦૦
૩. સૂત્રાર્થ-પ્રવેશિકા.	૮-૦૦
૪. જીવન ઘડતર-પ્રવેશિકા.	૮-૦૦
૫. જૈન ધર્મકા અણુમેલ તત્ત્વજ્ઞાન (હિન્દી) ૧૬-૦૦	
૬. તીર્થેકર ભગવાન શ્રી મહાવીરહેવ.	૬-૦૦
૭. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય.	અપ્રાય.
૮. ગુજરાતની અર્સિમતાના અનોખા આવિલોવક હેમચન્દ્રાચાર્ય.	૧૦-૦૦

❖ સંકલિત ❖

૯. લાવના ભવોદ્ધિજહૃજ	અપ્રાય
૧૦. ભર્વિયા ! એ ગુણુ જ્ઞાન રસાળ.	અપ્રાય
૧૧. અંધેરેમે એક પ્રકાશ.	૩૦-૦૦
૧૨. શિવમ્ સુનંદરમ્	૭-૦૦
૧૩. પર્વતું ભૂપણુ, જીવનતું આભૂપણુ.	૧૭-૦૦
૧૪. મંગલ મંદિર ઘોલે.	૨૦-૦૦
૧૫. સર્વ મંગલ માંગલ્યમ્	અપ્રાય
૧૬. નિકલા સૂરજ હુઆ સવેરા.	અપ્રાય

સુર ચારા કાટકાલ કુળમાયાળને
અલિનો શાસન પ્રલાંબ કરતું
લોલાજાની જીવાસાન પુ. હેઠળનું થાયું

